

શ્રી યજોપીલાગ

લેન ગંથમાળા

દાદાશાહેબ, ભાવનગર.

ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૩૨

૩૦૦૪૮૪૬

૧૦૫૭.

૬૪	છેદી	જમાંયા	જમાડયા
૬૫	૬	નોગઠી	નોગથી
૬૬	૧૦	જલ	જખ
૬૭	૨૦	અપરે	અપારે
૬૭	૧૦	ઉડેશ	ઉપહેશ
૬૭	૧૬	મજાના	મજાનો
૬૮	૧૮	પધરી	પાધરી
૬૯	<	તરે	તારે
૭૦	૧૪	માગશો	માણુસો
૭૧	૨	ચીહુગનિ	ચીહુગતિ
૭૭	૨૧	ડયા	કૃયો
૭૮	૧૧	દડ	દ્વર
૭૯	૨	દડ	દર
૭૯	૧૫	શ્રત	શ્રુત
૮૪	૧૬	સ્યં	સ્યું
૮૬	૩	સ્નો	નો
૮૭	૪	લોલતા	ઓલતા
૮૭	૧૪	પાવ	પાવે
૯૧	૧૫	આચારંગ	આચારંગ
૯૧	૨૨	ધનસાન	ધમસાન

૬૪	૨૩	દેવ	હેવે
૬૫	૩	વરતાં	વરતારી
૬૫	૯	આંકુશ	અંકુશ
૬૫	૧૯	નેવ	નેવે
૬૮	૧૪	આણ્યા લવ	આણ્યો લૈવે
૧૦૦	૯	વધિરણુ	વહીરણુ
૧૦૦	૧૯	થાંહિળુ	માંહિળુ
૧૦૪	૧૯	લીરાવ	લિરાવે
૧૦૬	૧	પસડા	ઇંશડા
૧૦૬	૨૦	કહુ	કહે
૧૧૦	૧	ફીસ	ફીસે
૧૧૨	૬	ખયાવ	ખયાવે
૧૧૬	૫	લોગવ	લોગવે
૧૨૦	૧૯	લોગવ	લોગવે
૧૨૧	૪	મહાત્રન	મહાત્રત
૧૨૨	૩	લોગવ	લોગવે
„	૧૪	બધારેા	બગારેા
„	૨૩	પુછાવ	પુછાવે
„	૨૩	ગૃહસ્થરી	ગૃહસ્થની
૧૨૩	૬	પુરુષે	પરુષે

૧૨૩	૭	અણુચાર	અણુચાર
૧૨૪	૧૮	એટી	એટી
૧૨૬	૧૯	દીતુરા	દીતુરા
૧૨૭	૧	૧૩૭	૧૨૭
„	૧૩	અપશરા	અપશરા
૧૩૩	છેલ્લી	થપે	થપે
૧૩૬	૧૯	કહેની	કહેવી
૧૪૪	૧	પત્ર	પાત્ર



## હોહરે.

ભવ ભમણુંકો ટાલવા, પંથ શોધે સખ કોય,  
(પણ) હે પ્રભુ તેરાપંથકો, સમજ્યા વીન શું હોય.

વાંચકજ્ઞનને આ ઉપરનો હોહરે વાંચીને સાધારણું  
શીતે જુઝાસા અથવા વિચાર થાય કે “તેરાપંથ” કે જેને  
ખાસ સમજવાની બાધત આ હોહરામાં લખવામાં આવી  
છે, તે શું છે ?

તેરાપંથ એટલે શું તે ખાસ સમજવાની મુળ  
અગત્યતા હોવાથી અતે તેનો ખુલાસો નીચે મુજબ  
આપવામાં આવે છે :

પાંચ મહાવત. પાંચ સમિતિ અને ત્રણું ગુણિત આ  
સેર બોલ શ્રી પ્રભુજીએ પ્રરૂપ્યા છે તે બધા પરિપૂર્ણ  
શીતે પાણે અથવા તેનું મનન કરે તે જ તેરાપંથ. એ  
તેરાપંથ શખ્ફ હિંદુસ્તાની ભાષાનો છે કે જેને ગુજરાતી  
ભાષામાં તેરા એટલે તમારા કહેવાય છે એટલે હે પ્રભુ !  
આ પંથ તમારો છે મારું કાંઈ નથી. આપની આજામાં  
ચાલે તે આપનો પંથ એટલે તે તેરાપંથ. આ શખ્ફ  
નિષ્પક્ષપાતીઓને માટે વિશ્વ ગ્રેમી છે. પ્રભુના નામનો  
પંથ આના ઉપર કોઈનું મારાપણું કે વડાપણું નથી.  
વિશ્વબ્યાપી દ્રવ્યિથી જેતાં તેરાપંથ એટલે તમારો પંથ  
એ નામ જે આપવામાં આવેલ છે તે ચોગ્ય અને બંધ  
બેસ્તું હોવાથી દરેક પ્રકારે બ્યાજણી ગણ્યાય.

ઉપર જણાવેલાં પાંચ મહાત્મત કયાં કયાં! તે કહે છે. ૧ હિંસા ૨ જૂઠ ઉ ચોરી ૪ મૈથુન પ પરિશ્રહ. આ પાંચને ત્યાગ કરવા! તેનું નામ પાંચ મહાત્મત અંગીકાર કરેલાં કહેવાય.

## ગ્રથમ મહાત્મતમાં અહિંસા પરમોધુમ્માંદ્ર.

જૈન સાધુને હિંસાના ત્યાગ સર્વથા પ્રકારે એટલે ત્રણું કરણું અને ત્રણ જોગથી (નવ કોટિઓ) જાવળું સુધીના ત્યાગ હોય છે.

**ગ્રશ્મા:**—નવ કોટિઓ પદ્ધયખાણું કેવી રીતે થાય?

**ઉત્તર:**—પોતે કરે નહિ, બીજ પાસે કરાવે નહિ. કરતાં પ્રત્યે અનુમોદે નહિ એટલે સારું સમજે નહિ. આ ત્રણ નામ કરણું નાં છે.

મન, વચન અને કાયા આ ત્રણનું નામ ચોગ છે. અહેકુ ચોગની ઉપર ત્રણ ત્રણ કરણું ગણવાથી કુદ્દે નવ કોટિઓ પદ્ધયખાણું નીચે સુજાપ થાયઃ—

(૩) છકાય લુવની હિંસા મને કરી કરે નહિ, છ-કાય લુવની હિંસા મને કરી કરાવે નહિ, છ-કાય લુવની હિંસા મને કરી અનુમોદે નહિ-આ ત્રણ કરણું મનનાં થયાં.

(૩) છકાય લુવની હિંસા વચને કરી કરે નહિ. છ-કાય લુવની હિંસા વચને કરી કરાવે નહિ. છ-કાય લુવની હિંસા વચને કરી અનુમોદે નહિ.

આ ત્રણુ કરણુ વચ્ચનાં થયાં.

(૩) છકાય જીવની હિંસા કાયાએ કરી કરે નહિ,  
છકાય જીવની હિંસા કાયાએ કરી કરાવે નહિ,  
છકાય જીવની હિંસા કાયાએ કરી અનુમોદે  
નહિ આત્રણુ કરણુ કાયાનાં થયાં.

મન, વચ્ચન, અને કાયાના મળી નવ ડેટિએ જીવ  
હિંસા કરવાના ત્યાગ થયા.

પ્રશ્નઃ—જીવ કેટલા પ્રકારના છે ?

ઉત્તરઃ—ઇ પ્રકારના છે. તેનાં નામઃ પૃથ્વીકાય,  
અપકાય, તેજિકાય, વાયુકાય. વનસ્પતિકાય,  
અને ત્રસ્કાય.

૧ પ્રશ્નઃ—પૃથ્વીકાય કેને કહેવાય ?

ઉત્તરઃ—જમીન ઐદેકી માટી, હીરા, માણુક, રણ  
ગેર, ગોપીયંદન, સુરદહિંગુત, હડતાલ વગેરેને

૨ પ્રશ્નઃ—અપકાય કેને કહેવાય ?

ઉત્તરઃ—કુવા, તળાવ, વાવ, વગેરનું પાણી

૩ પ્રશ્નઃ—તેજિકાય કેને કહેવાય ?

ઉત્તરઃ—અગ્નિ, ફેવતા વગેરેને.

૪ પ્રશ્નઃ—વાયુકાય કેને કહેવાય ?

ઉત્તરઃ—હવાને.

૫ પ્રશ્નઃ—વનસ્પતિકાય કેને કહેવાય ?

ઉત્તરઃ—આડ, પાન, કુંબ, ફળ, લીલાત્રી વગેરેને.

૬ અશ્રઃ—ત્રસકાય કેને કહેવાય?

૭-તરઃ—કીડા, માખી, મચ્છર; ગાય, સેંસ, પશુ,

પક્ષી, ખી, પુરુષ, વગેરે હાલતા ચાલતા જીવો..

સાધુને છકાય જીવની હિંસા નહિ કરવાનાં પચ્ચયખાણું

સર્વ પ્રકારે છે. જે દિવસથી તેઓએ છકાય જીવની હિંસા

નહિ કરવાનાં પચ્ચયખાણું કર્યાં ત્યારથી તેઓ અભયદાની

થયા એટલે બધા જીવોને પોતાના આત્મવત બેખી તેને

લય ઉપજલવવાના કાર્યથી નિત્રિત થયા, સુયંગડાંગ

સૂક્તમાં પણ કહ્યું છે કે સાધુ છકાયના જીવોના પિતા

સમાન છે અને છકાય પુત્ર સમાન છે.

અશ્રઃ—૫ ચેન્દ્રિય જીવને શાતા થતી હોય અને

એકેન્દ્રિય આદિ અનંત જીવોનું બહિદાન

આપવું પડતું હોય તો તેમાં સાધુ ધર્મ

પુન્ય પ્રરૂપી શકે કે નહિ?

૮-તરઃ—છકાય પૈકીની એકપણ કાયની હિંસા

થતી હોય તે કામમાં સાધુને આહેશ અથવા

ઉપહેશ આપવો કલ્પે જ નહિ કારણું કે તેઓ

છ કાય જીવના પિતા સમાન છે અને તેમને

છકાય પુત્ર સમાન છે અને સાધારણ રીતે

જે પિતા પિતાપણુનો ધર્મ પાળતા હોય તે

મોટા દીકરાના રક્ષણ માટે નાના દીકરાનું

ભક્ષણ થતું હોય તેવા કામમાં ધર્મ પુન્ય છે

એવા પ્રકારનો ઉપહેશ ન જ આપી શકે.  
માટે શુદ્ધ આચાર વિચારવાળા જૈન સાધુને  
એવા પ્રકારનો ઉપહેશ આપવો છાજેજ નહિ.

**અશ્વઃ—**કોઈ એમ કહે કે એકેન્દ્રિયની અપેક્ષાએ  
પંચેન્દ્રિયની પુન્યાધ અનંતગણી વધારે છે  
તો પછી પંચેન્દ્રિયના પોષણ માટે એકેન્દ્રિયની  
હિંસા થાય તે કાર્યમાં સાધુ ધર્મ પ્રરૂપે  
તો શું વાધો ?

**ઉત્તરઃ—**એકેન્દ્રિય અને પંચેન્દ્રિયની પુન્યાધમાં  
અનંત ગણો હેર છે તે તેની ધન્દ્રિયોની  
અપેક્ષા એ છે પરંતુ અસંખ્યાત પ્રહેશિલુષ  
જેવો મનુષ્યમાં છે તેવો જ કીડીમાં છે અને  
તેવો જ એકેન્દ્રિયમાં છે અને વેદના  
પણ જેવી મનુષ્યને મારવાથી થાય છે  
તેવીજ કીડીને થાય છે અને તેવી જ એકે-  
ન્દ્રિય વગેરે જીવોને થાય છે.

વેદના એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય જીવોને સરખી  
થાય છે તે બાબતનો સૂત્રનો દાખલો કહે છે.

શ્રી આચારંગ સૂત્રના પહેલા અધ્યયનના ધીજા  
ઉદ્દેશામાં શ્રી ગોતમસ્વામીએ શ્રીમહાવીર લગવાનને  
પૂછ્યું છે કે હે પ્રભુ ! પૃથ્વીકાય જીવને આંખ, કાન,  
નાંક, મોઢું કંધ નથી તેમજ સુખુઃખનું જ્ઞાન પણ  
નથી ત્યારે એ જીવોને વેદના શ્રી રીતે થતી હશે ?

ભગવાને કહ્યું કે હે ગૌતમ ! આના ઉપર મનુષ્યને દાખલો આપું, તે ધ્યાનપૂર્વક સાંલળ કોઈ એક પુરુષ જન્મયો તે દિવસથી આંધળો હોય બહેરો હોય અને મુંગો હોય, તેને કોઈ બત્રીશ વરસનો ચુવાન પુરુષ પોતાના એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ભાડો લઈને તે પુરુષને હુણે તો તેને વેદના થાય કે નહિ ?” ત્યારે ગૌતમસ્વામી ઓલ્યા “હે ભગવાન ! તેને અત્યંત વેદના થાય, પણ તે બીચારો જન્મનો આંધળો અને મુંગો હોવાથી કાંઈ ઓલી શકે નહિ” ત્યારે ભગવાન ઓલ્યા, “હે ગૌતમ ! તેવી જ રીતે એકેન્દ્રિય જીવને આંખ, કાન, નાક, મોહુ વગેરે કાંઈ નથી. પરન્તુ વેદનાનો જેવી આંખના આંધળા અને મોઢાના મુંગા પંચેન્દ્રીય જીવને થાય છે તેવીજ વેદના પૃથ્વીકાય આહિ એકેન્દ્રિય જીવને થાય છે.” ઈકટ પુન્યાધ આશ્રી ઈન્દ્રિયોમાં ફેર હોય છે તેથી પુન્યાધને હીસાએ એકેન્દ્રિય ગરીબ અને પંચેન્દ્રીય ભાગ્યવાન થયેલ છે. પરન્તુ સાધુને તો ગરીબ અને ભાગ્યવાનના પક્ષપાત રહિત કે ધર્મ હોય તે પ્રરૂપવે જેઇએ કારણું કે તેઓ તો છકાય જીવના પિતા સમાન છે. અને જો લેએ પિતા સમાન થઈને એવી ભાવા બોલે કે જેમાં મોટા દીકરા પંચેન્દ્રીય જીવના રક્ષણ માટે નાના દીકરા એકેન્દ્રિય અનંત જીવનો નાશ થાય. (જો તેવા કાચોમાં ધર્મ, પુન્યની પ્રરૂપણા કરે તો) તો તેઓ છ કાય જીવના પિતા કહેવાય નહિ પણ પિતાખણ્ણાની પોતાની ઝૂરજ ચુક્યા છહેવાય.

વળી સાધુનું નામ છ કાયના પ્રતિપાળ છે તો પછી એકેન્દ્રિય મારી પંચેન્દ્રિયને પોષવામાં પુન્ય છે એવી પ્રરૂપણા કરવાથી છ કાય જીવના પ્રતિપાળને જે દાવો ધરાવે છે તે આટો થઈ જાય છે. પછી તો તેનું નામ ઈકૃત પંચેન્દ્રિય પ્રતિપાળ છે એમ કહેવાય અને છ કાય પ્રતિપાળને જે દાવો છે તે રાખી શકે જ નહિ. તેમને છ કાય પ્રતિપાળનો દાવો અરી રીતે રાખવો જ હોય તો કોઈપણ આરંભવાળાં કાચો કે જેમાં જીવહિંસા રહેલી છે તેમાં પુન્ય થાય છે એવી પ્રરૂપણા તેઓથી કરાય જ નહિ. એટલા માટે જ ભગવાને સાધુને જીવહિંસાનાં નવ કોટીએ પદ્યખાણ કરવાનું ઈરમાવેલ છે.

### ઇતિ પ્રથમ મહાત્રતની વ્યાખ્યા।

---

## ખીજું મહાત્રત

ખીજ મહાત્રતમાં સાધુને જવળું સુધી નિર્બધ, સત્ય લાખા ઓલવી જેઠિએ અને જૂહું નહિ ઓલવાના ઉપર મુજબ નવ કોટીએ પદ્યખાણ હોય છે.

**પ્રશ્ના:**—ધર્મ ડેકાણે સાધુથી જૂહું ઓલાય કે નહિ?

**ઉત્તરે:**—ન જ ઓલાય કારણ ધર્મ જેવા ઉત્તમ સ્થાનમાં જૂહું ઓલાય તો પછી સત્ય શું અધર્મને ડેકાણે ઓલાશે કે? જૂહું તો

સંસારમાં અનેક ઠેકાણે બોલાય છે પણ  
ધર્મની બાબતમાં જૂહું ન જ બોલાય.

**પ્રશ્નઃ**—કેટલાએક એમ કહે છે કે સાધુ, સાધી.  
એક ગામથી બીજા બામ જતા હોય અને  
મારગમાં એક પારધિ (શિકારી) સાધુને  
પૂછે કે આ રસ્તે તમે હરણુને જતાં જેયું  
છે ? તે વખતે હરણુના જીવની રક્ષાને માટે  
સાધુએ જૂહું બોલવું કે હરણુને આ રસ્તેથી  
જતાં જેયું નથી. આચારંગ સૂત્રનો આશ્રય  
લઈ આવા કામમાં જૂહું બોલવામાં વાંધો.  
નથી એમ કહે છે તે કેમ ?

**ઉત્તરઃ**—એમ કહેનારા શાસ્ત્રના અર્થનો અનર્થ  
કરે છે આચારંગ સૂત્રમાં તો એમ કહું છે કે  
સાધુએ હરણુને જેયું હોય તો મૌન રહેવું  
પણ જૂહું બોલવું નહિ. કદાચ પારધિ (શિકારી)  
સાધુને પરીસહૂ આપે તો તેઓએ સહન  
કરવો. કારણ કે હરણુને નથી જેયું એમ  
જે કહે તો તેઓના બીજા મહાવતનો લંગ  
થાય અને હરણુને જેયું એમ કહે તો ચેલો  
શિકારી માણુસ હરણુને મારવા જય તો  
પહેલું મહાવત તુટે પણ મૈન રાખે તો  
કોઈપણ મહાવત તુટે નહિ. શાખ.  
સૂત્ર, આચારંગ, અધ્યયન ૧૨ ગાથા ઉ વળી  
દશ વિકાલિક સૂત્રના છઙ્ગો અધ્યયનની

ગાથા ૧૨માં પણ એમ કહેલ છે કે સાધુને  
પોતા માટે અથવા ભીજ માટે જૂઠું એલખું  
કહે નહિ. તે ગાથા ૧૨ લખીએ છીએ.

અણાણણું પરઢાવા, કોહાવા જઇવા મયા।  
હિંસગં ન મું બુયા નો વિઅન્ન વયાવએ ॥  
તો પછી હરણુને માટે જૂઠું કેમ એલાય ?

### ધતિ ભીજું મહાત્રત.

---

## ત્રીજું મહાત્રત

ત્રીજ મહાત્રતમાં સાધુને ચોરી કરવાનાં પદ્યખાળું  
ઉપર પ્રમાણે નવ ડેટિએ સમજવાં.

પ્રશ્નઃ—ચોરી કેટલા પ્રકારની ?

ઉત્તરઃ—એ પ્રકારની સચેત અને અચેત વસ્તુની.

પ્રશ્નઃ—સચેત એટલે શું ?

ઉત્તરઃ—સચેત એટલે જીવ સહિત

પ્રશ્નઃ—અચેત એટલે શું ?

ઉત્તરઃ—નિઝીવ, અચેતમાં આહાર, પાણી, વખ,  
પાતરાં, પુસ્તક વગેરે ધર્ણીની આજા! વગર  
સાધુએ ત્રણણ કરવાં નહિ. સચેતમાં શિષ્ય,  
શિષ્યથી કરવાં, તે પણ દીક્ષા લેવા વાળાના  
માતા પિતા આદિ કુઠુંબીએની આજાથી,

વગર આજાએ મુંડી પાડવાથી સચેતની ચોરી ગણ્યાય. જે તેના ઘરવાળા આજા આપતા હોય તો પણ દીક્ષા લેવાવાને નવતત્વનું જાણ્યપણું, પ્રતિકમણું વગેરેનું જાન તો એછામાં એછું લેઈએ જ. જેથી તે જીવ અજીવને એળખી શકે જીવ, અજીવને એળખ્યા બિના સંયમની એળખ નથી. શાખ, સૂત્ર દશવિકાલિક, અધ્યયન ઈ ગાથા ૧૨ જો જીવેવિ ન યાણાં, અ જીવેવિ ન યાણાં, જીવાજીવો અયાણંતો, કહંસો નાહી ય સંજમં. ॥૧૨॥ માટે જીવાદિક નવતત્વના જાણ્યપણું વગર દીક્ષા આપે તો લગવાનની આજાની ચોરી કહેવાય.

વળી દીક્ષા લેવાવાળા વૈરાગ્ય ભાવથી દીક્ષા લે છે કે કેમ એ બાબતની દીક્ષા આપવાવાળાએ ખાસ તપાસ કરવી, કારણું કે ભૂખે ભરતા અથવા પોતાને કરજ એટલે હેઠું પતાવવાને અથેં લે તો, તે કાંઈ દીક્ષા પાળી શકે નહિ, તેથા આવા માણુસે દીક્ષાને માટે અયોગ્ય કહેવાય અને અયોગ્યને દીક્ષા આપવાથી દીક્ષા આપનારને ચોમાસી દંડ આવે. શાખ સૂત્ર નિસીત ઉદ્દેશો. ૧૧.

તેથી વૈરાગ્યની પરીક્ષા કર્યા વગર દીક્ષા આપે તો શાખ અનુસારે દંડને પાત્ર થાય વળી તે પ્રખ્યાતી આજા બાગ કરનાર એટલે આજાની ચોરી કરનાર

કહેવાય. માટે વૈરાગ્યની તપાસ કર્યા વગર દીક્ષા આપવી કદમે નહિ. વૈરાગ્યની કસોટીમાં પાસ થયા પછી તેની પ્રકૃતિ સંબંધી તપાસ કરવી કારણ કે અહુ કોઈ હોય તો જણું જણુથી લડે અને વિષયી હોય તો ગામે ગામ ભવાડા ઉઠે, અને તેથી જૈન ચાસન નિંદાય, ઈત્યાદિક અનેક બાખતની તપાસ કર્યા પછી દીક્ષા આપવી તે સિવાય એમની એમ આપવાથી જીન આજાની ચોરી લાગે અને ત્રીજું મહાપ્રત તૂટે.

### ઈંતિ ત્રીજું મહાપ્રત

---

## મહાપ્રત ચોથું

ચોથા મહાપ્રતમાં સાધુને કુશિલનાં પચ્ચખાણ  
ઉપર પ્રમાણે નવ કેટિએ સુમજવાં.

પ્રશ્ના:—કુશિલ કેટલા પ્રકારનાં?

ઉત્તરઃ—ત્રણુ પ્રકારનાં દેવતા, દેવાંગના સંબંધી,  
મનુષ્ય મનુષ્યણી સંબંધી, તિંયંચ તિંયંચણી  
સંબંધી. આ ત્રણે પ્રકારનાં કુશિલ સેવવાનાં  
સાધુને સર્વ પ્રકારે ત્વાગ હોય છે.

પ્રશ્ના:—અદ્ધાચારી સાધુ એકલી ખી, અથવા એકલી  
સાધ્વીથી વાત કરી શકે કે નહિ?

ઉત્તરઃ—દશ વિકાલિક સૂત્ર અધ્યયન ૮ ગાથા  
પ્રે માં ભગવાને કહ્યું છે કે એકસો વરસની  
ડાઢી જેના હૃથ, પગ, નાક, કાન કાપેલાં  
હોય તો પણ અદ્ધારારી સાધુએ તે સીથી  
એવી હાલતમાં પણ વાત કરવી નહિ.

પ્રશ્નઃ—તો પછીએકલી સ્વો હોય અને બીજું કોઈ  
પાસે ન હોય તો સાધુ વહેારી શકે કે નહિ?

ઉત્તરઃ—બીજુ ઓં કે બીજે પુરુષ કોઈપણ ન હોય  
તો સાધુને 'વહેારવું' કહ્યે નહિ, કારણ કે  
બીજાઓને તેઓના શિયળંત્રતમાં શાંકા ઉપજે  
અને કોઈ પૂછે તો સાધુએ એમ કહેવું કે  
એન તું એકલી છે માટે અમને વહેારવું કહ્યે  
નહિ.

પ્રશ્નઃ—આવા હુષ્કર અદ્ધારચ્ચ્યત પાળવા સારુખાવા,  
બીવા વીગેરની મર્યાદા રાખવી પડે કે નહિ?

ઉત્તરઃ—મર્યાદા વગર અદ્ધારચ્ચ્યત પાળવું ધાર્યું  
મુર્કેલ છે માટે જ તેરા પંથી મત સંશોધક આચાર્ય  
વર્ય શ્રી લીખનાની સ્વામી તથા શ્રી લુતમલાની  
મહારાજ આદિ પુરુષોત્તમ પુરુષોએ પણ સમુ-  
દ્ધારયમાં ખાવાપીવાની બાબતમાં કારણ સિવાય  
સાંજની વખતે ગરમ આહારની જોયરી ન  
કરવી આદિ અનેક મર્યાદા બાંધેલી છે. આમ  
કરવાથી હુંમેશાં ઉણોદરી તપ ચાલુ રહે અને  
સંયમ સુખેથી પાળી શકાય.

**ગ્રંથ:**—કેટલાક સાધુ (નામધારી) એવી પ્રકૃપણું કરે છે કે શ્રાવકને “સદાર સંતોષીએ અવશોષ” મેહુણું વિહું પચ્ચયખામી” આ પ્રમાણેના ત્યાગ હોય છે તેમાં સદાર સંતોષીએ તેનો ગુણ છે અને તે આજામાં છે. આ અરાધર છે?

**ઉત્તરઃ:**—નહિં, સદારા છોડી બીજુના ત્યાગ કર્યો તે ગુણ છે. સદારા લોગવવામાં તો પાપ છે. અત્રત છે. જે કોઈ તેવી પ્રકૃપણું કરે છે તેનું ચોથું બત બીજે કરણે તૂટે છે.

### ધતિ ચોથું ભહાત્રત

---

## પાંચમું ભહાત્રત

પાંચમાં ભહાત્રતમાં સાધુને નવજલતનો પરિશ્રહ રાખવાનાં પચ્ચયખાણું ઉપર પ્રમાણે નવ કોટિએ સમજવાં નવજલતના પરિશ્રહની વિસ્તારપૂર્વક વ્યાખ્યા.

નવજલતિના પરિશ્રહનાં નામઃ—હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય, ઐત્ર, વત્થુ, દ્વિપદ, ચૌપદ, અને કુંભી ધાતુ.

(૧) હીરણ્યઃ—એટલે ચાંદી, રૂપિયા, નોટ વગેરે.

(૨) સુવર્ણઃ—એટલે સોનું, ગીની વગેરે.

સાધુએ પોતાના કામ માટે અથવા પરના કામ.

આટે પોતાની પાસે રાખવું નહિ, બીજા પાસે રાખવું નહિ અને રાખે તેને અનુમોદવું નહિ. મનથી, વચનથી અને કાયાથી.

**પ્રશ્નઃ**—સાધુ પોસ્ટ કાર્ડ, કવર, ટિકિટ વગેરે ટપાલ વહેવાર લખવા સારુ રાખે કે નહિ?

**ઉત્તરઃ**—રાખવા કદ્યે નહિ. કારણ કે કાર્ડ, કવર, ટિકિટ વગેરે એક જાતની નોટની નોટજ છે. જેમ કાગળની કરન્સી નોટ ગવર્નર્મેન્ટના સિક્કાથી ચાલે છે તેમ કાર્ડ, કવર, ટિકિટ વગેરે ગવર્નર્મેન્ટના સિક્કાથી જ ચાલે છે.

**પ્રશ્નઃ**—સાધુને પોતાના શુરૂ અથવા શ્રાવકને સમાચાર લખવા હોય તો?

**ઉત્તરઃ**—ગમે તે સમાચાર લખવા હોય પણ લીધેલાં મહાવત તૂરે તો શી રીતે ટપાલ લખાય?

**પ્રશ્નઃ**—ટપાલ વહેવાર કરવાથી મહાવતમાં એટલો બધો શું વાધો આવે છે?

**ઉત્તરઃ**—(૧) પહેલાં તો મહાવતજ તૂટી જય છે, કારણ કે સાધુને પરિચહુ રાખવો નહિ અને ટપાલ વહેવાર કરે તેને થોડાંધણું કાર્ડ, કવર, ટિકિટ વગેરે પાસે રાખવાં પડે.  
(૨) બીજું કાર્ડ, કવર વગેરને રેલવે ગાડીનો વિહાર પણ કરાવવો પડે. સાધુ રેલવે ગાડીમાં એસે નહિ પણ ટપાલ વહેવાર

કરનારનાં કાર્ડ કવરને રેલવે ગાડીમાં  
બેસાડવાં જ (મોકલવાં જ) પડે. સાધુને તેથી  
સ્વારી કરવાના જે ત્રણુ કરણુ અને ત્રણુ  
નેગથી પરચયખાળુ હોય તે તુટી જાય છે.  
(૩) ત્રોણું ગૃહસ્થીના હુથમાં આપીને કાર્ડ,  
કવર ટપાલના ભુંગળામાં નંખાવવાં પડે છે  
તેથી અહુસ્થી પાસે કામ કરાવવા રૂપ જે  
૨૮ (અહુવીસ)મું અણુચાર છે તે તેને  
લાગે. (૪) ચોથું ટપાલ વહેવાર કરનાર  
સાધુઓને અહુસ્થી કરતાં વધારે ચિંતા અને  
ઉપાધિ સોએવવી પડે છે એ દેખીતી વાત  
છે. આજે અહુસ્થીને પાંચ કાગળો લખવા  
હોય તો ખરચના લયથી તે ત્રણુ કાગળથી  
ચલાની લે છે પણુ સાધુ મહારાજશ્રીને  
ટપાલ વહેવાર કરતાં કેટવા પૈસા ખરચાય  
છે તેની ચિંતા કરવાની હોતી જ નથી કારણુ  
ચેતાને તો દ્રવ્યોપાજન કરવાની ચિંતા  
છે જ નહિ. પૈસા ટકાનો આમાં જે ધુમાડો  
થાય છે તે તો અહુસ્થીઓને જ થાય છે.  
અહુસ્થીને પાંચ કાગળમાં ચાલતું હોય  
તો ટપાલ વહેવાર કરનાર સાધુને ૧૫ (પંદર)  
કાગળ તો સહેજે જેઠાં કારણુ અહુસ્થને  
તો એમુક જ ધરની સંસાળ રાખવાની હોય  
પણ ટપાલ વહેવાર કરવાવાળા કહેવાતા સાધુ

મહારાજને તો ઘણું ડેકાણ્યુંની સંભાળ  
 રાખવી રહી. દાખલા તરીકે અમુક શ્રાવ-  
 કળનો કાગળ નથી આંદો, માંદા હતા  
 તેમને કેમ છે ને કેમ નહિ માટે તેમને  
 એક કાગળ લખો. અમુક શ્રાવકળ  
 આવવાના હતા તે કેમ નથી આંદો માટે  
 એક કાગળ તેમને લખો. અમુક લેખ,  
 છાપાં છપાવવાનાં હતાં તે હજુ બહાર કેમ  
 નથી પડયાં માટે એક કાગળ ત્યાં લખો,  
 અમુક લહીયા (વખનાર) પાસે સૂત્ર લખા-  
 વવાનું કહ્યું હતું તે હજુ કેમ નથી લખાયું  
 એક કાગળ ત્યાં લખો. અમુક ચોપડીઓ  
 લખાવવાની હતી પણ હજુ રૂપયાની  
 સગવડ થઈ નથી માટે એક કાગળ અમુક  
 શેડિયાને ત્યાં લખો ઈત્યાદિ અનેક ડેકાણ્યો  
 કાગળ લખવાનો ધંધો ટપાલ વહેવાર  
 કરનાર સાધુને મોટે ભાગે હરરોજ ચાલુ  
 રહે છે અને તેને લીધે બ્રહ્મસ્થ પાસે ઉપર  
 જણ્ણાંદ્યા ગ્રમાણ્યો કામ પણ કરાવવું પડે છે.  
 ટપાલને રેલ ગાડીનો વિહાર કરાવવો પડે,  
 ચોડાંધણ્ણાં કાડો, કવર વગેરે પણ તેઓને  
 પાસે રાખવાં પડે. આથી અનેક હોષનાં  
 કારણો ઉભાં થાય માટે પાંચ મહાવત.

ધારી સાધુ મહારાજને ટપાવ વહેવાર કરવો  
કહે નહિ.

**ગ્રંથ:**—હિરણ્ય અને સુવર્ણ, (પરિશ્રહ)ના ત્યાગ  
થયા પછી છાપાં, ચોપડી કે હેન્ડબીલ  
છપાવવા સારુ કે પુસ્તકો બંડાર માટે  
એકઠાં કરવા સારુ સાધુ ઉપહેશ દ્વારા  
ઇપિયા પૈસા એકઠા કરી કરાવી શકે  
કે નહિ?

**ઉત્તરઃ**—સાધુને કોઈપણ બાબત સારુ પરિશ્રહ  
લેગો કરાવવાનો આદેશ, ઉપહેશ આપવાનું  
કહે નહિ. પછી છાપાં, ચોપડી કે હેન્ડબીલ  
ગમે તે બાબત હોય. છપાવવા સારુ પરિશ્રહ  
લેગો કરાવવાની બાબત તો હૂર રહી પણ  
સુ. સાધુને પોતાના પાંચ મહાવ્રતને  
હિસાએ તો છપાવવાનો આદેશ ઉપહેશ પણ  
આપવો કહે નહિ. એટલું જ નહિ પરંતુ  
મુંડ સુધારવા જેવું પણ કામ કહે નહિ.  
તેમ છતાં જો કોઈ સાધુ નામ ધરાવી તે  
કરે તો તેનાં લીધેલાં પાંચ મહાવ્રતનો  
લાંગ થાય. ડાદ્યા હોય તે હૃદયથી વિચારી જોનો.

(3) ધન:—ધનપરિશ્રહ એટલે બીજું ધન તો  
સાધુ પાસે શું હોય? વસ્તુ, પુસ્તક, પાતરાં વગેરે  
સાધુ જો મર્યાદા ઉપરાંત રાખે તો ધન પરિશ્રહનું પાપ

લાગે અને તેથી પાંચમું મહાવત તૂટે છે.

**પ્રશ્ન:**—વસ્ત્ર, પુસ્તક, પાતરાં વગેરે રાખવાની સાધુને માટે શાસ્ત્રમાં શું ભર્યાદી છે કે જેથી ધન પરિશ્રહનું પાપ તેઓને નહિ લાગે અને સાધુનું મહાવત કુશળ રહે?

**ઉત્તર:**—૦૫૧૧૨ સૂત્રના ૨ (બીજા) ઉદ્દેશોમાં કહ્યું છે તેમજ આચારંગ સૂત્રમાં પણ કહ્યું છે કે એક સાધુને ત્રણ પછેડી રાખવી કર્દે અને ત્રણ પાતરાં રાખવાં કર્દે શાસ્ત્રની આ ભર્યાદી સુજાપ રાખે તો સાધુને ધન પરિશ્રહનું પાપ લાગે નહિ અને લીધેલાં મહાવત તૂટવાને બદલે કુશળ રહે, કારણું કે પ્રભુલની આજા છે; પરન્તુ આજા જાદુંધીને વધારે રાખવામાં આવે તો મહાવત તૂટે. અને પરિશ્રહધારી કહેવાબ,

**પ્રશ્ન:**—વસ્ત્ર, પુસ્તક, પાતરાં વગેરે સારાં હોય અને પાછળથી મન ગમતાં જોઈએ તેવા મલતાં ન જણે તો અવસરે કપાટ ભરીને રાખી મૂકવામાં શું વાંધો?

**ઉત્તર:**—શાસ્ત્રોક્ત ભર્યાદી મૂકીને રાખવાથી, અન આજાની ચોરી લાગે અને તેથી જીવું મહાવત તૂટે અને બીજું ધન પરિશ્રહ લાગે.

કારણ કે મર્યાદા ઉપરાંત જો વસ્તુ, પુસ્તક, આત્માં ઈત્યાદીક રાખે તે પરિશ્રદ્ધારી કહેવાય આથી પાંચમું મહાત્મત તુટે વળી ઉપર ખતાંયા મુજબ વસ્તુના કપાટ, પટારા લરીને રાખી મૂકવામાં આવે તો દરરોજ તેનું પડીલેહણું યાય નહિ અને પડીલેહણું કયાં વગર ચોડાં પણ વસ્તુ, પાતરાં વગેરે સાધુ રાખે તો નિસીત સૂત્રના ખીળ ઉદ્દેશાના ખોલ પદમાં તેઓને લઘુ માસિહું પ્રાયશ્ચિત કહેલ છે તે લાગે જ માટે જ સાધુને કપાટ, પટારા યા ભંડાર લરીને વસ્તુ, પુસ્તક પાતરાં વગેરે રાખી મૂકવાં કહેયે નહિ. રાખે તો ધનપરિશ્રદ્ધારી કહેવાય અને ઉપર ખતાંયા પ્રમાણે અનેક દોષ લાગે તેથી ચારિત્ર રહિત થાય.

(૪) ધાત્યઃ—એટલે અનાજ ધઉં, ચણુા વગેરે સાધુ પોતાના કામ માટે અથવા પારકાના કામ માટે રાખે નહિ, ખીળ પાસે રખાવે નહિ અને રાખતાને અનુમોદે નહિ. મનથી, વચનથી અને કંયાથી.

(૫) એત્રઃ—એટર વગેરે ઉધાડી જમીન. સાધુ ઉધાડી જમીન પોતાની કરી રાખે નહિ, ખીળ પાસે રખાવે નહિ, રાખતાને અનુમોદે નહિ, મનથી, વચનથી અને કાયાથી.

**પ્રશ્નઃ**—સાધુને માટે વાડા ખાંધ્યા હોય અથવા સંડાસ. (જજરૂ) ખાંધ્યા હોય તેમાં સાધુ ઠંકે, માત્રે (લધુનીત, વડીનીત) જાય કે નહિ?

**ઉત્તરઃ**—સાધુને માટે વાડા અથવા સંડાસ ખાંધ્યા હોય તેમાં તેઓને ઠંકે, માત્રે જવું કલ્પે નહિ અને જે તેમાં જાય તો ચારિત્રનો જંગ ધાય. માટે જ લગવાને આચારંગ સૂત્રના ૧૨ (બારમા) અધ્યયનના પાંચમા ઉદ્દેશમાં કલ્યું છે કે જે ગામમાં ઠંકે, માત્રે જવાની ઘુણ્ણી નિર્વંદ્ય જગ્યા ન હોય ત્યાં સાધુએ ચોમાસું કરવું નહિ.

**પ્રશ્નઃ**—ઉપકાર વધારે થતો હેખાતો હોય તો?

**ઉત્તરઃ**—ગમે તેટલો ઉપકાર થતો હોય તો પણ રહેતું કલ્પે નહિ. સાધુએ પોતાના સંયમ-ઇપી ધરને પહેલાં તપાસવું. ધર ખાળીને અજવાળું કરે તે માણુસ મૂળું કહેબાધ.

(૬) વત્થુપર્ચિષ્ઠઃ—એટલે ખાંધેલાં મકાન.

**પ્રશ્નઃ**—સાધુ સ્થાનક ઉપાસરા બંધાવવાનો ઉપહેશ આપી શકે કે કેમ?

**ઉત્તરઃ**—નહિ. વળી એમ પણ કહે નહિ કે તમારા ગામમાં સ્થાનક, ઉપાશ્રય નથી.

માટે ઉપાશ્રય કરાવવો જેધાંએ. અને જે સાધુ એમ કહે તો તે સાધુને વત્થુ પરિશ્રહનું પાપ લાગે અને બીજા કરણે પાંચમું મહા-પત તણે.

૩. શ્રી—સાધુના ઉપહેશ વગર કોઈ ગૃહસ્થે પોતાની મેળે તેઓને માટે મકાન બંધાવ્યાં કેવેચાતાં લીધાં હોય તે કહેપે કે નહિ?

૪. તરદ્દિ—સાધુ માટે કોઈ ગૃહસ્થે ઉપાશ્રય બંધાવ્યો. હોય અથવા વેગાતો લીધો. હોય અથવા ભાડે રાખ્યો. હોય અથવા સ્થાપિત રાખ્યો. હોય (આ મકાન હુંમંશાં સુનિ મહારાજ માટે છે અને એને બીજા કોઈ કામમાં વાપરવું નહિ) તો એવા પ્રકારનાં સ્થાનક મકાન અથવા ઉપાશ્રયમાં સાધુને ઉત્તરવું કહેપે નહિ. અને જે કોઈ ઉત્તરે તો તેનાં પાંચ મહાપતમાં વત્થુ પરિશ્રહ નામનું પત ત્રીજે કરણે તુણે. કારણું કે સાધુ માટે બંધાવેલા સ્થાનકને તેઓ લોગવે તો તેઓને અનુમોદવાની હિયાનું પાપ લાગે.

વળી આધાકર્મી સ્થાનકનો હોથ આચારંગ સૂત્રમાં અતાવેલ છે તે સુત્ર શાખથી નીચે બતાવીએ છીએ.

સાધુ માટે છકાય જીવની હિંસા કરી મકાન બંધાવે

અને તેમાં સાધુ રહેતો દ્રવ્યથી તો સાધુ કહેવાયાં  
કારણું સાધુને વેષ પહેંચો છે માટે, પણ ભાવથી  
તો ગૃહસ્થી જ કહેવાય. શાખ, સૂત્ર આચારંગ અધ્યયન  
૧૧ (અગ્નિયારમું), ઉદ્દેશો ૩ (ત્રણ), એલ ૧૫ (પંદર)  
મામાં આ બાબત કહેલી છે. વર્ગી બીજે પણ અનેક  
ઠેકાણે તીર્થેંકર હેવે કહ્યું છે કે સાધુને માટે અનાવવાના  
ભાવ હોયા. કરી સ્થાનક, ઉપાશ્રય બંધાવ્યા હોય તેમાં  
સાધુએ ઉત્તરવું નહિ, તો પછી તેને માટે સ્થાનક  
ઉપાશ્રય સારુ કરાણા કરવવાનો અધિકાર હોયજ ક્યાંથી?

**પ્રશ્ના:**—કેટલાએક એમ કહે છે કે સાધુ થોડાજ  
કહે છે કે અમારે માટે સ્થાનક ઉપાશ્રય  
બંધાવો. ગૃહસ્થી પોતાની મેળે બંધાવે  
તેમાં અમોને (સાધુને) રહેવામાં શું વાંધો?

**ઉત્તરઃ**—સારમાં જમાઈ શસ્ત્રગૃહે જમવા  
જવાનો હોય ત્યારે શસ્ત્રપક્ષ બદામનો  
શીરો બરફી વગેરે બનાવે છે, તે વખતે  
જમાઈ થાડુંજ કહે છે કે મારે માટે  
મિઠાજ બનાવો. તે સાસરે જમવા જાય.  
છે ત્યારે સાસરાવાળા તેને માટે સારાંસારાં  
મિઠાનાં બનાવે છે પણ લે તે પહેલેથી જ  
શસ્ત્રપક્ષને કહી હે કે મારે આજે હાળ,  
રાઠલી એ દ્રવ્ય સિવાય બીજાં દ્રવ્ય કામમાં  
લેવાનાં પચ્ચાણ છે તો પછી તેઓ.

બધામનો શીરે બરણી વગેરે બનાવે નહિં  
 કારણું ધરનો માલ ફૈલેક્ટ કોણું ગુમાવે.  
 તેમજ સાધુ પહેલાં જ કહી હે કે અમારે  
 માટે સ્થાનક ઉપાશ્રય · અંધાવશો નહિં  
 કારણું કે અમને કદ્વે નહિં તેમ છતાં  
 જે અંધાવશો તો તમારા ધરનો માલ  
 ગુમાવશો અને હુગાંતિનાં ખાતાં બાંધશો  
 આમ સાધુ ખુલ્લું કહે તો પણ કોઈપણ  
 શ્રાવક પોતાનો માલ ગુમાવી પાપમાં ઉતરે  
 નહિં પણ સાધુ પોતે અદ્વય પાપ, બહુ  
 નિર્જરા હેખાડી ગામો ગામ સ્થાનક ઉપા-  
 શ્રયનો ઉપદેશ આપી ઉતારા કરાવે છે.  
 એમ કરવાથી એક ધરની ભમતા છેઠી  
 અનેક ધરની ભમતા લાગે છે. તે કારણથી  
 સાધુને નિયત કાયમી સ્થાનક-ઉપાશ્રય નજ  
 જેઠાં એ. વખત પર હાટ, હવેલી, અંગલો  
 ઓટલો જે સુજતું મળે તેમાં સાધુણું  
 અપ્રતિબંધપણે રહેવું પણ સાધુને એકજ  
 મકાનમાં ઉત્તરવાનો પ્રતિબંધ ન જ હોય.  
 જે પ્રતિબંધ રાખે તો વત્થુ પરિમિહતું  
 પાપ લાગે અને પાંચમું મહાક્રત તુટે.

૭. દ્વિપદ પરિથિહઃ—એટલે દાસ, દાસી, નોકર,  
 નાકર, વગેરે સાધુ રાખે નહિં, રખાવે નહિં અને

રાખતાં પ્રત્યે અનુમોદે નહિ, મનથી, વચ્ચનથી અને કાયાથી.

**પ્રશ્નઃ**—સાધુ ગૃહસ્થી પાસે બોજ ઉચકાવે કે નહિ? તેમજ ડોણી ઉપડાવે કે નહિ? વીહાર કરતી વખતે લૈયા વગેરે નોકર ચાકર ધત્ત્યાદિક મંગાવે કે નહિ? કપડાં ધોવરાવે કે નહિ? પગ ચંપી કરાવે કે નહિ?

**ઉત્તરઃ**—સાધુ ગૃહસ્થી પાસે બોજ ઉચકાવે નહિ અને ડોણી ઉપડાવે નહિ. ઉચકાવે તો ચોમાસી પ્રાયશ્ક્રિત એટલે ચાર મહિનાનું સાધુપણું જય. શાખ સૂત્ર નિસ્તિ ઉદ્દેશો ૧૨. બોલ ૪૫. કપડાં વગેરે ધોવરાવે તેમજ પગચંપી કરાવે તો અહૃતીશમું અણુચાર હોષ લાગે. શાખ સૂત્ર દશ વૈકાલિક અધ્યયન ૩. વળી સાધુ ગૃહસ્થી પાસે પગચંપી કરાવે તો ચોમાસી પ્રાયશ્ક્રિત લાગે. શાખ સૂત્ર નિસીત ઉદ્દેશો ૧૫. માટે સાધુએ ગૃહસ્થી પાસે કાંઈ કામ કરાવલું નહિ.

**પ્રશ્નઃ**—સાધુ પગારદાર પંડિત પાસે ભણે તો દ્વિપદ પરિશ્રહ લાગે કે નહિ?

**ઉત્તરઃ**—સાધુ માટે પગાર આપી પંડિત રાખે તો તેની પાસે ભણુલું નહિ પણ જેમ ફોંઝ પાસે રાઠલી હોષ અને તે જેમ વગર મૂઘ્યે આપે

તેમ કોઈ પાસે વિધા હોય ને તે આપે તો  
તેની પાસે લખું પણ સાધુ પગારઢાર  
પંડિત રાજે નહિ રખાવે નહિ અને રાજે  
તેની પાસે લખે તો દ્વિપદી પરિશ્રહનું પાપ  
લાગે. વળી પંડિતના પગારની સગવડ પણ  
કરવી પડે. આ હિસાઝે બીજાને પરિશ્રહ  
રખાવે તેથી બીજે કરણે પાંચમું મહાત્મત તૂટે.

૮ ચૈયાપદ પરિશ્રહઃ—એટલે ગાય, લેંસ, ઘોડા,  
ખાથી, બકરાં છત્યાદિક સાધુ પોતે રાજે નહિ, રખાવે  
નહિ, અને રાખતાં પ્રત્યે અનુમોદે નહિ. મનથી વચ-  
નથી અને કાયાથી,

પ્રશ્નઃ—સાધુ ગૃહસ્થને એમ કહે કે નહિ કે તમારે  
આટલી ગાયો, લેંસા તો રાખવીજ જોઇએ?

ઉ.તરઃ—ગાય, લેંસ ચૈયાપદ પરિશ્રહમાં છે તેને  
સાધુએ પોતે રાખવી છોડી અને પછી બીજાને  
રાખવાને। ઉપદેશ કરે તો બીજે કરણે ચૈયાપદ  
પરિશ્રહનું પાપ લાગે અને પાંચમું મહાત્મત તૂટે.

પ્રશ્નઃ—કેટલાએક એમ કહે છે કે આણુંં શ્રાવક  
ચાલીસ હજાર ગાયો રાખી હતી અને વીર-  
પ્રભુએ રખાવી હતી તો તેમનું મહાત્મત  
કેમ તૂટ્યું નહિ?

ઉ.તરઃ—આણુંં શ્રાવકે ચાલીશ હજાર ગાયો

પોતાની છંચાથી રાખી છે પણ મહાવીર સ્વામીએ તેને રાખવાનું કહ્યું નથી. અને મહાવીર સ્વામીએ રખાવી હોત તો તેઓ આણુંદ શ્રાવકને એમ કહેત કે, હે, આણુંદ તું ચાલીસ હજરની મર્યાદા કેમ કરે છે. વધારે રાખશે તો વધારે પુન્ય થશે. પણ ભગવાનનો ઉપદેશ રાખવાનો ન જ હોય. ભગવાન પાસે કોઈ યત્થાશક્તિ ત્યાગ કરે તેનાં તેને પચ્ચાખાણ આપે છે. ભગવાન પાસે આવીને કોઈ કહે કે મને પાંચ ગાય ઉપરાંત રાખવાના પચ્ચાખાણ આપો તો ભગવાન પચ્ચાખાણ કરાવે કારણ કે ભગવાનનો ઉપદેશ મત વધારવાનો હોય. અપ્રત વધારવાનો ઉપદેશ ભગવાનનો હોય જ નહી. માટે જ જ્ઞાની જ ખે વિચારવું કે આણુંદ શ્રાવકને ચાલીશ હજર ગાયો રાખવાનો ઉપદેશ પ્રલુચે આપ્યો જ નથી. ડાઢ્યા હોય તે વિચારી નેજે.

← કુંભી ધાતુનો વ્યાખ્યા-કુંભી ધાતુમાં ત્રાંણ, પિતળ, લોખંડ ઇત્યાદિ સાધુ પોતે રાખે નહિ, રખાવે નહી. રાખતાંને અનુમોદે નહિ. મનથી વચનથી અને કાયાથી.

**પ્રશ્નઃ—**સાધુને ધાતુ માત્ર રાખવી નહિ તો પણી કોઈ સાધુની આપે ચક્ષમાં આઠ્યાં હોય તો

ચરમાં પહેરે કે નહિ ?

ઉત્તરઃ—સાધુએ ચરમાં રાખવાં નહિ કારણ કે પ્રશ્નાં  
દ્વાકરણ સૂત્રના અધ્યયન ૧૦માં કલ્યાં છે.  
સાધુએ કાચ, પછિયર, સોનું, ઝું, પિરાવ  
વગેરે રાખવું નહિ તો પછી ચરમાં કેમ રખાય ?

પ્રશ્નઃ—કોઈ કહે ચરમાં તો જ્ઞાન ધ્યાનની વૃદ્ધિ  
માટે રાખીએ છીએ.

ઉત્તરઃ—જગવાનની આજા કુશળ રાખીને જ્ઞાન  
ધ્યાનની વૃદ્ધિ કરવામાં આવે, તો જ બેખામાં  
ગણ્ણાય, પણ આજાનો લંગ થાય તે કરણી  
બેખામાં નહિ અને જે જગવાનની આજા બેખી  
પાંચસું મહાત્રત તોડીને ચરમાં ચઢાવવામાં જ્ઞાન  
ધ્યાનની વૃદ્ધિ કોઈ વ્યક્તિ સમજતી હોય તો  
તેને ન્યાયે કોઈ સાધુને કાનમાં જખમ થયો.  
હોય અને તેથી કાનમાં બહેરાશ વધીને ઓષ્ણ  
સંભળતું હોય ત્યારે દ્વાકરણ આપવામાં અને  
પ્રશ્નોત્તર કરવામાં ઘણી અડચણું પડતી જણી  
તે વખતે જ્ઞાન ધ્યાનના વધારાનો લાભ લઇ  
કાને ઘેટરી ચઢાવે તો પછી શું વાંધો ! અને  
મોઢાનાં દાંત પડવાથી દાંતનું ચોકઠું ચઢાવે  
તો પછી શું વાંધો ? દાંતનું ચોકઠું ઘેસાડવાથી  
સ્પર્ષ ઉચ્ચારણ કરવામાં આવે અને લોકો  
સહેલાઈથી ધર્મ ઉપદેશ સમજાવવાનો લાભ.

જાળવી શકે એ પણ ધ્યાનના વધારા સારુજ છે.

વળી કોઈ સાધુને પગમાં જખમ થયો હોય તો જ્ઞાન ધ્યાનના વધારા સારુ રેલગાડીમાં વિહાર કરે તો શું વાંધો? કારણ કે ગામો ગામ ફરે તો ધણું શાવકને સમજલવે એ પણ જ્ઞાન, ધ્યાનના વધારા સારુ જ છે.

હવે વિચારો કે જે જ્ઞાન ધ્યાનના વધારા સારુ ચર્ચમાં ચદાવવામાં આવે તો પછી કાને સાંભળવા સારુ એટરી રાખે, અને સ્પૃષ્ટ ઉચ્ચારણ કરવા સારુ દાંત બંધાવે અથવા દાંતનું ચોકડું ધાલે અને ગામો ગામ ઉપકાર કરવા સારુ પગમાં જખમને લીધે રેલગાડીમાં વીહાર કરે તો પછી સાધુપણું પાળવું શું સુશકેલ છે? શાસ્ત્ર આજા બહારનાં કાર્ય કરી જ્ઞાન, ધ્યાનનો વધારો સમજે તે માણુસની દ્રષ્ટિ પ્રભુ આજા પાળવાની નથી એમ સમજવું જેઠાએ અને જે આજા પાળવાના જાવ હોય તો એમ સમજે કે ગમે તેમ થાય પણ પ્રભુની આજા તોડી ચર્ચમાં ચદાવવાં નહિ.

પૂર્વે કહ્યા તે પાંચ મહાબ્રત પૂર્ણરીતે પાળે તેજ ગુરુ કહેવાય અને પાંચ મત્રાની અંદર એકપણું મહા-બ્રત તૂટે તો સાથેના સાથે પાંચે મહાબ્રત તૂટી જાય છે.

પ્રશ્નઃ—તે કેમ?

ઉત્તરઃ—ધારા કે કોઈ એક સાધુએ ઉપહેશ આપી કોઈપણ કાર્ય સારુ પરિથિહ લેગો કરાવ્યો અને

લેણો થયા પછી ખુશી પણ થાય કે આપણું ઉપરેશથી કેવું મજાહનું કર્દ થયું. આમ કરવાથી પાંચમાં મહાબ્રતમાં સાધુનાં એ કરણું તુટ્યાં એ એ હિસાએ પાંચમું મહાબ્રત તો ખલાસ થયું જ અને પરિશ્રહ છે ત્યાં આરંભ સમારંભ રહેલા છે. શાખ-સૂત્ર સુયગડાંગ.

અધ્યયન-૧ ઉદેશો—૧ ગાથા-૨. આ હિસાએ આરંભ, સમારંભ જે કાર્યમાં સમાયલાં હોય તે કાર્યનો સાધુ મુનિરાજ ઉપરેશ આપે તો તેનું પહેલું મહાબ્રત તુટે, એ મહાબ્રત ખલાસ થયાં પહેલું અને પાંચમું, પછી પૂછવાથી તે સાધુ કહે છે કે અમે પાંચ મહાબ્રતધારી છીએ એટલે જુહું બોલ્યા કારણું કે પાંચમાંથી એ તો પહેલાં જ તોડી નાંખ્યાં એ હિસાએ બીજું વ્રત પણ ખલાસ થયું. હવે જુહું બોલવાની પ્રભુની આજાનથી તે હિસાએ આજાની ચોરી થઈ. એટલે ત્રીજું વ્રત પણ ખલાસ થયું. હવે ચોથા વ્રતની વાતકુશિલ એ પ્રકારનાં છે: એક તો સ્ત્રી પુરુષના લોગ સખાંધી, બીજું આચાર કુશિલ, તે આરંભ અને પરિશ્રહની ખાણતમાં આહેશ અને ઉપરેશ દ્વારા લાગ લેવાય તે. આ કારણથી ચોથું મહાબ્રત તુટ્યું કાંચ કે

પરિશ્રમને લેગા કરવાથી આચારનું કુશિલ-  
થણું અને જ્યારે પરિશ્રમના ઇંડ સખાંધી  
ઉપરેશ કચો ત્યારે પાંચમું મહાત્મત શરૂઆ-  
તમાં તૂટવાથી પાંચે તુટે છે માટેજ સાધુ  
ચાર મહાત્મતધારી કે ત્રણું પ્રતધારી કહેવાતા  
નથી એ રીતે દરેક મહાત્મત ઉપર વિચાર  
કરવો જોઈએ કે એક મહાત્મત તૂટવાથી  
પાંચેના પાંચેજ એકી સાથે તુટે છે. જેમ  
મોતીની માળાનું એક મોતી તુટી પડવાથી  
બધાં મોતા નીચે પડે છે તેમજ મહાત્મતનો  
હિસાબ સમજવો.

ઉપર ખતાવ્યા પ્રમાણે પાંચ મહાત્મત પાળવાવાળા  
-સાધુએ આઠ પ્રવચન માતાના બોલ પૂરી રીતે પાળવા  
-જોઈએ કારણું કે સંયમરૂપી સંતાનની રક્ષા માટે  
-ભગવાને આઠ ધાર્ય માતા કરેલ છે.

**પ્રશ્નઃ**—આઠ પ્રવચન માતાનાં નામ કહેણ.

**ઉત્તર—**ઇરિયા સમિતિ, લાખા સમિતિ, એવણી  
સમિતિ આઢાન લંડમત નિષેષણી સમિતિ  
ઉચ્ચાર પાસવણું જલ, સંધારુ પરિઠાપણીઓ  
સમિતિ એ પાંચ સમિતિ છે. અને ત્રણું  
ગુરુ છે તેનાં નામ. મન ગુરુ વચન ગુરુ  
અને કાય ગુરુિત. પાંચ સમિતિ અને ત્રણું  
ગુરુિત મંગી આઠ બોલને પ્રવચન માતાના

બોલ કહે છે.

પ્રશ્ના:—ઇરિયા સમિતિ એટલે શું?

ઉત્તરઃ—ઇરિયા સમિતિ એટલે પોતાની દેહ પ્રમાણે  
દ્રષ્ટિ મૂકીનેથ નેથને ચાલવું મારગમાં ચાલતાં,  
વાતો કરવી નહિ સખાન વાતો કરવાથી  
નેવામાં ધ્યાન રહે નહિ અને નીચું બેથા  
વગર દિવસે સાધુ જે ચાલે તો તે સાધુ છ  
કાયનો ઘાતક કહેવાય. અને રાત્રે દેહ ચિંતા  
ટાળવા માટે બહાર જવું પડે તો અરવળાથી  
પુંજ્યા વગર પગ મૂકવો નહિ.

### ઇતિ ઇરિયા સમિતિ

પ્રશ્ના:—ભાષા સમિતિ એટલે શું?

ઉત્તરઃ—ભાષા સમિતિ એટલે સાધુએ નિવંધ  
સત્ય ભાષા બોલવી સાવધ ભાષા બોલવી  
નહિ એટલું જ નહિ પરંતુ સત્ય હોવા  
છતાં સાવધ હોય તો તે પણ બોલવી નહિ.

( ગાથા )

ભાષા વિચારીને નિધવં બોલીએરે કર્દાર મુળમત  
બોલરે  
સાવધ ભાષા મતી બોલે સર્વથારે મીઠા બોલેતો પહેલાં  
તોલ રે.

શ્રી જીન ગણ્યધર જૌતમને કહે રે.

પ્રશ્નઃ—સાવધ ભાષા કોને કહેવી ?

ઉત્તરઃ—જે વાક્ય બોલવામાં પાપ લાગે એવી ભાષા બોલવી નહિ. દાખલા તરીકે “ચુલે જેધને સળગાવજે” “પાણી ગાળીને પીજે” આ સાવધ ભાષા થઈ કારણું કે આમાં કાર્ય કરવાની આજા આપી છે.

નિવંધ ભાષા બોલવામાં પાપ નહિ દાખલા તરીકે “જેયા વગર ચાલવું નહિ” અણુગળ પાણી પીવું નહિ” આ ભાષા નિવંધ થઈ કારણું કે આમાં કાર્ય કરવાની આજા આપી નથી ફૂકત ઉપહેશ આપી પાપ ટળાંયું છે.

દશવૈકાલીક સૂત્રના ઉમા અધ્યયનની ૪૭મી ગાથામાં કહ્યું છે કે ગૃહસ્થ તમે અહીં આવો અથવા અહીંથી ભાયો અથવા અહીં ઉલા રહો અથવા અહીં બેસી ભાયો અથવા અમુક કાર્ય કરો. આ ભાષા સાવધ હોવાથી સાધુએ બોલવી નહિ.

પ્રશ્નઃ—કોઈ મોટો પૈસાવાળો શેડીઓ આંયો હોય તે ?

ઉત્તરઃ—ગમે તેવો મોટો અને પૈસાવાળો શેડીઓ હોય તેની સાધુને શું ગરજ છે કે જેથી ગરીબને તકલીફ આપી પૈસાવાળાને આગળ બેસાડે. સાધુને ગરીબ અને પૈસાવાળા ણધાને સરખા ગણી કોઈને પણ આવો, બુયો, બેસો ઉડો

એમ કહેવું કહ્યે નહિ. સર્વને સરળો ધર્મ ઉપહેશ સાધુએ કરવો. આવી રીતની સમિતિ ઉપરથી શુદ્ધ સાધુ તરતજ ઓળખી શકાય.

### ધર્તિ ભાષા સમિતિ.

પ્રશ્ના:—અખણુા સમિતિ એટલે, શું?

ઉત્તરઃ—અખણુા સમિતિ એટલે, વસ્ત્ર, પાત્ર, આહાર પાણી હંવા અને ઉત્તરવાની જગ્યા વગેરેની ચોળખી દીતે તપાસ કરવી તે. કારણુ કે સાધુ માટે કોઈપણ વસ્તુ બનાવી હોય અથવા વેચાતી લાગ્યા હોય તો તેઓને શહણુ કરવી કહ્યે નહિ કારણુ કે અખણુા સમિતિવંત સાધુએ બેતાલીસ દોષ અને બાવન અનાચાર ટાળી ઉપરોક્ત વસ્તુ લેવી તેમ કહેત છે તે નીચે મુજબ છે. તે બેતાલીસ દોષ કયા કયા છે તેનાં નામ વિગત સાથે કહે છે.

### આવકના લોગથી ૧૬ ઉદ્ગમના દોષ

૧. આધાકમી (અધોગતિમાં લઈ જતા દોષો) એટલે ખાસ સાધુ માટે આહાર, પાણી, વસ્ત્ર, પાત્રાં, પાટ, પાટલા, સ્થાનક ઉપાશ્રયાદિક ૧૪ પ્રકારની વસ્તુમાંની ફોઈપણ વસ્તુ બનાવીને સાધુને આપે અને સાધુ લોગવે

તો હોષ લાગે.

૨. ઉહેશીક એટલે સાધુને ઉહેશી ભાવ લેગા કરી બનાવેદી ૧૪ પ્રકારની વસ્તુ તેઓને આપે અને સાધુ તે લે અથવા ભોગવે તો હોષ લાગે.
૩. પુતીકર્મ એટલે ઉપરોક્ત હોષ વાળી વસ્તુનો શુદ્ધ વસ્તુ સાથે જરા પણ લેળ, સંસેળ કરીને આપે અને સાધુ તે લે તો હોષ લાગે.
૪. થાપીતો એટલે સાધુને માટે સ્વાપી રાખે કે અમુક વસ્તુ સાધુને માટે જ છે બીજા કોઈ વાપરવી કે ભોગવવી નહિ. આવા પ્રકારની વસ્તુ આપે અને સાધુ તે લે તો હોષ લાગે.
૫. મિશ્ર એટલે સચેત અને અચેત બેડને લેગી કરીને આપે અને સાધુ તે લે તો હોષ લાગે.
૬. પ્રોહણો પ્રોહણો એટલે આઘા પાછી કરીને સાધુને આપે અને તે લે તો હોષ લાગે.
૭. કોઈપણ વસ્તુ અંધારામાં હોય અને સાધુને વહેરાવવા સાર્દ અજવાળું કરીને વસ્તુ આપે અગર વહેરાવે અને સાધુ તે લે તો હોષ લાગે.
૮. સાધુ સાર્દ કોઈપણ વસ્તુ વેચાતી લાવીને આપે અને સાધુ તે લે તો હોષ લાગે.
૯. સાધુ સાર્દ કોઈપણ વસ્તુ ઉધાર લાવી આપે અને સાધુ તે લે તો હોષ લાગે.
૧૦. કોઈપણ વસ્તુનો અદલો અહો કરી સાધુને

આપે અને તે લે તો હોષ લાગે.

૧૧. સાધુને સામું આણ્ણીને આપે અને લે તો હોષ લાગે.
૧૨. સાધુને બારણુ ઉધાડીને આપે અને સાધુ લે તો હોષ લાગે.
૧૩. વસ્તુ ઉચ્ચી નીચી હોય તે ઉતારતાં અજયણુા થાય એવી જખાઓશી ઉતારીને સાધુને આપે અને સંધુ લે તો હોષ લાગે.
૧૪. નિર્ભળ એટલે નભળા પાસેથી છીનવીને વસ્તુ સાધુને આપે અને તે લે તો હોષ લાગે.
૧૫. પારકી વસ્તુ ધણીને પુછ્યા વગર સાધુને આપે અને તે લે તો હોષ લાગે.
૧૬. રાંધતી વખતે આંધણુમાં સાધુ મારે વધારે એરે અથવા રાંધે અથવા નાંએ અને તે લે તો હોષ લાગે.

**સાધુના યોગથી ૧૬ ઉત્પાનના હોષ.**

૧૭. સાધુ ધાવની માર્ક ખાળકને રમાણીને કોઈ વસ્તુ લે તો હોષ લાગે.
૧૮. કુતીની માર્ક ગૃહસ્થીને સગા સંબંધી વગેરેના સમાચાર કહીને સાધુ કોઈ ચીજ યાચે તો હોષ લાગે.
૧૯. નિમિત્ત વગેરે કહીને લે તો સાધુને હોષ લાગે.
૨૦. ન્યાત જત જખુાવીને એટલે હું અમુક

જાત અથવા નાતનો છું અથવા ગૃહસ્થીને  
સાધુ એમ કંઠે કે સંસાર પણે તમો અને  
અમો અમુક અમુક સગાં સથાંધી થઈએ  
છીએ એમ કહીને કોઈપણ વસ્તુ લે તો  
હોષ લાગે.

૨૧. ગરીબી ભતાવીને એટલે તમો અમોને  
નહિ આપશો તો બીજું કોણું આપશો  
એમ કહીને લે તો સાધુને હોષ લાગે.

૨૨. સાધુ વૈદપણું ભતાવીને કોઈ વસ્તુ લે  
તો હોષ લાગે.

૨૩. કોઈ કરીને લે તો સાધુને હોષ લાગે.

૨૪. માન, અહુંકાર કરીને લે તો હોષ લાગે.

૨૫. માયા, કૃપટ, કિયા કરીને લે તો  
હોષ લાગે,

૨૬. લોલ કરીને લે તો હોષ લાગે.

૨૭. આગળ પાછળ આપનારના ચુણુ ગાઇને  
લે એટલે કે તમો ઉદાર હિલના છો,  
દાનવીર છો માટે તમો આપો એમ કહીને  
યાચે તો હોષ લાગે.

૨૮. વિદ્ધા, કામણુ, વશીકરણ વયેરે કરીને લે  
તો હોષ લાગે.

૨૯. મંત્ર, વૈદપણું કરીને લે તો હોષ લાગે.

૩૦. ગોદી ચુરણુ બનાવવાનું કહીને લે તે

દોષ લાગે.

૩૧. સુભાય્ ફુલોઽપણું ખતાવીને કે તો  
દોષ લાગે.
૩૨. ગર્ભ પડાવીને કે તો દોષ લાગે.
- સાધુ શ્રાવક બંનેના ચોગથી એવણુના  
દસ દોષનાં નામો**
૩૩. શાંકા સહિત કે તો દોષ લાગે.
૩૪. સચેત (એટલે જીવ સહિત પૃથ્વી પાણી  
વળેર)થી હુથ અરડાયલો હોય તેવા પસેથી  
કે તો દોષ લાગે.
૩૫. સચેત ઉપર મૂકેલી વસ્તુ હોય તે વસ્તુ  
કે તો દોષ લાગે.
૩૬. સચેતે કરી ટાંકેલું હોય તે સાધુ કે તો  
દોષ લાગે.
૩૭. સચેતનો સ્પર્શ થતો હોય એટલે અડકીને  
રહ્યું હોય અને તે કે તો દોષ લાગે.
૩૮. આંધળા, પાંગળા\* પાસેથી કે તો દોષ લાગે.
૩૯. પૂર્ણ શસ્ત્ર પરણુભ્યું ન હોય એટલે પુર્ણ  
અચેત નહિ થયું હોય તે કે તો દોષ લાગે  
(કાચું પાડું)
૪૦. સચેત, અચેત લેગળી વસ્તુ હોય તે કે તો  
દોષ લાગે.
૪૧. અજયણું થાય તેમ નાખતાં નાખતાં કોઈપણ

વસ્તુ વહેરાવે અને તે સાધુ કે તો દોષ  
લાગે.

૪૨. તરતનું દીપેલું આંગળું હોય તે ઉપરથી  
કે તો દોષ લાગે.

હવે ખાવન આણુચાર કયા કયા તેનાં નામ  
વિભિન્ન સાથે નીચે મુજબ.

- ૧ સાધુને ઉદેશીને એટલે સાધુના નિભિ-તે આરંભ  
કરીને જે કાંઈ આહાર, પાણી, વસ્તુ, પાત્ર દવા,  
પાટ, પાટલા, સ્થાનક, ઉપાશ્રયાદિક ૧૪ પ્રકારની  
વસ્તુ અનાવી હોય તેને લોગવે તો આણુચાર લાગે.
- ૨ સાધુને ભાટે ડોધપણ વસ્તુ વેચાતી લાવીને આપે  
તેને લોગવે તો આણુચાર લાગે.
- ૩ જે ધરનાં આહાર, પાણી વગેરે પહેલે દિવસે  
વહેરાં હોય તેજ ધરનાં ખીજે દિવસે વહેરાં  
તો અણુચાર લાગે.
- ૪ આહાર, પાણી, વસ્તુ, પાતરાં વગેરે ગૃહસ્થ સામું  
આણી મૂકે ને સાધુ લોગવે તો આણુચાર લાગે.

\* નોંટઃ—(દોષ નંબર ૩૮) “આંધળા, પાંગળા હાલી  
ચાલીને વહેરાવે તો અયતના થવાનો સંભવ છે ભાટે દોષ ઉદ્ઘાટન  
જણાય છે પરંતુ જે તે રિથર રૂપે એટલા હોય તે વખતે ડાખલ  
સુભતી રોટલી તેના હાથમાં વહેરાવવા સારુ આપે અને તે  
વહેરાવે તો તે લીધાના દોષનું કારણ સાધુને નથી.”

- ૫ રાત્રે આહાર, પાણી લોગવે તો અષ્ટુચાર લાગે.
- ૬ સ્નાન કરે એટલે નહાય તો અષ્ટુચાર લાગે.
- ૭ સુગંધી પદાર્થો, અતાર, તેલ, કૂતુ આહિ લોગવે તો અષ્ટુચાર લાગે.
- ૮ પુણ્યાદિકની માળા લોગવે તો અષ્ટુચાર લાગે.
- ૯ વાયરો (પવન) લેવા માટે વિંઝણો અથવા પંખો વગેરે હુલાવે તો અષ્ટુચાર લાગે.
- ૧૦ આહાર, પાણી, લોજષ્ટુદિક રાત્રે વાસી રાખે તો અષ્ટુચાર લાગે.
- ૧૧ ગૃહસ્થના વાસષ્ટુમાં રમે તો અષ્ટુચાર લાગે.
- ૧૨ રાજ રાજગાઢીએ એસે તે વખતનાં સરસ આહારાદિક રાજપિંડ લોગવે તો અષ્ટુચાર લાગે.
- ૧૩ સદાત્રત, દાનશાળા ધમીદા વગેરેનાં આહાર પાણી દવા વગેરે કેદીપણ વસ્તુ લે તો અષ્ટુચાર લાગે.
- ૧૪ શરીર પર તેલાહિ ચોણે તો અષ્ટુચાર લાગે.  
(કારષુથી છુટ)
- ૧૫ હાંત પખાણે તો અષ્ટુચાર લાગે. (કારષુથી છુટ)
- ૧૬ ગૃહસ્થને સુખ શાતાદિક પૂછે તો અષ્ટુચાર લાગે.
- ૧૭ અરિસા એટલે કાચમાં મોઢું જુએ તો અષ્ટુચાર લાગે.
- ૧૮ જુગાર રમે તો અષ્ટુચાર લાગે.
- ૧૯ ચોપાટ, પાનાં વગેરે રમે તો અષ્ટુચાર લાગે.
- ૨૦ માથા ઉપર છત્રી રાખે તો અષ્ટુચાર લાગે.

- ૨૧ વૈદપણું કરે એટલે ગૃહસ્થને રોગાદિક ઉપર ગોળી ચુલ્હું વગેરે ઓપધ ખતાવે તો અષ્ટાચાર લાગે.
- ૨૨ પગમાં ખૂટ વગેરે પહેલે તો અષ્ટાચાર લાગે.
- ૨૩ અગિનનો આરંભ સમારંભ કરે તો અષ્ટાચાર લાગે.
- ૨૪ જેના થકાનમાં ઉત્તર્યા હોય તે ધર્મીના ધરનાં આહાર, પાણી, દવા વગેરે હે તો અષ્ટાચાર લાગે.
- ૨૫ ગૃહસ્થના આસન, પદંગ, માંચા, વગેરે ઉપર બેસે તો અષ્ટાચાર લાગે.
- ૨૬ રોગી, તપસ્વી, દુર્ખિંગ એટલે અશક્ત એ ત્રણુ સ્થિવાય કારણુ વગર ગૃહસ્થના અંતર ધરમાં (એટલે એ મકાનની વચ્ચમાનું મકાન) બેસે તો અષ્ટાચાર લાગે.
- ૨૭ મેલાદિક દૂરાંકરના સાડ શરીરે પીઠી વગેરે ચોળાવે તો અષ્ટાચાર લાગે.
- ૨૮ ગૃહસ્થની વૈયાવચ કરે તથા ગૃહસ્થ પાસે વૈયાવચ કરાવે તો અષ્ટાચાર લાગે.
- ૨૯ પેલાની જાતની ઓળખાણુ કરાવીને એટલે હું અમુક જાતને છું તમે અમારા અમુક સાંસાર પણે થાગો છો એમ કહી આહારાદિક વહેલે તો અષ્ટાચાર લાગે.
- ૩૦ મિશ્ર પાણી એટલે કંઈક કાચું અને કંઈક પાકું ઓવું લેળસેળવાળું લોખવે તો અષ્ટાચાર લાગે.

- ૩૧ રોગ થયો હોય ત્યારે ગૃહસ્થીનું શરણું ઠંડું છુટું તો અણુાચાર લાગે.
૩૨. મૂળા (૩૩) આદુ (૩૪) શેરડીના કાચા કટકા (૩૫) કંદ (૩૬) મૂળ (૩૭) એજ (૩૮) ઝળ (૩૯) સંચળ (૪૦) સિંધવ (૪૧) કાચું મીઠું (૪૨) સસુદ્રનું મીઠું (૪૩) ખાડીનું મીઠું (૪૪) કાળું મીઠું ઉપરોક્ત નંબર તર થી નંબર ૪૪ સુધીની વસ્તુ સચેત ભોગવે તો અણુાચાર લાગે.
- ૪૫ ધૂપ કરે કરાવે તો અણુાચાર લાગે.
- ૪૬ વગર કારણે જાણી જેઇને જિલાટી કરે તો અણુાચાર લાગે.
- ૪૭ વગર કારણે ગુણ્ય પ્રદેશ, ધૂવે તો એણુાચાર લાગે.
- ૪૮ વગર કારણે રેચ એટલે જુલાખ વે તો અણુાચાર લાગે.
- ૪૯ વગર કારણે આંખમાં કાજળા, અંજન, સુરમે વગેરે આંજે તો અણુાચાર લાગે.
- ૫૦ દાતણું કરે વા મસ્ક વગેરેથી રંગે તો અણુાચાર લાગે.
- ૫૧ તેવાદિક કરી શરીરતું મદ્દન કરે તો અણુાચાર લાગે.
- ૫૨ શરીરની શુશ્રૂષા કરે તો અણુાચાર લાગે.

\* નોટ નંબર ૫ અને નંબર ૧૦ બાયતમાં નંબર ૫ગાં સાધુ રાતે આહાર, પાણી આદિ ભોગવે તો અણુચાર લાગે એમ કહેલ છે. અને નંબર ૧૦માં આહાર, પાણી, ભોજનાદિક રાત્રે વાસી રાખે તો અણુચાર લાગે એમ કહેલ છે મારે ઉપરોક્ત સૂત્ર અમાણે આહાર, પાણી, દવા વગેરે સાધુને રાત વાસી રાખવાં કે ભોગવન્નાં કહેયે નહિ. જે સાધુ વાસી રાખે અથવા ભોગવે તો નિશીત સૂત્રના ૧૦મા ઉદેશામાં ચોમાશાદં આવે એમ દર્શાવેલ્ય છે વળી દર્શાવેકાલીક સૂત્રના છઠ્ઠા અધ્યનમાં ૨૫૪ જાણુંયું છે કે તેવા સાધુને, સાધુ નહિ પણ ગૃહસ્થ માનવા.

આ ઉપરાત કોઈ આધુનિકિ વગેરે અંથનો આધાર લઈ પોતાને સગવડ પડતી વસ્તુઓ જેવી ને કરતુરી, અશીષુ, ત્રિકળા ઝરી ક્રોપણ, કંદુકરીઆતું, લાંગ વગેરેને અણુઢારી ગણીને, રાત વાસી રાખે અથવા ભોગવે તો ઉપરોક્ત શાસ્ત્રની આજ્ઞાનો લાંગ થાય અને તેથી ચારિત્ર નાશ પામે. ગારે ઘ્યાલ રાખવો. જોઈએ કે કોઈ અંથકારે પોતાને દ્રાવતી અથવા મનગમતી વાત લખી જાણુવી હોય પણ તે વિતરાગ પ્રલુનાં વચન સૂત્રથી વિશેષ હોય તો તે માનવી નહિ.

\* નોટ નંબર ૧૦—એમ તો રાજાદિક ને ધેર ગોચરી જતું કહેયે. શાખ-સૂત્ર અંતગડ, વર્ગ, ડ અધ્યયન ૮. દેવકીના છાંએ દીકરા સાધુ હતા તેમણે શ્રીકૃષ્ણને ધરેથી મોદક લાડુ વહોયાં હતા.

### કિંતિ બાવન અણુચાર સંપૂર્ણ

ઉપરોક્ત હોથ ટાળીને આહાર પાણી અહંકુંકરનાર સાધુ અને એ અમાણે આપનાર ગૃહસ્થ એ બન્નેની.

શુદ્ધ ગતિ ભગવાને બતાવી છે. શાખ સૂત્ર દશવૈકાલિક, અધ્યયન ૫, ઉહેશો ૧ ગાથા ૧૦૦, શુદ્ધ ગતિના દિચ્છક શુદ્ધ સાધુ શુદ્ધ નિર્દેષ આહાર પાણી લે અને સમજુ આપક તેજ મુજબ આપે અથવા વહેરાવે કારણું અશુદ્ધ આહારાદિક લેવાવાળા અને આપવાવાળા જન્નેને મહા હુઃખનાં કારણ પ્રભુજુઓ બતાવ્યા છે.

પ્રથમ અશુદ્ધ આહાર લેવાવાળાની શું દશા થાય તે સૂત્ર શાખ સાથે નીચે લખીએ છીએ.

ઉત્તરાધ્યયન, અધ્યયન ૨૦, ગાથા ૪૭માં કહ્યું છે કે ઉદ્દેશિક એટલે સાધુનો ઉહેશ રાખી બનાવેનું હોય તે, સાધુ માટે વેચાતી કોઈપણ વસ્તુ આણી હોય તે, નિત્ય પિંડ એટલે રોજ રોજ એક ઘરના આહાર પાણી લેવાં તે, ઈત્યાદિક દોષની અંદર કોઈપણ દોષવાલી વસ્તુ સાધુ અહુણું કરે તો તે સાધુ અર્થિની માર્ક સર્વલક્ષી છે. અને તે અહીંથી મરી હુંગાતિમાં જાય છે.

દશવૈકાલિક, અધ્યયન ૬માં ૧૮ સ્થાનક સંયમથી ભ્રષ્ટ થવાનાં બતાવ્યાં છે. તેમાંનું ૧૩મું સ્થાનક એ છે કે આહાર ઉપાક્રમ, વચ્ચ, પાત્ર એ ચારે સાધુ માટે જ્ઞાવેલાં હોય અથવા વેચાતાં આણેલાં હોય, તેને જે અહુણું કરે તે સંયમથી ભ્રષ્ટ છે.

ભગવતી, શતક ૧, ઉહેશો ૮, ઐલ ૧૭માં કહ્યું છે કે આધા કર્મી એટલે સાધુ માટે ભાવ લેગા

કરી જનાવેલ હોય તે, જે કોઈ શ્રમણ નીચંથ લોગવે તો આયુષ્ય વળ્ણને સાંત-કર્મના બંધન ગાઢાં બાંધ-વાવાળા છે અને તે અહીંથી મરીને ચતુર્ગતિર્દ્વાંસારમાં અનંતકાળ સુધી રખડશે ધત્યાદિક અનેક દાખલા છે કે જેમાં અશુદ્ધ આહાર, પાણી લોગવવા-વાળા ધણીની હુદ્દીશા વલ્લંઘની છે.

હવે શ્રમણ નીચંથને આહાર, પાણી વગેરે ૧૪ પ્રકારનું દાન અશુદ્ધ જાણી જેઇને આપે, તે દાતારની હુદ્દીશા સૂત્ર શાખથી વલ્લંઘની છીએ.

પ્રથમ તો ૧૪ પ્રકારનાં દાનની અંદરની કોઈપણ વસ્તુ શ્રાવક જાણી જેઇને અસુજતી વહેરાવે અથવા આપે તો તે આપનારનું બારમું પ્રત તૂટે, કારણ કે બારમાં પ્રતમાં શ્રાવકને અસુજતી વસ્તુ સાધુને આપવાનાં પરચાણણ હોય છે. વળી અસુજતા આહારાદિક આપવવાવાળા સાધુના પ્રતના લુંટારા કહેવાય. વળી ત્રીજ હુદ્દીશા અસુજતા અને અષુદ્ધાભિકૃત આહારાદિક વહેરાવવાવાળા અદ્વય આયુષ્ય બાંધે એમ ઠાણુંગ સૂત્રના ત્રીજ ઠાણુંમાં કુછું છે અને લગવતી સુત્ર શ. ૫ ઉદ્દીશા ૬ માં અદ્વય ઉત્કૃષ્ટ આયુષ્ય (એટલે અડતાળીશ (૪૮) મિનિટમાં ૬૫૫૩૬ વખત ૧૦-મે અને મરે તે) બાંધે ધત્યાદિક અનેક દાખલામાં અશુદ્ધ આહાર, પાણી વગેરે ૧૪ પ્રકારનાં દાન આપવવાવાળા ધણીની હુદ્દીશા વલ્લંઘની એ. તેથી આપવવાવાળા દાતારે પોતાને માટે

બનાવેલી વસ્તુમાંથી યથાશક્તિ ખંતોષ કરી ધ્યાનપૂર્વક-  
વહેારાવવું અથવા આપવું તેમજ યાચવાવાળા સાધુએ  
વહેારતાં દરેક વખતે પૃથ્રી સારી રીતે કરી લેવું.  
આનું નામ એવણ્ણા સમિતિ છે.

**ગ્રંથઃ**—કોઈ ગામમાં ક્ષાવકના એ ત્રણજ ધર હોય  
ત્યાં દસ વીસ સાધું વિહાર કરતાં કરતા  
આઠ્યા તેવે અવસરે આધાકર્મી આહાર પાણી  
વહેારવાં અથવા લોગવવાં કે નહિ ?

**ઉત્તરઃ**—પ્રથમ તો આવવાવાળા સાધુએ પહેલાંથી  
તપાસ કરી વિચારીને આવવું જોઈએ. ગામમાં  
કદ્વપતી ગોચરીનાં ધર થોડાં હોય તો બધાએ  
ત્રણ ત્રણના સાથ કરી જુદા જુદા દિવસોએ  
આવવું પણ બધાંએ એકી સાથે આવવું નહિ.  
ધારો કે કોઈ કારણુને લાધે આવવાનું થયું  
તો તે ગામવાળા ત્રહસ્થોને પહેલાંથી જણાવી  
દેવું કે સાધુએ માટે વધારે કાંઈ પણ  
બનાવવું નહિ કારણુંકે અમારે માટે  
બનાવેલી વસ્તુ વહેારવાના કે લોગવવાના  
અમોને પર્યખખાણું છે છતાં જે તમો બના-  
વશો તો તમારા ધરનો માલ શુમાવીને  
હુર્ગતિના અધિકારી થશો. આ સુજખના  
અશુદ્ધ આહાર વહેારાવવાનાં માડાં ઝેણ  
પ્રથમ પ્રરૂપવાં એમ કહેવાથી કોઈ શ્રાવકુ

સાધુ સાર્થકે ઈ પણ વસ્તુ બનાવશે નહિં  
 છતાં કોઈ રાગાંધ થઈ બનાવે અને તેની  
 ખબર સાધુને પડે તો તે ધરે તેઓએ ગોચરી  
 જવું નહિં. આ પ્રમાણે સાધુએ પોતાનાં વ્રત  
 સાચવવાં. કોઈ પણ પ્રકારે અમુક બહાનાનું  
 અથવા કારણું નામ દઈ અશુદ્ધ આહાર  
 પાણી લોગવવાં નહિં. જેમ કષ પડે તો પણ  
 પોતાનું શિયળ સાચવવા દ્રઢ રહે તે સતી  
 કહેવાય તેમ સાધ પણ આવા અવસરમાં  
 અશુદ્ધ આહાર પાણી નહિં વહેરે તો તેમાં  
 સાધુપણું અખંડ જળવાય. આવા અવસરમાં  
 ઉપવાસાદિક કરીને પોતાના વ્રતને સાધ અખંડ  
 રાખી લે તે જ ખર્દસાધુ પણું કહેવાય. જે  
 આવા અવસરને વખતે અશુદ્ધ આહાર પાણી  
 સાધુ લે અને પોતે લીધેધાં વ્રત લાંગે તે  
 તેવા વ્રતના ખંડન કરનાર સાધુ સાધુજ ન  
 કહેવાય પરંતુ તે વ્રતના ભાગલ બષ્ટાચારી  
 કહેવાય ડાહ્યા હોય તે વિચારી જે જે.

**પ્રશ્ન છથો :—**આહાન લંડમતનીખેવણા સમિતિ  
 એટલે શું ?

**ઉત્તર :—**આહાન લંડમતનીખેવણા સમિતિ એટલે  
 મુસ્તક, પાનાં, વસ્ત્ર, પાતરાં, વગેરે દિવસમાં  
 તો જેઠ જેઠને યતનાપૂર્વક લેનાં મૂકવાં

અને રાતે પુંજુને થહણુ કરવાં મુકવાં પણ  
વગર જોયાં મૂકવાં નહિ. ઉચ્ચેથી પટકવાં  
નહિ.

### ઇતિઆદાન લંડમત નીખેવણું સમિતિ

પ્રશ્ન પ્રમેષો :— ઉચ્ચાર પાસવણુ સમિતિ શાટલે શું ?

ઉત્તર :— ઉચ્ચાર પાસવણુ સમિતિ એટલે ઠલે  
માતરે જીવજંતુ, લીલાતારી વગરની જગ્યામાં  
નિર્વિઘ્ન જવું અને પાછલા પહોંચે એ ધડી  
હિવસ બાઢી રહે ત્યારે રાત્રિમાં પરઠવાને  
માટે જગ્યા પડીલેછી હિવસમાં એક વખત  
તડકો આવે એવી જગ્યામાં પરઠવું.

### ઇતિ પાંચમી સમિતિની વ્યાપ્યા

પ્રશ્ન :— મન ગુટિપ એટલે શું ?

ઉત્તર :— મન ગુટિપ એટલે સાવધ, સંસારિક કામ-  
માંથી મન ગોપવીને એટલે રોકીને રાખવું પણ  
સંસારિક કામમાં મન પ્રવતાવિવું નહિ તે  
મન ગુપ્તિ કહેવાય.

પ્રશ્ન :— વચન ગુપ્તિ એટલે શું ?

ઉત્તર :— વચન ગુપ્તિ એટલે સાધધંવચન ગોપવીને  
એટલે રોકીને રાખવું પણ સાવધ પાપકારી  
વચન સાધુ ઓદે નહિ તે વચન ગુપ્તિ કહેવાય.

પ્રશ્ન :— કાય ગુપ્તિ એટલે શું ?

ઉત્તરઃ—કાયગુપ્તિ એટલે સાવધ પાપવાળા કાર્યથી  
કાયા ગોપવી એટલે રોકીને રાખવી પણ  
પાપવાળું કોઈ પણ કાર્ય કાયાથી કરવું  
નહિ. તે કાયાગુપ્તિ કહેવાય.

ધતિ પાંચ સમિતિ અને ત્રણુ ગુર્તિ વ્યાખ્યા સંપૂર્ણ

ઉપરોક્ત પાંચ મહાત્રત, પાંચ સમિતિ; અને ત્રણુ  
ગુપ્તિ એ તેર બોલ ખરી રીતે સંપૂર્ણપણે પાણે તેજ  
સાધુ અને તેજ સ્વપરના કલ્યાણ કરનારા નીચાંથ શુરૂ  
કહેવાય. આ વ્યાખ્યા શુરૂતત્વ સમજવા સારુ આત્માથી  
પુરૂષને ધણી ભદ્રગાર અને સંતોષજનક છે એ નિવિં-  
વાદપણે કહી શકાય કારણુ કે ઉપલી બધી બાબતો  
શાસ્ત્રના કુરમાન મુજબ હોવાથી કેદ વાંધેા કાઢી  
શકે જ નહી પણ આજે માનવ જલિનો સ્વભાવ કુદ-  
રતી શાંકાશિળ હોવાથી કેટલાએકને એવી શાંકા થઇ  
આવે કે આજનો જમાનો અને હાલનો દેશકાળ જોતાં  
આવા કઠીણુ મહાત્રત કોઈથી પળાય નહિ કારણુ કે  
જમાનો બહલાઈ ગયો છે અને શરીર સંધયણુ પણ  
ચોથા આરાના સાધુઓ જેવાં રહ્યાં નથી.

દિવસે દિવસે બળ પરાકમની સ્થિતિ નભળી હોવાથી  
આરિત્ર પણ તેવાજ પ્રમાણમાં પાણી શકાય એવું સામાન્ય  
રીતે ધણુા માણુસોનું ધારવું છે પણ જે શાંકાદિથી  
વિચાર કરવામાં આવે તો ઉપરોક્ત શાંકા કરવાનું  
કાંઈજ કારણુ રહેતું નથી. કારણુ કે અગવતી સૂત્રના

૨૦ મા શતકમાં પ્રલુચે ફરમાયું છે કે એકવીશે  
 હૃદર વરસ સુધી; માહિં તીર્થ આવશે. વળી ઉત્તરા-  
 ધ્યયન સૂત્રના ૧૦માં અધ્યયનમાં કહ્યું છે તેનો: લાભાર્થ  
 એ છે કે હે ગૌતમ! પાંચમા આરાના આત્માર્થી  
 કાંચ લુચો હશે તે એમ કહેશે તે આ લન મહ્રગ  
 અણા તીર્થિકર હેવેનો પ્રદેપેત છે માટે આપણે આ  
 રસ્તે ચઢી અપ્રમાદપણે વિચરો એમ નકઢી કરી ધણા  
 લુચો શુદ્ધ આચાર પાળી આત્મ કલ્યાણ કરશો. હુચે  
 આ ઉપર આપેદા દ્વારા ઉપરથી ખુલ્લી રીતે ચિદ્ધ  
 ચાય છે કે પાંચમા આરાના છેડા સુધી આત્માર્થી  
 લુચો થશે અને શુદ્ધ સાધુયણું પાળશો. તો પછી એમ  
 કેમ કહેવાય કે જમાનાને લીધે સંપૂર્ણ રીતનું  
 સાધુયણું ન જ પણ. વાંચક! જમાનો તો અનાહિકા-  
 જથ્થા બદલાતો રહે છે પણ તેને લીધે સાધુયણું  
 પાળવામાં પ્રલુચે કાંઈ છુટ જુદી આપો નથી એટલે કે  
 કાળઆશી મર્યાદા બાંધેત નથી. વિચારીને જોવામાં  
 આવે તો શાસ્કારે જીવટી સખત મર્યાદા બાંધી છે.  
 જેમકે ચોથા આરામાં ૨૨ (બાનીસ) તીર્થિકરના  
 સાધુયાને ૪ (ચાર) મહાન્ત પાળવાનાં હતાં (ખી  
 ત્યાગ અને પરિશ્રહના ત્યાગને એક જ મહાન્તમાં  
 ગણુનામાં આવેલ) તેને બદલે મહાવીર પ્રલુચે પાંચ  
 મહાન્ત પાળવાનું ફરમાન કર્યું વળી બાવીશ તીર્થિ-  
 કરના સાધુને પંચવણાં વલ્લ અપતાં હતાં તેને બદલે  
 બીર પ્રલુચે એક શૈતવણુંનાં જ વલ્લ વાપરવાની સાધુને

આજા એપી ઈત્યાદિક અનેક મર્યાદા ચોથા આરાના સાધુની અપેક્ષાએ પાંચમા આરાના સાધુઓને માટે વિશેષ કડકાઈથી બાંધવામાં આવી છે કારણ કે ત્રિકાળ જાની પ્રભુ પોતે જાણુત્ત હતા કે પાંચમા આરાના સાધુઓમાં વહેજડતા વિશેષ રહેશે અને તેથી સખત મર્યાદાની જરૂર છે. વળી એ આવી સખતાઈ કરવામાં આવશે નહિ તો તક્કું માંચી તક્કું કાઢશે. માટે પાંચમા આરાના શેષ કાળ સુધી શુદ્ધ સાધુપણું પાળી શકાય એવા ધરાદાથી આચારંગ, દશપૈકાલિક વિગેરે સૂત્રમાં પૂર્વે વલ્લંઘ્યા તે તેર બોલ બતાવ્યા છે, કે જેથી આત્માર્થી સાધુ પૂર્વે બતાવ્યા તે તેર બોલ પાળવામાં જમાનાનો આશ્રયે લઈ, જરાએ વાંધો લઈ શકે નહિ અને ખરું જેતાં આત્માર્થી લે પણ નહિ. તેમ છતાં એ હોઈ પુછુગળા નંદી બનીને દેશકાળ અથવા જમાના ઉપર વાત મૂકીને ચારિત્ર પાળવામાં ધૂટ લે અને શિથિ-લાચારપણું ધારણું કરે તે શાસ્ત્ર દ્રષ્ટિએ સાધુએ કહેવાય જ નહિ, પણ આજાના ઉત્થાપક કહેવાય, અને તેથી તેવા માટે શાસ્ત્રકારે પહેલેથીજ સૂચના આપી છે કે શુદ્ધ સાધુપણું નહિ પાળવાવાળાઓ દેશ કાળનું નામ લઈ આવું આતું કહેશે તે બાબત આચારંગ સૂત્રના અધ્યયન દ ઉદેશ રૂમાં દર્શાવેલ છે તેનો ભાવાર્થે એ છે કે “પાંચમા આરામાં ઢીલા ભાગલ સાધુ હશે તે એમ બોલશે કે પાંચમા આરામાં પૂરેપૂરું સાધુપણું પાળી શકાશે નહિ” અહીં શાસ્ત્રકારે રૂપીઠ જણાવે છે કે

દીલા ભાગલ હુણે તે સાધુપણું સંપૂર્ણ રીતનું પાળણે  
નહીં અને એમ કહેણે તે સિવાય બીજા કોઈ કહેણે  
નહિં, કારણ કે યાંચમો આરો છે તે કંઈ સાધુપણું  
યાળતો નથી. સંયમ પાળવાવાળો તો પોતાને  
આત્મા છે. સાધુના શુદ્ધ ચારિત્ર પાળવાનાં પણ  
ખૂબ અથવા ભાવ હોય તો આરો કંઈ આડો  
આવે નહિં, પણ જેના આત્મામાં ચારિત્ર પાળવાવા  
ભાવજ ન હોય તેને તો આજના જમાનાનું નામ  
લઈ છુટા થવું અને શિથિલાચારી બનવુંએ એક બહુજ  
સહેલી વાત છે તેને માટે આ મદદકારી બહાનું છે.  
અને આ મુજબ પ્રરૂપવાથી હાલની કેટલીક લેણી ગ્રા  
બિચારી માની પણ લે છે કે સાધુ મહારાજ ચારિત્ર  
પાળવામાં દીલા ચાલે છે તે કંઈ સાધુ મહારાજનો હોણ  
નથી પણ આ જમાનોજ એવો છે. પરંતુ આ  
ખાબતમાં ન્યાયપૂર્વક ડહાપણુથી વિચારવામાં આવે તો  
નહિં. પાળવાવાલા માટે જમાનો બિચારો શું કરે? શુદ્ધ  
ચારિત્ર નહિં પાળવાવાળાઓએ તો તીથેંકરોની હ્યાતીમાં  
થણું શિથિલપણું ચલાંયું છે તેના દાખલા નીચે  
સુજાય છે.

- (૧) શ્રી આદિનાથ ભગવાનના કેટલાએક સાધુએ  
શરૂઆતમાં આહાર પાણી ન મલવાથી શિથિલાચારી  
બની ધર્મ પતીત થયા હતા.
- (૨) શ્રી પાર્શ્વનાથ ભગવાનની (૨૦૧) સાંદ્રી (અયો)  
સાધુપણું હાથ પગ વખાદિ ધોવાનો અનેક હોણ

લગાવી ચારિત્ર વિરાધક થઈ હતી. શાખ-સૂત  
શાતાસુતરકંધ ર.

- (૩) વળી ગગાચાર્યના શિષ્ય ગલોહાર બધા જે ગે  
અવનીત થયા. શાખ-ઉત્તરાધ્યન, અધ્યન રજી
- (૪) અરિષ્ટ નેમનાથ લગવાનના વખતમાં શેલકરાજ  
રૂપિ શિથિલાચારી થયા. જ્ઞાતા સૂત્ર અધ્યન પ.
- (૫) લગવાન મહાવીર સ્વામીની હૃદાતીમાં જમાલ  
ગોશાળો વગેરેએ શિથિલાચારી બની અનેક શાખ  
વિરુદ્ધ પ્રદૃપણું કરી હતી. શાખ-સૂત્ર લગવતી શ  
૧૫ ઈત્યાદિક ચોથા આરાના ઘણું દ્વારા દ્વારા છે.

આ ખાણતમાં વિચાર કરવાથી જણ્ણાઈ આવે છે  
પાંચમા આરાનો દોષ કાંઈ નથી, દોષ તો નહિ  
પાળવા વાળાનો છે. જે પાંચમા આરાનો હો  
ઢાય તો એવી માન્યતાવાળાના હિસાબે ચોથા આરામ  
પૂર્વે કહ્યા તેવા શિથિલાચારી નહિ હોવા જેઠાએ.  
વખતે બધા શુદ્ધ સાધુ હોવા જેઠાએ અને જે એમજ  
હોત તો કહી શકત કે અગાઉ જ્યારે શુદ્ધ સાધુપણું  
પળાતું હતું ત્યારે બધા શુદ્ધ સાધુ હતા પણ આવ  
શુદ્ધ સાધુપણું પળાય નહિ એટલે બધા શિથિલાચાર  
થયા અને થાય છે, પણ ખરી વાત તો એ છે કે ચોથ  
આરામાં શુદ્ધ ચારિત્ર નહિ જ પાળયું તેમ હાલન  
પાંચમા આરામાં પણ હેટલાએક નંહિ પાળવાવાળ  
નથી જ પાળતા અને પાળવાવાળા છે તે તો તે ૧૫

તે સાધુઓ જેમ શુદ્ધ ચારિત્ર પાળતા હતા તેમ નજરે પણ સારી રીતે પાળે છેજ.

પૂર્વે વર્ણુંયા તે તેર બોલ સંપૂર્ણપણે પાળવા-વાં વર્તમાનમાં સાધુઓ શોધવાથી નજરે આવે તેમ એખને તેએને જોવાથી અગર મળવાથી નિશ્ચય થાય છેક આજના જમાનામાં પણ શાસ્ત્રોક્ત પ્રમાણે પાળવાળા સાધુઓ છેજ. જેમ શાસ્ત્રમાં કરમાવેલ છે કે જો સાધુને મુખ્ય કરી એટલે એકને શુરૂ માની સુધીએ વિચરવું તેજ પ્રમાણે તેરાપંથી સમાજમાં વર્તમાનમાં આશરે પડ્ય સાધુ સાધી છે તે બધા ખૂબ મહારાજાલધિરાજ શ્રી તુલસી રામજી સ્વામીને શુરૂ માનીને વિચરે છે તેમની આજા સિવાય કોઈ પણ સાધુ સાધી કોઈ પણ ડેકાણે ચોમાસું કરી શકે નહિ. શેષ-કરી રહી શકે નહિ, દીક્ષા આપી શકે નહિ, ચેવા ચે. પોતપોતાને નામે કરવાના બધા સાધુ સાધીએને પચ્ચખાણુ હોય છે, સાધુને સારુ સ્થાનક, જીઃશ્રય કાયમના સ્થાપિત રાખ્યા હોય અથવા કોતા લીધા હોય અથવા બંધાવ્યા હોય તેમાં એ સાધુને જિતરવાના પચ્ચખાણુ હોય છે. મુસ્તક, ખાંના લંડારો કરી કે રાખી શકાય નહિ. જે હોય તેમાત પોતાની પાસેજ સાથે રાખવાં અને તે પણ વર્તમાન આચાર્યની નિશ્ચાયે. પોતપોતાની માલિકી કુની રાખવાના પચ્ચખાણુ હોય છે. ચોમાસું જિતર્બાઈ એ દેખે આજુ સાંકી ને જિમામાં આચાર્ય ગુરુ

વગાવી ચારિત્ર વિરાધક થઈ હતી. શાખ-સૂત્ર  
જ્ઞાતાસુતરકંધ ર.

- (૩) વળી ગગાચાર્યના શિષ્ય ગલોહાર બધા જેમ  
અવનીત થયા. શાખ-ઉત્તરાધ્યન, અધ્યન ૨૭.
- (૪) અરિષ્ટ નેમનાથ લગવાનના વખ્તમાં શેલકરાજ-  
રૂપિ શિથિલાચારી થયા. જ્ઞાતા સૂત્ર અધ્યન ૫.
- (૫) લગવાન મહાવીર સ્વામીની હૃયાતીમાં જમાલી  
ગોશાળેણે વગેરેએ શિથિલાચારી બની અનેક શાખ  
વિરુદ્ધ પ્રદ્રષ્ટા કરી હતી. શાખ-સૂત્ર લગવતી શ.  
૧૫ ઈત્યાદિક ચોથા આરાના ઘણ્યા દાખલા છે.

આ ખાખતમાં વિચાર કરવાથી જણાઈ આવે છે કે  
પાંચમા આરાનો દોષ કાંધ નથી, દોષ તો નહિં  
પાળવા વાળાનો છે. જે પાંચમા આરાનો દોષ  
હોય તો એવી માન્યતાવાળાના હિસાએ ચોથા આરામાં  
ચૂંકે કદ્યા તેવા શિથિલાચારી નહિં હોવા જોઈએ. તે  
વખ્તે બધા શુદ્ધ સાધુ હોવા જોઈએ અને જે એમજ  
હતા તો કહી શકત કે અગાઉ જ્યારે શુદ્ધ સાધુપણું  
પળાતું હતું ત્યારે બધા શુદ્ધ સાધુ હતા પણ આજે  
શુદ્ધ સાધુપણું પળાય નહિં એટલે બધા શિથિલાચારી  
થયા અને થાય છે, પણ ખરી વાત તો એ છે કે ચોથા  
આરામાં શુદ્ધ ચારિત્ર નહિં જ પાળયું તેમ હાલના  
પાંચમા આરામાં પણ ફેટલાએક નહિં પાળવાવાળા  
નથી જ પાળતા અને પાળવાવાળા છે તે તો તે વખ-

તના સાધુઓ જેમ શુદ્ધ ચારિત્રયાળતા હતા તેમ અત્યારે પણ સારી રીતે પાળે છેજ.

પૂર્વે વર્ષોંથાં તે તેર બોલ સંપૂર્ણપણે પાળવાણા વર્તમાનમાં સાધુઓ શોધવાથી નજરે આવે તેમ છે અને તેઓને જેવાથી અગર મળવાથી નિશ્ચય થાય છે કે આજના જમાનામાં પણ શસ્ત્રોક્ત પ્રમાણે પાળવાણા સાધુઓ છેજ. જેમ શાખમાં કરમાવેલ છે કે એક સાધુને મુખ્ય કરી એટલે એકને ગુરુ માની સાધુએ વિચરવું તેજ પ્રમાણે તેરાપંથી સમાજમાં વર્તમાનમાં આશરે પડ્ય સાધુ સાધી છે તે બધા ખૂલ્ય મહારાજાન્ધિરાજ શ્રી તુલસી રામજી સ્વામીને ગુરુ માનીને વિચરે છે તેમની આજા સિવાય કોઈ પણ સાધુ સાધી કોઈ પણ ડેકાણે ચોમાસું કરી શકે નહિ. શેષકાળ રહી શકે નહિ, દીક્ષા આપી શકે નહિ, ચેતા ચેલી પોતપોતાને નામે કરવાના બધા સાધુ સાધીઓને પચ્ચયખાણુ હોય છે, સાધુને સારુ સ્થાનક, જીપાત્રય કાયમના સ્થાપિત રાખ્યા હોય અથવા વેચાતા લીધા હોય અથવા બંધાંયા હોય તેમાં આ સાધુને જીતરવાના પચ્ચયખાણુ હોય છે. પુરુષક, પાનાંના ભંડારો કરી કે રાખી શકાય નહિ. જે હોય તે પોત પોતાની પાસેજ સાથે રાખવાં અને તે પણ વર્તમાન આચાર્યની નિશ્ચાયે. પોતપોતાની માલિકી કરીને રાખવાના પચ્ચયખાણુ હોય છે. ચોમાસું જીતરાં ખરી દરેક ભાર્ણુ સાધી જે છિસામાં આચાર્ય ગુરુ

મહારાજ વિચરતા હોય તે તરફનો વિહાર કરીને તેમની હુલ્લરીમાં હાજર થાય છે, આચાર્યનાં દર્શાન કયો વગર તેઓના હુકમ સિવાય અન્ય ક્ષેત્રમાં કોઈ સાધુ સાધ્વી વિચરતાં નથી આચાર્યના દર્શાન કરી, જે જે ગામોમાં બે જે સાધુ સાધ્વી વિચર્યાં હોય તેનું લીસ્ટ આચાર્યને બતાવવામાં આવે છે. આવા લીસ્ટમાં સાધુને વિગતવાર બધી હકીકટ વખતી પડે છે કે અમુક ગામમાં આટલા દિવસ રહ્યા, અમુક ગામમાં અમુક ધ્યીનાં આટલાં કષણાં જાચ્યાં, અમુક ગામમાં શરીર સબધી કરણું ને લીધે સાંજથી વખતે આટલા દિવસ ગરમ આહુરની ગોચરી કરી તેની પાચ વિગય આટલા દિવસ ટાલી સાધુ સાધ્વીને એક ગામમાં આચાર્યના હુકમ સિવાય શોષકાળ વા ચોમાસામાં લેગા રહેવું નહિ, ઈત્યાદિક અનેક મર્યાદા તેરાપથ્ય પ્રચારક લીક્ષુ-અણીએ બાધેત છે અને તેને લીધે શાસ્ત્રોક્ત પ્રમાણે પાંચ મહાશ્રદ્ધ, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ તેર ઓથ સાપુણુંપણે પાળવામાં આજના જમાનામાં પણ જરાયે વધિા આવતો નથી, જે સુજાય મહાવીર સ્વામી ચારિત્ર પાળવાનું સાધુએને ઝરમાવી ગયા છે તે સુજાયનું ચારિત્ર સારીરીતે પળાય છે અને તેથી પાંચમાં આરામાં શાસ્ત્રોક્ત પ્રમાણે શુદ્ધ સંયમ નાડ જ પળાય એવી શંકા લાવવાનો સવાલ ઉલેલો રહેતો નથી. એક શુરુની આજામાં ચાલવવાળા અને શાસ્ત્રોના ઝરમાન સુજાય પાળવાળા સાધુ આંકે પણ પ્રત્યક્ષપણે નજરે

એવામાં આવે છે. ડાદ્યા હોય તે ખાત્રી કરી જેશે.

**પ્રશ્નઃ—**કેટલાક કહે કે કે ઉપરોક્ત તેર પોલ  
પાળે છે કે નહિ તેની ખાત્રી કરીને શું કરવું  
છે ? જેણે ધરણાર, બાયડી, છોકરાં, માતા  
પિતા બધાને છોડ્યાં તેઓ તો આપણા કરતાં  
સારાજ છે, પછી ચારિત્ર પાળે યા નહિ તેનું  
તે જાણો.

**ઉત્તેરઃ—**ગુરૂતત્ત્વની ખાત્રી કથ્યો વગર અને તેને  
સમજ્યા વગર કોઈનો છૂટકો જ નથી કારણું  
કે સુશુરુ વગર જ્ઞાન મળતું નથી. ગુરૂ જે  
શુદ્ધ ચારિત્રવાન દરેક રીતે હોય તે તેઓ  
હેવનું સ્વરૂપ શુદ્ધ સમજાવે. કે  
વિતરાગ પ્રભુ રાગ દ્વેષને જીતવાવાળા,  
ને કલ્યાણકારી હેવ છે. પાંચ  
મહાત્રત, પાંચ સમિતિ, અને ત્રણ  
ગુપ્તિ ખરીશીતે પાળે તેજ કલ્યાણકા-  
રીનિયંથ ગુરૂ છે. કુનળી પ્રરૂપીત  
અહિંસામય કલ્યાણકારી તે ધર્મ છે.  
શાસ્કોક્ત ઇરમાન સુજખ પાળવાવાળા ગુરૂ  
જે હોય તેજ ઉપર બતાયા પ્રમાણે હેવ,  
ગુરૂ અને ધર્મ એ ત્રણે તત્ત્વનું સ્વરૂપ શુદ્ધ  
રીતે સમજાવે અને તેથી જ માણુસો પોતાનું  
આત્મકલ્યાણ સારી રોતે કરી શકે અને

તેટલા માટે આત્માર્થી પુરુષોએ, શુરૂ ત-ત્વ સમજવાની અને તે વિષે ખાત્રી કરવાની ખાસ જરૂર છે. ખાલી વેષ પહેરવાથી સાધુ અને શુરૂ થઈ જવાય નહિ. વેષ તો પૂર્વે દરેક જીવે અનંતીવાર પહેર્યો છે. પણ શાસ્ત્રોક્તા ઇરમાન પ્રમાણે શુદ્ધ ચારિત્ર પાળયું નહિ તેથી કલ્યાણ થયું નથી માટે સમજુ માણુસે વિચારવું જોઈએ કે જિન મારગમાં શુણી શુરૂ તે શુરૂ છે અને તેની પૂજા છે. શુણુ વગરનો વેષ પહેરનાર તે શુરૂ નથી તે તો સંસારી કરતાં ઓટા ગણ્યાય કારણું કે લીધેલા મહાપ્રતની ભર્યાદા તોડે તે સારા હોય શકે જ નહિ. તે તો ગૃહસ્થી કરતાં ઉત્તરતા જ ગણ્યાય.

દાખલા તરીકે એ શ્રહસ્થી છે તેમાં એકે તો સામાયિક કરવાનાં પર્યાખાણુ લઈ સામાયિક લીધું છે અને બીજે પર્યાખાણુ વગરનો ખુદ્વો છે. હુવે જે ખુદ્વો છે, તે શ્રહસ્થ સંસારના અનેક આરંભ સમારંભનાં કાર્ય કરે છે તેનું પાપ ઇકત તેને લાગે છે, પણ સામાયિકનાં પર્યાખાણુ ન હોવાથી, પર્યાખાણુ ભાંગવાનું પાપ તેને લાગતું નથી, અને જેને સામાયિકુંનાં પર્યાખાણુ લીધાં છે તે, આરંભ સમારંભવાળું કાર્ય કરે તો એવંડો જુન્હેગાર ગણ્યાય. આ દાખલો દ્વાનમાં રોખી ઉપરોક્તિ શુરૂતત્વ પર વિચાર કરવો

કે એ ઘડીની સામાયિક ભાંગવાવાળો, ખુદ્વા ગૃહસ્થ  
કરતાં ધણોજ નરસો અણુય. તો પછી સાધુને તો  
લંદગીની સામાયિકનાં પચ્ચાખાળુ હોય છે, તે પચ્ચાખાણુને  
ભાંગવાવાળા તો ગૃહસ્થ કરતાં સારા શી રીતે  
હોઢ શકે! ન જ થઈ શકે સારાને બદલે સાધારણ  
રીતે ઠગારા તો કહી શકાય અને એવાને જે સારા  
માની ધર્મ શુરૂ સમજે તેને ભગવાને મિથ્યાત્વી કહ્યા  
છે.. શાખ,-સૂત્ર, ઠાણુંગ ઠાણું ૧૦માં એમ જણુવેલ  
છે કે અસાધુને સાધુ સરદે તો મિથ્યાત્વ લાગે માટે  
કુકુત વેષ જેઠને સારા શુરૂ તરીકે માનવા નહિ.  
વિતરાગનાં કુરમાન મુજબનું સાધુપણું પાળે છે કે  
નહિ તે બાબતની પ્રથમ તપાસ કરવી, નહિ પાળે  
તેની કરણી તે બણે એમ કહીને વેષધારીને શુરૂ  
માનવા નહિ.

જેમ સંસારમાં કુંભારને ત્યાંથી તાવડી ખરીદ  
કરવી હોય ત્યારે તેને ધણું કરીને એ ત્રણ વખત  
દટોકારાથી વગાડી લેવામાં આવે છે પણ કુટેલી જણું  
જેઠને કોઈ લે નહિ, તે મુજબ ડાઢ્યા અને સમજું  
માણુસોએ ધર્મશુરૂની બાબતમાં પણ પરીક્ષા કરવી,  
કે આ સાધુની શ્રદ્ધા, આચાર, શાસ્ત્રોકૃત પ્રમાણે  
અખંડ છે કે કેમ! જે અખંડ રીતે પાળવાવાળા  
હોય તો તે શુરૂ છે, પણ જે તે ચારિત્ર અખંડ  
ભાંગવાળા ન હોય અને અત્ર-કુટેલી તાવડી જેવ.

હોય તો સમજુ માણુસે તેવાઓને શુરૂ તરીકે માનવા,  
જૂજવા કે વાંડવા જોઈએ નહિ.

**પ્રશ્ના:**—પહેલાંના ધારેલા શુરૂ મુકાય કેમ? ભલેને  
તે શાસ્કેકત પ્રમાણે સંયમ ન પાળતા હોય  
અને ખીલ સાધુ પાળતા હોય તો પણ  
શુરૂ તો તે જ મનાય કે જે અસ્થિત્વી  
એટલે ખાપદાદાથી ચાલતા આંદ્યા હોય-

**ઉત્તરઃ:**—શાસ્કેંકન પ્રમાણે નહિ ચાલે અને શિથિ-  
લાચારી હોય તો, તેવાઓને છોડી દેવામાં  
જરાયે વાંધો નથી. આગળના આત્માર્થી પુરુષોએ  
શર્દ્દા આચારમાં એટા જાણ્યા તેવા શુરૂએને  
છોડ્યા છે. તેના દાખલા શાસ્ક પ્રમાણું સહિત  
નીચે મુજબ છે. શક્કાળ પુત્રનો શુરૂ જોશાલો  
હતો. તે એટો લાગ્યો એટલે તેને છોડી શ્રમણ.  
ભગવંતશ્રી મહાવીર પ્રલુને શુરૂ તરીકે તેણે  
સ્વીકાર્યો છે. શાખ સૂત્ર ઉપાસગદશાંગ, અધ્ય-  
યન જ. સુખદેવ સન્યાસી પોતે ૧૦૦૦ એક  
હજાર ચેલાના શુરૂ હતા, તેમણે પણ સ્થાવરચા  
પુત્ર સાધુ સાથે ચરચા કરી, અને તેઓને  
ધમં શુરૂ તરીકે સ્વીકાર્ય અને તેમની પાસે  
દીક્ષા પણ લીધી. શાખ-સૂત્ર જાતા, અધ્યયન  
પ્ર ધર્ત્યાદિક શાંતોમાં અનેક દાખલા છે તે  
ધ્યાનમાં લઇ વિચારવામાં આવે તો સમજુ

માણુસ મહાવત નહિ પાળનાર સાધુઓને  
ગુરુ તરીકે ન જ માને તેમ છતાં તેઓને  
ને કોઈ એકાંત પક્ષ તાણી ગુરુ તરીકે માનવા  
મૂકે નહિ તો તે વ્યક્તિને શાસ હિસાબે  
અભિન્થહિક મિથ્યાત્મ લાગે (અભિઅહિક  
(મિથ્યાત્મ એટલે ઐટા જાણે તો પણ લીધેલી  
ટેક મૂકે નહિ.) આત્માર્થી હોય તે વિચારી  
નેશો. વળી શાસ્કોકત પ્રમાણે નહિ પાળવા-  
વાળા સાધુને માત્ર બાપદાદાચે ગુરુ તરીકે  
માન્ય કરેલ હોવાથી દીકરાએ તેને જ માનવા  
નેધાચે તેવા મંત્રબ્યને લઈ ભીજ સુ સાધુને  
ગુરુ તરીકે નહી ધારવા અને ગુરુ તરત્વ નહિ.  
સમજવું એવી વાત પણ ધર્મ મારગમાં  
અધિત્ત છે. કારણુ કે કોઈના બાપદાદાચે ઐ-  
શાળા જેવા પાંખડીને ગુરુ માન્યા હોય અને  
તેનાં કરતાં દીકરાને મહાવીરપ્રભુ સારા લાગે તો  
ગુરુ તરીકે તેને નહિ માનવા એમ બને નહિ.  
દીકરા પોતાના કલ્યાણ સાર ખુશીથી માની  
શકે છે. અને તેમાં જરાયે વાંધોનથી, સબજ  
હેવ, ગુરુ, ધર્મ એ ત્રણે તરત્વ સૈને માટે  
સ્વતંત્ર છે.

પોતપોતાની આત્મા ચાક્ષી બરે અને જે  
સારું લાગે તે સ્વીકારી શકે છે. સ્વાત્મ-

કંદયાણુ કર્તાં તરવેનો હુક, બાપદાદા કે બીજા કોઈની પાછળ હોકા શકે નહિ. જેમ કણું છે કે “કરણી આપો આપની કોણું બેટા કોણું બાપ” માટે ધર્મોપહેશ લેવા સારુ શાસ્ત્રોના ઇરમાન મુજબ પાળવાવાળા! નિયંત્ર સાધુને ધર્મ ગુરુ માનવામાં વડીત અથવા ન્યાત જાત કોઈની અડગણુ, કે અટકાયત આત્મ હિતૈષી પુરુષોને કખૂલ છાય નહિ જ કારણુ કે પેલાની અટકાયત કખૂલ કરી, શરમ, વા અંતરાય, રાખવામાં આવે, તો ચોતાના આત્માનું, ભવે ભવનું હિત બગડે. વિવેક લોચને વિચારી જે જે.

**ગ્રન્થ:**—ઉપરોક્ત નિયંત્ર ગુરુની વ્યાખ્યા લખવાનો અને બહાર પાડવાનું દ્યોય અથવા હેતુ શું હશે !

**ઉત્તર:**—આ વ્યાખ્યા લખવાનો અને બહાર પાડવાનું દ્યોય કુંકત એજ છે કે લવિ પુરુષો નિયંત્ર ગુરુનાં લક્ષ્ણો સારી રીતે સમજુ શકે, તે સિવાય કોઈની નિંદા કે કોઈને હુલકા પાડવાનું દ્યોય નથી તે વાંચક પુરુષોને આ આ આપો લેખ દ્યાનપૂર્વક વાંચવાથી આપો આપ જળ્યાઈ આવશે.

**ધર્તિ શુભમ્.**

શ્રી ૧૧  
પારણાની ઢાલ,

( હોહરા )

કરણુ જેખને એલાખ્યા, લાગે જીન મત છાપ;  
તોઝે ત્યાગ લોગ એઉં જુદા, સમજે આપોઆપ, ॥૧॥  
પ્રથમ કરણુ પોતે કરે, કરાયા ધીને જાણ;  
અનુમોદાં ત્રીજે કરણુ, સમજે ચતુર સુજાણ. ॥૨॥  
પ્રથમ મન ધીજે વચન, ત્રીજે કાયા જોગ;  
સારા નરસા છે ત્રણે. સમજે હૈ ઉપયોગ, ॥૩॥  
ત્યાગ મારગને ઉપરે, જે લગે કરણુને જોગ;  
તો ધર્મ પુન્ય એઉ હુવે, કટે કર્મનો રોગ. ॥૪॥  
લોગ મારગને ઉપરે, જે કરણુ જોગ જુટ જાય;  
તો લોગ વધે ઈદ્રિયાં તણો, ધર્મ પૂછ્ય નહિ થાય. ॥૫॥  
આ કરણુ જોગ ચાવી થડી, બધા તાળાં ખુલ જાય;  
સમજે ચાવો જે ચતુર, મિથ્યા મતિ ગુંચવાય. ॥૬॥

॥ ઢાલ ॥

આ અનુકંપા જીન આજામે “એદેશી”

ચાવીસ લાખ લીલોતરીની જતિ,  
તેને ત્યાગ્યા બગર લાગે પાપ પીછાણો;  
સમજુ શ્રાવક પાપ શું શકે જબ,  
યથાશક્તિ બાંધે પ્રમાણો,  
આ ત્યાગ બધારો છે મોક્ષનો  
મારગ. આંકડી. ॥૭॥

દાખલા તરીકે ધારો એક શ્રાવક,  
પચાસ સિવાય કર્યાં પચ્ચાખાણ્ણો,  
તે પહેલે કરણું થયો ત્યાગ વધારો,  
ત્યાગથી નિજ આત્મ કદ્વાણ્ણો.

ઓ ત્યાગ વધારો, ॥૨૪॥

મર્યાદા ખાંધી તમે પિણુ મુકોા,  
ભીજને ઉપહેશ આપ્યો પ્રસિધ્ધેા;  
જથું પચાસ ઉપરાંત ભીજે પણુ છોડી,  
ઓ ત્યાગનો લાલ ભીજે કરણું લીધો.

ઓ ત્યાગ વધારો. ॥૨૫॥

ગીજે માણુસ કરે છે અનુમોદના,  
ધન્ય ધન્ય ત્યાગ કર્યાં તમે ભાઈ;  
એમ ત્યાગીના ત્યાગ વખાણ્ણો,  
તે પિણુ ગીજે કરણું લીધો લાલ ઉઠાઈ.

ઓ ત્યાગ વધારો. ॥૨૬॥

હવે પચાસ લીલોાતરી રાખી હતી.  
તે પાસે મુકી ચેતે ખાવા બેઠો;  
એ પ્રથમ કરણું થયો લોાગ વધારો,  
પણું શ્રાવક સમજે મારો જીવ ઘેડો.  
ઓ લોાગ વધારો છે સંસાર

મારગ આંકડી. ॥૨૭॥

ભીજે આંદ્યો તેને દસ ખવરાવો,  
ઓ ભીજે કરણું થયો લોાગ વધારો;

આપવા વાલાને જે અનુમોદે,  
તે ત્રીજે કરણે ભોગનો ભાગીદારો.

એ લોગ વધારો. ॥૬૮॥

વળી ખીંલે દાખલો ત્યાગ સોગનો,  
એક અહુસ્થને આવ્યો વૈરાગ સારો;  
તે ચોમાસે રાત્રિ ભોજન ત્યાગ્યો,  
એ પહેલે કરણે થયો ત્યાગ વધારો.  
એ ત્યાગ વધારો છે મોક્ષનો મારગ. ॥૭૯॥

ઉપહેશ આપી ખીંલને છોડાયો,  
તે ખીંલે કરણે થયો લાલ પ્રસિદ્ધ્યા;  
તિણુ ત્યાગી વૈરાગીને જે અનુમોદે,  
તે ત્રીજે કરણે લાલ સેહજેહી લીધ્યો.

એ ત્યાગ વધારો. ॥૮૦॥

હવે દિવસે જમવો રાખ્યો છે તેને,  
લોગ મારગ પહેલે કરણે કહી જે;  
શરીર સારુ આરંભ કરવો પડે છે,  
યણું ધર્મ તો ત્યાગ છે તેહમાં ગણું જે.  
એ લોગ વધારો છે સંસાર મારગ. ॥૮૧॥

કેટલાએક આલ અજ્ઞાની એમ જોલે,  
આવો પીવો એમાં શેંનો છે ઢાંચે;  
તે ત્યાગ લોગ સું છે ઓલખ્યો નાહિ,  
આઈ ખાઈ પણ જેમ હેહિને ચોંચે.

એ લોગ વધારો. ॥૮૨॥

ચોતે જમ્યો, તે પહેલો કરણું છે,  
તો જમાડ્યો, તે કરણું લોગનો બીજો;  
જમવો જમાડવો સંસાર મારગ,  
પણ ત્યાગને લોગની ઓલખ કીજો.  
એ લોગ વધારો છે સંસાર મારગ. ॥૧૧॥

કોઈ જમાડણુવાલાને ખૂબ વખાણ્યો,  
આને કેવો મળનો માલ જમાઠ્યો;  
તે ત્રીજે કરણું થયો લોગમેં દાખિલ,  
ઝોગટમાંહી પાપ ઉપાયો.

એ લોગ વધારો છે સંસાર મારગ. ॥૧૨॥

કોઈ આખા દહાડામાં એકજ ટાણું,  
જમવો રાખ્યો બાકી કીયાપર્યાખાણું;  
રાખ્યો તે લોગનો પહેલો કરણું છે,  
ત્યાગનો નામ એકાસણું જાણું.

એ ત્યાગ. ॥૧૩॥

એમજ બીજને ઉપદેશ આપીને,  
એક ટાણું સિવાયનો લોગ છાડ્યો;  
તે બીજે કરણું દલલ કર્હ જે,  
ત્યાગ વધારાનો લાલ ઉઠાયો.

એ ત્યાગ મારણું. ॥૧૪॥

ત્રીજે કરણું અનુમોદનવાળો,  
એ ત્રણું જણું શિવપંથ આરાદ્યો,  
એક ટાણું જે જમ્યા જમાઠ્યા,

તે લોગ મારગ સંચારનો સાધ્યો।

ઓ લોગ વધારો છે સંચાર મારગ. ॥૧૫॥

વળી ઉપવાસ પારણું ત્યાગ લોગનો,

ન્યાય સંભવને નિષ્ઠુંથ કીજ્યો;

લીદોતરી રાત્રિ લોજન જેમ જ,

કરણું જેગઢી ઓલખ લીજ્યો. ઓ લોગ ॥૧૬॥

પોતે ઉપવાસ કર્યો એક શ્રાવક,

તે પહેલે કરણું થયો ત્યાગ વધારો;

ચ્યારું આહારના ત્યાગ કર્યો,

જબ રોક દીધા નિજ આશ્રવદ્વારો.

ઓ ત્યાગ વધારો છે મોક્ષનો મારગ ॥૧૭॥

ઉપરેશ આપી બીજા પુરુષને,

તેને કર્મકાટણું ઉપવાસ કરાવ્યો;

તે ત્યાગ વધારી કરી આતમ શાતા,

ઓ બીજે કારણું લાલ કર્માંયો.

ઓ ત્યાગ વધારો. ॥૧૮॥

જે તપસ્યાવાલાને ખૂબ વખાણ્યો,

ધન્ય ધન્ય સંકળ કર્યો અવતારો;

તે અનુમોદવારૂપ ત્રોજે કરણું,

ત્યાગ પ્રશંસાનો લાલ અપારો.

ઓ ત્યાગ વધારો. ॥૧૯॥

હવે ઉપાસવાળો પારણું સાહુ,

બીજે દિવસ કર્યો આરંભ કુટો,

પછી પચ્ચાખું પાળી ખાંવા એઠો,

જખ થયે। શોઅમેં હાધિત ત્યાગથી ભૂટે।

ઓ લોગ વધારે। ॥૨૦॥

પોતાનો પારણો પહેલે કરણો,

તો બાળનો બીજે કરણો જણો;

ઓ લોગ વધારે। પાધરો હિસે,

લોગ મેં ધર્મ કહેતે અનણો।

ઓ લોગ વધારે। ॥૨૧॥

પારણો કરે કરાવે તેહને ડેઢ,

અનુમેદે કહે સારે કીધો;

તે ત્રીજે કરણો લોગ વખાણ્યો,

ઓ કરણુ જોગનો છે લેણો સીધો.

ઓ લોગ વધારે। ॥૨૨॥

પોત પોતાને ઘર તેરી લે જાને,

જમે જમાડે સંસાર વ્યવહારે,

પિલુ તિલુ માંડે ધર્મ ન સમજે,

શ્રાવક સમજે બીજે આશ્રવદ્ધારે.

ઓ લોગ વધારે.

એમ ત્યાગ લોગનો ખુલાસો સાંશળ,

ડેઢ મોહ કર્મ વસ ઉલટી લાણુ;

અસાધ કહે ખારણો। નહિ કરાવણુ,

એહવા આરોપ મૂકે જાણુ જાણુ.

ઓ લોગ વધારે। ॥૨૪॥

જણ લોગલાધ એમ ન સમજે,

ना शांत्यां लागे अंतराय कर्मी;  
 हृषि लिखारी वडोरेज नाड़ि,  
 तो ना कह्या क्यां रह्यो साधु धनो.  
 ओ लोग वधारो ॥२५॥

साधु तो उपदेश आपी छवाने,  
 त्याग ने लोगनो। भारग समजवे;  
 लोग वधारामां मोड वश आखी,  
 धर्म समजे ते कुणुद्धि छाडवे.  
 ओ लोग वधारो ॥२६॥

उपदेश आपी उपवास करायो,  
 ते भीजे करणे थध त्याग हलाली;  
 तिणु त्याग हलाली मे धर्म कह्यो प्रलु,  
 पणु लोगनी वात सूक्ष्मा न चाली.  
 ओ लोग वधारो ॥२७॥

कुणुद्धि त्यागने लोग ऐड मे,  
 तेवा मजना धर्म अताव्यो;  
 पिणु समजु माणुस पाधरो समजे,  
 ऐड मे धर्म थाये किणु न्यायो.  
 ओ लोग वधारो ॥२८॥

पारण्यामां ने धर्म थावे तो,  
 उपवास करी कौणु लुभ्या मर्शो;  
 पैसावाणो वगर कायह कष्टे,  
 पारण्यां करावो करावीने तरसे.  
 ओ लोग वधारो ॥२९॥

ગરીબ તો પત્રણાં કયાંથી કરાવે,  
રોટલીના ઝાંકાં પોતાને હોય;  
ઇથું ન્યાયે તો નિર્ધાર રખડે,  
ચૈસાવાલો જાવે સ્વર્ગમેં સોય.

ઓ લોગ વધારો. ॥૩૦॥

આમ વિતરાગના મારગ ભાંડે,  
પક્ષપાત નથી રાખી કાય;  
માટે જ ત્યાગમેં ધર્મ પ્રરૂપ્યો,  
ગરીબ લાભ્યવાન કરે તિથુને હોય.

ઓ ત્યાગ વધારો. ॥૩૧॥

કેટલાક લુન સમજયા વિષુ બોલે,  
મેં પારણો કરાય શાતા વપરાઈ;  
તિથું શાતાનો ધર્મ થયો છે,  
અહેં ખાટકસથી ચોળ્યો સાધમીં લાઇ.  
આ પુદ્ગલ શાતા સંસારનો મારગ. ॥૩૨॥

ઇથુરો ઉત્તર આપું સીધો,  
અષ્ટક અદ્ધિથી ન્યાય વિચારો;  
શાતા થઈ તે પધરી દીસે,  
પણ શાતાના લેઠ છે એ પ્રકારો.  
આ પુદ્ગલ શાતા. ॥૩૩॥

ઉપવાસ કરે કરાવે તેહથી તો,  
આતમ શાતા થતી બાણો;  
પારણુંમાં થઈ પુદ્ગલ શાતા,  
અમ જે શાતાના લેઠ પિછાણો.  
આ પુદ્ગલ શાતા. ॥૩૪॥

કેંધ માણુસ ઉપવાસ કથ્યો તે વખતે,  
શુદ્ધગવને તો થઈ પરમ અશાતા;  
કુલ જેમ આ કાયા કુમલાધિથી,  
ગરમી ચલી માથે ચકડર આતા.  
આ પુદ્ધગલ શાતા. ॥૩૬॥

જખ આતમાથી લિન્ન સમજુ કાયા,  
સમલાવ રાખી કર્મ ખપાયા;  
તરે આતમ શાતા થઈ મળહની,  
ઉપવાસથી લુલ ઓહવા પાયા.  
આ આતમ શાતા સુક્તિને મારાન. ॥૩૭॥

ખીને દહાડે થયો પારણું જખ,  
સુસ્કો મટી કાયા દીસે મળની;  
આ પુદ્ધગલ શાતા થઈ પારણું મે,  
આને આતમ શાતા કેંધ ઓહવશ માની.  
આ પુદ્ધગલ શાતા. ॥૩૮॥

આતમને તો થઈ જિવટી અશાતા,  
એ જ્ઞાનદિષ્ટથી કેંધ જોય વિચારે;  
આ પુદ્ધગલ સારુ કરવે પડ્યો આરંભ,  
જખ લુલ થયો કર્માથી લાડે,  
આ પુદ્ધગલ શાતા. ॥૩૯॥

ઉપવાસ કરાય ને કર્મ ખપાયા,  
જખ તો પેલાને થઈ આતમ શાતા;  
પારણાથી કરી પુદ્ધગલ શાતા,  
જખ લુલને તો થઈ જિવટી અશાતા.  
આ પુદ્ધગલ શાતા. ॥૪૦॥

ને પારણુંની શાવામેં ખર્મ છે તો,  
ઉપવાસમાં કહેવેં મહો માપ;  
કારણુંકે તપસ્યાથી પુદ્ગલ અશાતા,  
એ પ્રજ્ઞ પુછ્યા કુશુર રહે ચુષ્યાપ  
આ પુદ્ગલ શાતા. ॥૪૦॥

કઈ પારણો પારણો કર રહ્યા લોલા,  
પણ પારણુંનો અર્થ સમજે ન કોય;  
પચ્ચાખાણુ પૂરા થયા પાળે ખળાને,  
તેહનો નામ છે પારણો ન્યેય.  
એ લોગ વધારો. ॥૪૧॥

પચ્ચાખાણુ કરે કરાવે એક ભાણુસ.  
અન્ને પચ્ચાખાણુ પ્રાડે પડાવે;  
કહેલા બેઉમાં જીન આજા કોણુ પાળી,  
સમજુ ભાણુસ ન્યાય મિલાવે.  
આ લોગ વધારો. ॥૪૨॥

વળી પારણુના લેદ અનેક છે,  
સાંભળજ્યો જવિ ચિત્ત લગાયો;  
ઉપવાસનો પચ્ચાખાણુ પાળી જમે તે,  
ઉપવાસનો પારણો કહેવાયો.  
એ લોગ વધારો. ॥૪૩॥

એમ જ કેદને રાત્રિ ચાવિહાર જ,  
સૂર્યે ઉંઘે ખાવે પચ્ચાખાણુ પાળી;  
તે ચાવિહારનો પારણો કહી જે,  
સમજેજ સમજે ન્યાય વિચારી.  
એ લોગ વધારો. ॥૪૪॥

કોઈ એક મહિના સુધી લીલોતરીના,  
પદ્ધતિભાષુ છીયા હિંદ સમતા ખારી;  
થીજે મહિને આવે પદ્ધતિભાષુ ચાળીને,  
એ પણ પારણો કહીએ કારી.

ઓ લોગ વધારો. ॥૪૫॥

ઉપવાસ લીલોતરી ને વળી રાત્રિનો,  
ધત્યાદિક પારણો વિવિધ પ્રકારી;  
કહે કયા પારણું આપે જીન આજા,  
ઉત્તર આપો શોચ વિચારી.

ઓ લોગ વધારો. ॥૪૬॥

એમ પ્રક્ષ પુછ્યાનો જવાબ ના આવે,  
જણ ટેક રાખણુ કુહેતુ લગાવે;  
કહે પારણો કરાવતે કરાવતે કોઈ વખતે,  
તીર્થ કરનો જીવ જમાં જવે.

ઓ લોગ વધારો. ॥૪૭॥

તો જમાડણવાલો તીર્થ કર ગોત્ર બાંધે,  
એહુવો હીંસાધમી લાલ ખતાવે;  
એમ અદ્ય પાપને ખડુ નિજરા,  
કહી કહી આડંબર ધર્મ ચલાવે.

ઓ લોગ. ॥૪૮॥

પણ એટલો લેદ ન સમજે,  
લોલા જે દ્રવ્ય તીર્થ કર જમ્યા લાગે ધર્મ  
તો દ્રવ્ય તિર્થ કર જીવ જે ખાધામે આવે.  
તો કેટલો મેટો બાંધ્યો પાપ કર્મ.  
ઓ લોગ. ॥૪૯॥

તિષ્ણરી વિગત વિવરા શુદ્ધ સાંભળો,  
ગતાગતથી જેય વિચારે;  
પૂર્ણી પાણી વનસ્પતિ માંછી,  
દ્રોય કેવલીના જીવ છે ધારે.  
એ લોગ. ॥૫૦॥

તે જીવ જે ખાધામેં આવે તો,  
તેની અદ્ધા લેખે તેને પૂર્ણિજે;  
તું કહેતો દ્રોય તીર્થંકર જમ્યા ધર્મ તો,  
મર્યાથી કેટદો પાપ ગણી જે.  
એ લોગ મારગ. ॥૫૧॥

એ ન્યાય સાંભળ સમજુ એમ વિચારે,  
કુશુર એકતરણી વાત ખતાવે;  
લાભ દર્શાવે દ્રોય જીન જમ્યાનો,  
પણ દ્રોયે જીનહિં સાની વાત છુપાવે.  
એ લોગ. ॥૫૨॥

વડે દ્રોયે તીર્થંકર જમાડયા જે ધર્મ,  
તો શ્રેષ્ઠુકને શ્રી કૃષ્ણની રાણી;  
દ્રોયે તીર્થંકર હતા પતિ પોતાના,  
તેહને જમાડયા હિસે આહાર પાણી.  
એ લોગ. ॥૫૩॥

પણ પતિ જમાડવાના કાર્યથી તો,  
તીર્થંકર ગોત્ર બાંધ્યો નહિ કોય;  
તો દ્રોયે તીર્થંકરનો જીવ જમ્યાથી,  
પારણામેં ધર્મ કસી વિધિ હોય.  
એ લોગ મારગ. ॥૫૪॥

એમ ખોટી શર્દી પગ પગ અટકે,  
જબ જુન આજા બાહીર ધર્મ અતાવે;  
કુશુરું પડ્યા આડંખર માહે,  
તથ ત્યાગ મારગ ઓલખાવણી નાવે.

ઓ લોગ મારગ. ॥૫૫॥

જબ સવગડીઓ ને આડંખરીઓ ધર્મ,  
સાધ શ્રાવક મિલ ખુખ ચલાયો;  
તથ પણુસણુંમે પારણું સારુ,  
છકાય કુટો હેંસે ચેષાયો.

ઓ લોગ મારગ. ॥૫૬॥

પછે લીલેતરી આદીની થાયે પ્રભાવના,  
તેહનાં છાપાં ખૂબ છપાવે;  
જુવો સાંધુ કેવા પ્રભાવશાળી,  
એટલા એટલા માગસો આવે.

ઓ લોગ મારગ. ॥૫૭॥

જબ નામના દેશ પ્રહેરોમાં ઝેલે,  
મહારાજ સાંભળ હસ્તિત થાવે;  
પારણુંમેં ધર્મ બતાવે ઈણું કારણું,  
ઓ અંદરનો લેદતો વિરલા પાવે.

ઓ લોગ મારગ. ॥૫૮॥

મહારાજ તો થયા નામથી ખુશ,  
શ્રાવક ખુશ સહેલો સાંભળી ધર્મ;  
એઉ મિલ આડંખર ધર્મ ચલાયો,  
પણ ત્યાગ ઓગરે! ન ઓલખાયો મર્મ.

ઓ લોગ મારગ. ॥૫૯॥

ત्याग मारग છે આતમા બસ્તુ,  
લોગ મારગ પુદ્ગલ વ્યવહારે;  
આતમ પુદ્ગલ સ્વરૂપ જુદી જુદી  
સમજયા વિના નહિ સમકિત સારો.

ઓ લોગ વધારો. ॥૬૦॥

લોગ મારગમે બેઠો છે શ્રાવક,  
જમે જમાડે આ સંસારી ચાલ;  
પિણુ લોગ વધારામે ધર્મ ન સમજે,  
લોગ ત્યાગ ઓતખાવણુ કહી આઢાળ.

ઓ ત્યાગ મારગ ॥૬૧॥

સંવત એગણીસે નવ્યાશી વર્ષે,  
પોષ વહિ છઠ મંગલવારો.

પૂજયપ્રસાદે સૂરજ જેડો,  
દાદર શહેરે હર્ષ અપારો.

ઓ ત્યાગ વધારો છે મેધનો મારગ ॥૬૨॥

ઇતિ પારણાની ટાલ સંપૂર્ણ.

દ્વાર્ય સાતા અને ભાવ સાતાની ટાલ

શ્રાતા આખ્યા શાતા થાવે, એમ કહે બહુ પ્રાણી;  
તે શાતા કઈ સાંકલો ડાદ્યા, નહિ કરતા એંચાતાણી રે.

સમજુ શાતા અર્થ વિચારો.

પુદ્ગલ શાતાથી પ્રેમ કરી, જીવ શાતા કેમ વિસારો.

॥ રે સમજુ ॥ ૧

પુદ્ગલ શાતાતો સાજભૂ શરીરનો, તે અપતમથી કિસ્ત જાણે;  
પાંચ હંડિના તેવીસ વિષય, એથે તેણ પિણાણો રે.

॥ સમજુ ॥ ૨

જીવ શાતા કે ઈજીવ અજ્ઞાની, તેણને જ્ઞાન આપી કરે જાની;  
હિંસાદિક પાંચ આશ્રમ છુડાવે, લાવે ઝુખતાને કાઢે તાણી રે.

॥ સમજુ ॥ ૩

પુદ્ગલ શાતા કરી પરસ્પર, એક એકને બહુ વારે;  
અનંતીવાર જીવ થયો લીખારી, અનંતીવાર શોઠ જારો રે.

॥ સમજુ ॥ ૪

લીખારી લીખ માંગવા કારણ, શોઠ તણે ઘેર આવે;  
આતો રીત છે કાલ અનાદિની, પોતાની ગરણે પેલાપેંનાવે રે.

॥ સમજુ ॥ ૫

લીખારીને હુઃખીયો હેખી, શોઠ શાતા વપરાઈ;  
પુદ્ગલ આપી પુદ્ગલ પોષ્યો, આ પુદ્ગલ શાતા કહેવાઈ રે.

॥ સમજુ ॥ ૬

કુનિયાની ભાગીદારીનો ધન, શેડે લીખારીને આપ્યો;  
તેમાં નવાઈ શું કરી ભાઈ, એકએક શું સ્નેહ સ્થાપ્યો રે.

॥ સમજુ ॥ ૭

પુદ્ગલ શાતા સબંધ સગલાથી, જીવ કિયો બહુ વારે;  
પિણુલાવે અતમ શાતા કિયા વિન, નથી થયો  
કેઠનો ઉદ્ધારો રે. ॥ સમજુ ॥ ૮

એ હુમકને ઉપદેશ દેઈને, હિંસાદિક છોડાવે;  
આનદર્શિન નિજ વસ્તુ આપે, આ શાતાથી શાતા શાવે રે.  
॥ સમજુ ॥ ૯

શાવે આતમ શાતાની ઓલખ, કરશે તે નહિ અથડશે;  
પુદજલ શાતાને જીવ શાતા કહેશે, તે ચિંહુગનિ જોયા  
ખાશે રે. ॥ સમન્જુ ॥ ૧૦

પુદજલ શાતા સંસારનો મારખ, તેહને મોહમતવાલા વખાલુ  
ખર્મ સંખંધ છે આત્મા સાથે, પરમાર્થ વિરલા જણે રે.  
॥ સમન્જુ ॥ ૧૧

પુદજલ જીવનો પરિચય અનાદિ, જુદો સમજ્યાથી  
સમક્રિત આવે, તે માંહે રહે જે રાચ્યામાચ્યા, એધ  
થીજ નહિ પાવે રે. ॥ સમન્જુ ॥ ૧૨

વખ્રો ઓગણીસે નંયાસી મિગસર મહિને, સુદ નવમી  
સોમવારો;  
પૂજજ પ્રસાહે સૂરજ લાગે, સાતા લેદ વિચારો રે.  
॥ સમન્જુ ॥ ૧૩

(સંપૂર્ણ)

\* હુમક=કસાઈ.

## સાધુ કે આચાર કી ઢાલાં

॥ ઢાલ પહલી ॥

(જ્ઞાનિયલુ જોવો રે ઝૂદ્ધ વિમાસી એદશી)

આધાકરમી ઉદ્દેશિક જોગવૈ તિષ્ણને,  
નિશ્ચય કદ્યા અણુચારી ।  
કથકીકાતિક રે તીવૈ અદ્યયને  
શાંકા મ આણ્ણો તિગારી રે ॥

ભવિયણુ જોયજ્ઞો। હૃદય વિમાચી ॥ ૧ ॥  
આધાકરમી ઉદેશિક લોગવૈ તિષ્ણને,

બિંઠ કદ્યા લગવાન ।

દુશ્પૈકાવિક રે છુટે અધ્યયને,

નિરણો કરેા બુદ્ધિમાન રે ॥ ભ. ॥ ૨ ॥

આધાકરમી ઉદેશિક લોગવૈ તિષ્ણને,

નક્ષ આમી કદ્યા લગવાન ।

ઉત્તરાધ્યયન રે વીસમેં અધ્યયને,

નિષો કરેા બુદ્ધિમાન રે ॥ ભ. ॥ ૩ ॥

આધાકરમી ઉદેશિક લોગવૈ,

તિષ્ણરા છજિ પ્રત જાંગ્યાં જાણુ ।

આચારાંગ રે દૂજૈ અધ્યયને,

બ્લેય કરેા પિછાણુ રે ॥ ભ. ॥ ૪ ॥

આધાકરમી ઉદેશિક લોગવૈ,

તિષ્ણમેં છૈ મોટી ખોડ ।

આચારાંગ પહુંચે શુત ખંધે,

કહ હિયા લગવંત ચોર રે ॥ ભ. ॥ ૫ ॥

આધાકરમી ઉદેશિક લોગવૈ અધોગત લુલ,

વલી કદ્યા છૈ અન્નત સંસારી ।

અગવતી રે પહેંચે શતક રે નવમેં ઉદેશૈ,

તિંહાં બહુત જિયો વિસ્તારી રે ॥ ભ. ॥ ૬ ॥

આધાકરમી ઉદેશિક લોગવૈ તિષ્ણને,

કદ્યા અણી ને કેખધારી ।

हेय पक्ष से सेवन कहा छै,  
 सूयगडांग हज श्रुत अंध मंजारी रे ॥ લ. ॥ ૭ ॥  
 આધાકરમી ઉદેશિક એકવાર લોગવૈ તિણુને,  
 ચૌમાસી પ્રાયશ્ક્રિત હેણો ।  
 સદા નિતરો નિત ઠેડ સથું લોગવે,  
 તિણુને પ્રાયશ્ક્રિત રો કાંઈ કેહણો । રે ॥ લ. ॥ ૮ ॥  
 આધાકરમી ઉદેશિક લોગવૈ તિણુ ને,  
 સબલો હાખણુ લાગૈ ।  
 સદા નિતરો નિત ઠેડ સથું લોગવૈ  
 તિણુને પ્રયશ્ક્રિત રો કાંઈ થાગ રે ॥ લ. ॥ ૯ ॥  
 ચાંદુ કાજે દડ લીધૈ જઈ,  
 કીડી મકોડી હેવૈ દણી ।  
 અનેક ત્રસ લુવોં ને મારે ત્યાંરી,  
 વિકલાં રી ગત હોસે માઠી રે ॥ લ. ॥ ૧૦ ॥  
 અનેક ત્રસ લુવાં ને મારે,  
 અનેકાં પર હેવૈ દાટી ।  
 કંગુર કાજે લવ ધણુ વિધ મારે,  
 ત્યાંરી અકલ આડી આધ પાડી રે ॥ લ. ॥ ૧૧ ॥  
 શવાસ ઉરવાસ ઢાંધી લવ મારે,  
 મહામોહની કમે અંધાય ।  
 કદ્દી દસાશ્રું અંધ સુત્ર મે  
 તેપિણુ વિકલાં ને અજર ન કાંધ રે ॥ લ. ॥ ૧૨ ॥  
 ચીગટરો તણુખો નાખૈ જઈ,

કિડિયાં લાખાં ગમે આવે ।

ધર લીપૈ દડ રૂધૈ જઈ.

કિડિયાં લાખાં ગમે ભર જવૈ રે ॥ ભ. ॥ ૧૩ ॥

ચોતી કર્મ હોષ સેવે તિણુને,

કહ્યા ગૃહસ્થી ને લેખધારી ।

હેય પક્ષરા સેવનહારા કહ્યા છૈ,

સૂયગડાંગ દૂજા શ્રુત ખંધ મંઝારી રે ॥ ભ. ॥ ૧૪ ॥

ચોતી કર્મ હોષમે આધાકરમી,

હોષ વિશેષ છૈ ભારો ।

સદા નિતરો નિત આધાકરમી હોષ સેવૈ છૈ,

તે નિશ્ચય નહીં અણુગારો રે ॥ ભ. ॥ ૧૫ ॥

આધાકરમી સ્થાનક સેવૈ ઉધાડું,

વલિ સાધુ બાળે અનાખી ।

મહામોહની કર્મ બાંધૈ છૈ,

દથા શ્રુત ખંધ સૂત્ર છે ચાખી રે ॥ ભ. ॥ ૧૬ ॥

આધાકરમી સ્થાનક સેવૈ ઉધાડું,

પુછ્યાથી પાધરં બોલણું નહીં આવૈ ।

મિશ્ર બોલયાંથી મહામોહની કર્ય બંધાય,

કૂડ કપટથી ઠામ ચલતૈ રે ॥ ભ. ॥ ૧૭ ॥

આધાકરમી સ્થાનક સેવૈ ઉધાડું,

પુછ્યાથી બોલે કૂડ ।

ત્યાંરા શ્રાવક ત્યાંરી સાખ પૂરૈ છૈ,

તે ગયા વહુતી ઈ પૂરું રે ॥ ભ. ॥ ૧૮ ॥

આધાકરમી સ્થાનક સેવૈ ઉધારું,  
 બલી કુઠ એલૈ જાણુ જાણુ ।  
 ત્યાંરા જૈવા સ્વામી તૈવા સેવક,  
 નિકલ ગયો જાખક હાણુ રે ॥ અ. ॥ ૧૬ ॥  
 કોઈક આવક ત્યાંરા ભારી કર્મ,  
 કુટ બોલતાં ન ડરે લિગાર ।  
 આધાકરમી ને નિહોંખ કહૈ છૈ,  
 તે દૂખ ગયા કાલીધાર રે ॥ અ. ॥ ૨૦ ॥  
 આધાકરમી ઉદેશિક લોગવ તિણુને,  
 સાધ સરદ્ધૈ તે મિથ્યાતી ।  
 ઠાણુંગ રે દશ મેં ઠાણુ કદ્યો છૈ અર્થ,  
 મુંહકે લણી ભતિ જાણો ભાતી રે ॥ અ. ॥ ૨૧ ॥  
 આધાકરમી ઉદેશિક લોગવૈ.  
 તે છૈ ભારી કરમાં ।  
 શુદ્ધ શુદ્ધ બાહિરા 'જીવ અજ્ઞાની,  
 કેમ પામૈ શ્રી જિણુ ધરમાં રે ॥ અ. ॥ ૨૨ ॥  
 આધાકરમી હોષ સૂતર સૂં ભતાયો,  
 સૂત્ર મેં હોષ અનેક ।  
 ભાલરો લિયો હોષ કહું છું,  
 તે સુષુંજયો આણુવિવેક રે ॥ અ. ॥ ૨૩ ॥  
 ભાલરો લિયો લોગવૈ તિણુને,  
 નિક્ષેપ ઠદ્યા અણુઆરી ।  
 દશવૈકાલિક રે તીજૈ અદ્યયને,  
 શંકા મ જાણો લિગારી રે ॥ અ. ॥ ૨૪ ॥

મોલરો લિયો લોગવૈ તિષુને,

બિંઠી કહ્યા ભગવાન ।

દર્શાવૈકાલિક રે છહું અધ્યયને

નિરષ્ટય કરો બુદ્ધિમાન રે ॥ ભ. ॥ ૨૫ ॥

મોલરો લિયો લોગવૈ તિષુને,

નર્કંગામી કહ્યા ભગવાન ।

ઉત્તરાધ્યાન રે વીસમેં અધ્યયને,

નિરષ્ટય કરો બુદ્ધિમાન રે ॥ ભ. ॥ ૨૬ ॥

મોલરો લિયો લોગવૈ,

તિષુમેં છે મોટી ઓડ ।

આચારાંગે પહુલે શ્રુત ખંધે,

કહ દિયા ભગવન્તે ચોર રે ॥ ભ. ॥ ૨૭ ॥

મોલરો લિયો લોગવૈ તિષુરા,

સુમત ગુપ્ત મહાત્રત ભાગા ।

નિશીથ રે ઉગણીસમેં ઉદ્ધૌ,

કહ્યા પ્રત વિહુણ્ણા નાગા રે ॥ ભ. ॥ ૨૮ ॥

મોલરો લિયો એક વાર લોગવૈ,

તિષુને ચૈમાસી પ્રાયશ્ક્રિત હેણો ।

સદા નિતરો નિત ઠેઠ સ્થું લોગવૈ તિષુને,

પ્રાયશ્ક્રિત રો કાંઈ કેહણો રે ॥ ભ. ॥ ૨૯ ॥

મોલરો લિયો લોગવૈ તિષુને,

સબલો હોષણ લાગૈ ।

સદા નિતરો નિત ઠેઠ સ્થું લોગવૈ,

તિષુને પ્રાયશ્ક્રિતરો કાંઈ થાગ રે ॥ ભ. ॥ ૩૦ ॥

મોલરો કિયો હોષ સૂત્ર સ્થું બતાવો,  
સૂત્ર મેં હોષ અનેક ।

નિત પિણડ રો હોષ કહૂં છું,  
સુણુજ્યો આખુ વિવેક રે ॥ ભ. ॥ ૩૧

નિત રો નિત એકષુ ઘર કો વહિરૈ,  
તિષુને નિશ્ચય કહ્યા આખુચારી ।

દશવૈકાલિક રે તીજૈ અધ્યયને,  
શાંકા મ જણ્ણુંલિગારી રે ॥ ભ. ॥ ૩૨

નિત રો નિત એકષુ ઘર કો વહિરૈ,  
તિષુને ભ્રષ્ટ કહ્યા લગવાન ।

દશવૈકાલિક રે છહું અધ્યયને,  
નેય કરો પિણાખુ રે ॥ ભ. ॥ ૩૩

નિત રો નિત એકષુ ઘર કો વહિરૈ,  
તિષુને નર્કંગામી કહ્યા લગવાન ।

દશવૈકાલિક રે છહું અધ્યાયને  
નિરણ્ય કરો ખુદ્ધિમાન રે ॥ ભ. ॥ ૩૪

નિત રો નિત એકષુ ઘર કો વહિરૈ,  
તિષુ મેં છૈ માઠી ખોડ ।

આચારંગ પહેલે શુત ખંધે,  
કહુ દિયા લગવન્તો ચોર રે ॥ ભ. ॥ ૩૫

નિત રો નિત એકષુ ઘરકો વહિરૈ એક વાર,  
તિષુને ચૌમાસી પ્રાયશ્રિત હેણો ।

સદા નિતરો નિત ઠેઠ સ્થું વહિરૈ તિષુને,  
પ્રાયશ્રિત રો કાંધ કેહણો રે ॥ ભ. ॥ ૩૬

नित रो नित अेकषु धर को वहिरै,

तिष्णुने संपदो दौपष्टु लाजै ।

सदा नित रो ठेठ स्थुं वहिरै,

तिष्णुने प्रायश्चित रो कांच आग रे ॥ ल. ॥ ३७ ॥

आगत लेखधारी नित रो नित वहिरै,

अेकषु धर को आहार ।

पूछयांथी पाधरा नहीं बोलै,

जूठ बोलै विविध प्रकार रे ॥ ल. ॥ ३८ ॥

आगत लेखधारी नित रो नित वहिरै,

अेकषु धर को आहार पाणी ।

पूछयां यकी पाधरा नहीं बोलै,

जूठ बोलै बाणी बाणी रे ॥ ल. ॥ ३९ ॥

आहार तण्हो संसाग न तोडया,

ते पिष्टु आवा ने काजै ।

अेम मांडलै रा आहार जुवा जुवा करै छै,

निर्वन्जा भूल न लाजै रे ॥ ल. ॥ ४० ॥

॥ ढाळ भील ॥

( रे मुनिवर उन हया प्रतिपादो ए डेशा )

आधाकरभी स्थानक माहे साध रवै तो,

पैहडोई महाप्रत आगो ।

हया रहित क्ष्यो सूत्र लगवती मे-

अनन्ता जनम भरष्टुकरसी आगो रे ॥

मुनिवर उव हया प्रति भावोः ॥ ए आंकडी ॥ १ ॥

સર્વ સાવજ રા ત્યાગ કેવૈ તો;

દુલોઈ મહાત્રત લાગો ।

જે કેવૈ સ્થાનક ઝૂારે કાજ ન છીધો તો,

કપટ સહિત જૂઠ લાગો રે ॥ સુ. ॥ ૨ ॥

જે જીવ મુઅા ત્યારો શરીર ન આપૈ તો,

અદ્રા ઉષુ જીવાં રી લાગી ।

આજા લોપી શ્રીઅરિદુના હેચની,

તિષ્ણુસ્થું તીજે મહાત્રત ગયો લાગી રે ॥ સુ. ॥ ૩ ॥

બાનક ને આપણો કરિ રાખૈ,

મમતા રહૈ નિત લાગી ।

મઠ વાસો મઠ માહેં વસે જયું

પાંચમોં મહાત્રત ગયો લાગી રે ॥ સુ. ॥ ૪ ॥

ચોથો ને છફું તે તો કિષ્ણ વિધ લાયા,

આચાર કુશીલિયા ને વેણૈ ।

ઓહવા ભાગલ દિરૈ સાધાં ને લેખ મેં,

લિષુને શુદ્ધિવન્ત જાન સ્થાં હેણૈ રે ॥ સુ. ॥ ૫ ॥

એક કાય હણ્યાં સ્થૂં ઉતૃષ્ટે ભાંગો,

હિન્સા છઃ કાય રી લાગી ।

એક પ્રત ભાંગ્યાં સ્થૂં ઉતૃષ્ટે ભાંગો,

પ્રત છળો ગયા લાગી રે ॥ સુ. ॥ ૬ ॥

ધણુ સ્થૂં તો હોષ મોટા મોટા સેવે,

સાધારા લેખ મજારા ।

તે ચતુર વિચક્ષણુ જાણ હુસે તે,

તેને કેમ સરધૈ અણુગારો રે ॥ સુ. ॥ ૭ ॥

હોષ એતાલીસ કહ્યા સૂત્રમાં,  
 બાવન કહ્યા અખુાચારે ।  
 એ હોષ સેવ્યાં સેવાયાં,  
 મહાકૃત મેં પડસે જિગાડો રે ॥ સુ. ॥ ૮ ॥  
 આચારાંજ રે ખીજે અધ્યાયને,  
 છેઠે ઉદ્દેશો નિહાલો ।  
 વચન ચુષુ ચુષુને હિયે નિમાને।  
 ભત કરો આલ પાંપાલો રે ॥ સુ. ॥ ૯ ॥  
 કોઈ સ્થાનક નિમિતે અન્ય હેવે તિષુ ને,  
 ચુષુ ચુષુ ભતિ સરાવો ।  
 આપસ મેં છઃ કાય લુવાં ને,  
 જ્ઞાની કરિ લુલને કાંઈ ભરાવો રે ॥ સુ. ॥ ૧૦ ॥  
 સ્થાનક કરાવતા ને ધર્મ કહી ને,  
 ખોલાને ભત લરમાવો ।  
 આપ રહેવા ને જરૂરાં કારણે,  
 લુવાં ને કાંઈ ભરાવો રે ॥ સુ. ॥ ૧૧ ॥  
 સાધું કાજે લુલ હુણ્ણે ત્યારે,  
 હોસે ભૂડૈ સ્યું ભૂણ્ડો ।  
 જે સાધુ ઉષુજુયાં મેં રહસી તો,  
 સાધપળો તિષુ રો ખૂડો રે ॥ સુ. ॥ ૧૨ ॥  
 જિષુ સ્થાનક નિમિતે અન્ય હિયે તિષુને,  
 એટલા લુવાં નો તેને પાપો ।  
 ધર્મ જાણું તો પાપ અઠારમોં,  
 હોસે ધરો સન્તાપો રે ॥ સુ. ॥ ૧૩ ॥

સાધુ કાળે દડ નીપૈ છપરા છાવૈ,  
 લુંબ અનેક વિધ મારે ।  
 આપ દૂણૈ વતી વધ જીવા સ્નોા,  
 ગુરાં રે જનમ બિગાડે રે ॥ સુ. ॥ ૧૪ ॥  
 ચે ધમ્ય ડિકાણે જીવ હુણો તો,  
 દ્વા કયે ડેકાણે પાલો ।  
 કુગુરાં એ ભરમાયા તુમને  
 કાંઈ લગાવો કાલો રે ॥ સુ. ॥ ૧૫ ॥  
 રાત અન્ધારી ને જીવ ન સૂઝે તો,  
 આડા મત જડો કિંવાડો ।  
 છઃકાય રા પીયર બાલો તો,  
 હાથે સ્યું જીવ મત મારો રે ॥ સુ. ॥ ૧૬ ॥  
 એ થાંને સાચી સીખ ન લાગે,  
 તો મત લેવો સાધવિયાં રે શરણો ।  
 સાધાં રહણો દ્વાર ઉધાડે,  
 સાધવિયાં રે ચાલ્યો છૈ જડણો રે ॥ સુ. ॥ ૧૭ ॥  
 ગૃહસ્થ સાથે મેલો સંદેશા,  
 જબ મારી જવૈ છઃકાયો ।  
 વો જ્ઞાયાં વિના ચાવે મારગ મીં,  
 એહુવો મત કરો અન્યાયો રે ॥ સુ. ॥ ૧૮ ॥  
 એ સાધપણો થાં સ્યું પવતો નહીસે તો,  
 શાવક નામ ધરાવો ।  
 શક્તિ સાર પ્રત ચોખા પાલો,  
 હોષણું મતિ લગાવો રે ॥ સુ. ॥ ૧૯ ॥

આચાર તમારાથી પતતો ન હીસે તો,

આરાં કે માથે મતિ નહાયો ।

લગવન્ત કેદાયત બાન્ને,

તો જૂડ લોલતા કયું ન શાંકો રે ॥ સુ. ॥ ૨૦ ॥

પ્રત વિહુણું સાધુ બાન્ને,

યોં હી લોકા મેં પુજાવૈ ।

ઠાલે બાદલ જ્યું થોતા બાન્ને,

ઓ મોને અચરજ આવૈ રે ॥ સુ. ॥ ૨૧ ॥

ધત્યાદિક આચાર માંહીં ને

પૂરો કેમ કહુવાયો ।

હિન્સા માંહી ને ધર્મ થાપો તે,

પિણુ ખખર ન કાયો રે ॥ સુ. ॥ ૨૨ ॥

તેલો કરે તિણુ ને તીન દિન કોધિ,

ઉનું પાણી કર પાવૈ ।

તિણુ ને તો આગદે રી ક્ષણી રે લેખૈ,

એકન્ત પાપ ખતાવૈ રે ॥ સુ. ॥ ૨૩ ॥

ચૈથે દિન આરમ્ભ કરી ને,

છકાય હુણીને જીમાયો ।

તિણુ મેં મિશ્ર ધર્મ પરૂપો તો

ઓ કિણુ વિધ મિલસે ન્યાયો રે ॥ સુ. ॥ ૨૪ ॥

તેલા કરે તેહને પાણી પાયાં,

એકન્ત પાપ ખતાવૈ ।

ચૈથે દિન આરમ્ભ કરીને જીમાવૈ,

તિણુ મેં મિશ્ર કિહાંથી થાવૈ રે ॥ સુ. ॥ ૨૫ ॥

ਮਿਥ੍ਰ ਮਾਡੇਂ ਧਮੰ ਕੇਵੈ ਤਿਖੁ ਰੀ ਸਰਧਾ ਰੇ ਲੇਐ,  
 ਏਂ ਧਣ੍ਹੋਂ ਚਲ ਕਹਵਾਯੋ ।  
 ਛਿਨਸਾ ਮਾਡੇਂ ਧਮੰ ਥਾਧੇਂ ਤੋ  
 ਸ੍ਰੂਤ ਸਾਮੇ ਜੇਵੇ ਰੇ ॥ ਸੁ. ॥ ੨੬ ॥  
 ਅਥੰ ਅਨਥੰ ਨੇ ਧਮੰ ਰੇ ਕਾਜੇ,  
 ਲੁਵ ਹਣ੍ਹੈ ਮਨਦ ਘੁਛਿ ।  
 ਧਮੰ ਕਾਜੇ ਲੁਵ ਹਣ੍ਹੈ ਤਾਰੀ,  
 ਅਛਾ ਉਨਧੀ ਸਥ੍ਯੁ ਉਨਧੀ ਰੇ ॥ ਸੁ. ॥ ੨੭ ॥  
 ਅਮੁਚਥ ਆਚਾਰ ਸਾਧੁ ਰੋ ਅਤਾਯੋ,  
 ਤਿਖੁ ਮੇਂ ਰਾਗ ਫ੍ਰੇਖ ਮਤਿ ਆਣੋ ।  
 ਏ ਵਚਨ ਸੁਖੁ ਸੁਖੁ ਛਿਧੇ ਨਿਮਾਸੇ,  
 ਮਤ ਕਦੇ ਆਂਚਾ ਤਾਣੋ ਰੇ ॥ ਸੁ. ॥ ੨੮ ॥  
 ਪ੍ਰੀਤ ਪੁਰਾਣੀ ਥੀ ਥਾਂ ਸਥ੍ਯੁ ਪਹੁੰਚੀ,  
 ਤਿਖੁ ਸਥ੍ਯੁ ਲਿਨ ਲਿਨ ਕਰ ਸਮਝੀਂ ।  
 ਜੇ ਥਾਰੇ ਮਨ ਮੇਂ ਸ਼ਾਂਕਾ ਹੁਵੈ ਤੋ,  
 ਸ੍ਰੂਤ ਕਾਢੀ ਅਤਾਉ ਰੇ ॥ ਸੁ. ॥ ੨੯ ॥  
 ਸਾਂਕਤ ਅਫੁਕੇਂ ਵਰਸ ਤੇਤੀਸੇ,  
 ਮੇਡਤਾ ਸ਼ਹੁਰ ਮਝਾਰੇ ।  
 ਵੈਸਾਅ ਵਹੀ ਦਸ਼ਮ ਦਿਨ ਥਾਂ ਨੇ,  
 ਸੀਖ ਫੀਨੀ ਛਿਤਕਾਰੇ ਰੇ ॥ ਸੁ. ॥ ੩੦ ॥

॥ ਟੋਹਾ ॥

ਪਛਿਲਾ ਅਰਿਹੁਨਤ ਨੇ ਨਮ੍ਰਾਂ, ਜਧਾਂ ਸਾਰੀਆ ਆਤਮ ਕਾਮ ।  
 ਵਕੇ ਵਿਸ਼ੇਪੇ ਕੀਰ ਨੇ, ਤੇ ਸ਼ਾਸ਼ਵੁ ਨਾਥਕ ਸ਼ਵਾਮ ॥ ੧ ॥

તિણુ કારજ સાજી આપણુા, પહુંન્તા છૈ નિરવાણુ ।  
 લિદ્ધા ને વનદણુા કરેં, જ્યાં મેટયા આવણુ જાણુ ॥ ૨ ॥  
 આચારજ સહુ સારસા, ગુણુ રતના રી ખાણુ ।  
 ઉપાધ્યાય ને સરવ સાધુજી, એ પાંચું પદવખાણુ ॥ ૩ ॥  
 વાંદીને નિત તેહને, નીચો શીશ નમાય ।  
 શુણુ ઓલખ વનદણુા કરેા, જયું લવ લવરા હુઃખ જાય ॥ ૪ ॥  
 સુગુરુ કુગુરુ હોન્નું તણી, શુણુ વિના ખખર ન કાય ।  
 પ્રથમ કુગુરુને ઓલખો, સુણો સૂતર રેા ન્યાય ॥ ૫ ॥  
 સૂતર સાખ દિયાં વિના, લોક ન માને વાત ।  
 સાંલલ તે નર નારિયાં, છોડો મૂત્ર મિથ્યાત ॥ ૬ ॥  
 કુગુરુ ચરિત અનન્ત છે, તે પૂરા કેમ કહાય ।  
 શોડા સા પરગટ કરેં, તે સુણુજ્યો ચિત્ત લાય ॥ ૭ ॥

॥ ઢાલ ત્રોળ ॥

( તિંધી સરધા કોઈ મત રાખો—એ હશી )

ઓલખણું હોંરાં લવ જીવાં,

કુગુરુ ચરિત અનન્તજી ।

કહિતાં છેહ ન આવૈ તિણુ રેા,

ઇમ ભાજ્યો લગવન્તજી ।

સાધુ મત જણો ધણુ ચલગત સું ॥ ૧ ॥

આધાકરમી થાનક મૈં રહૈ તોા,

પડ્યો ચારિત મેં લેદજી ।

નિશીથ રે હશમેં ઉદેશૌ,

ચાર માસ રે છેદજી ॥ સા. ॥ ૨ ॥

અઠારે ઠાણુા કહ્યા જૂવા જૂવા,  
     એક નિરાધૈ ડોયળ ।  
 બાળ કહ્યો શ્રી જિષુશ્વર,  
     સાધ મ જણો સોયળ ॥ સા. ॥ ૩ ॥  
 આહાર સેજયા ને વસતર પાતર,  
     અસુધ લિથાં નહીં સન્તળ ।  
 દશવૈકાલિક છઠૈ અદ્યયને,  
     ભીષ્ટ કહ્યો ભગવન્તળ ॥ સા. ॥ ૪ ॥  
 અચિત વસ્તુ ને મોદ લિરાવૈ,  
     તો સુમત શુપત હુવે ખણ્ડળ ।  
 મહાવરત પાંચ હી લાગૈ,  
     તિષ્ણ રો ચૌમાસી ડંડળ ॥ સા. ॥ ૫ ॥  
 એ તો ભાવ નિર્ણિથ મેં ચાલ્યા,  
     ઉગણીસમે ઉદ્દેશળ ।  
 શુદ્ધ સાધુ વિષુ કુષુ સુષુવૈ,  
     સૃતની ઊડી રેંશળ ॥ સા. ॥ ૬ ॥  
 પુસ્તક પાતરા ઉપાસરાહિ,  
     લિવરાવૈ લે લે નામળ ।  
 આછા બૃષ્ટડા કહી મોદ બતાવૈ,  
     કરે ગૃહસ્થ રો કામળ ॥ સા. ॥ ૭ ॥  
 આહક ને તો કઇયો કહીએ,  
     કુગુરુ વચ્ચે દલાલળ ।  
 વેચણુવાલો કહ્યો વાણીયો  
     તીનાં રો એક હવાલળ ॥ સા. ॥ ૮ ॥

॥ વિકયમેં વરતૈ તે તો

મહા હોષ છે એહજી ।

તીસમાં ઉત્તરાંધ્યયન મેં,

સાધુ ન કદ્યો તેહજી ॥ સા ॥ ૬ ॥

ત કો વહિરે એકષુ ધર કો,

ચ્યારાં મેં એક આહારજી ।

॥વૈકાલિક તીજે અધ્યયને

સાધુને કદ્યો આજ્જાચારજી ॥ સા ॥ ૧૦ ॥

લાવૈ નિત ધોવણુ પાણી,

તિણુ લોાઘો સૂતર રો ન્યાયજી ।

તલાયાં ઓલે નહી સુધા,

ફ્રષ્ટુ હેવૈ છિપાયજી ॥ સા ॥ ૧૧ ॥

હિં કદેપૈ તે વસ્તુ વહિરૈ,

તિણુ મેં મોટી ખોડજી ।

ચારાંગ પહિલે શુતખંધે,

કહિ દિયો ભગવન્ત ચોરજી ॥ સા. ॥ ૧૨ ॥

હિલો વરત તો પૂરો પડિયો

જથ આડા જડે કિંવાડજી ।

ટા આગલ હોડા અટકાવૈ,

તે નિશ્ચય નહીં આજુગારજી ॥ સા ॥ ૧૩ ॥

તૌ હાથે જડે ઉધાડૈ,

કરૈ જીવાં રા ધનસાનજી ।

હસ્થ ઉધાડને આહાર વહિરાવે,

જડ કરૈ આજુહુ-તા ॥ હેનજી ॥ સા. ॥ ૧૪ ॥

साधवियां ने जड़णे। चाल्यो,  
 तिषु री म करा ताण्डल ।  
 यां लारै कोइ साधु जड़ै तो,  
 आगल रा अडुनाण्डल ॥ सा. ॥ १५ ॥

मन करने ले जड़णे। वंछै,  
 तिषु नहीं जाणी परपीडल ।  
 पैतीसमां उत्तराध्ययनमें,  
 वरज गया मडाकीरण ॥ सा. ॥ १६ ॥

परनिन्दा में राता भाता,  
 चित में नहीं संतोषल ।  
 वीर कहो दशमां अगमांडे,  
 तिषु में तेरै होषल ॥ सा. ॥ १७ ॥

कहै दीक्षा वे तो मो आगल लीजै,  
 और कनै हे टालल ।  
 कुण्डल एहना सूंस कर वे,  
 आ चोडे उन्हीं चालण ॥ सा. ॥ १८ ॥

इषु बंधा थी भमता लाजै,  
 गृहस्थ सूं लेतप यायल ।  
 निशीथ रे चाथै उहैशै,  
 हंड कहो जिनरायल ॥ सा. ॥ १९ ॥

जिमणुवारमें वहिरषु जावै,  
 आ साधांरी नहीं रीतल ।  
 वरजयो। आचारांग खुडतकेप में,  
 वली उत्तराध्यशन निशीथल ॥ सा. ॥ २० ॥

ਆਵਸ ਨਹੀਂ ਆਰਾ ਮੇਂ ਜਤਾਂ,  
 ਐਠੀ ਪਾਂਤ ਵਿਸ਼ੇਖਣ ।  
 ਸੁਰਸ ਆਹਾਰ ਵਧਾਵੈ ਲਰ ਪਾਤਰਾਂ,  
 ਜ੍ਯਾਂ ਲਜ਼ਿਆ ਛੋਡੀ ਲੇ ਲੇਖਣ ॥ ਸਾ. ॥ ੨੧ ॥  
 ਚੇਲਾ ਕਰਣੁ ਰੀ ਚਲਗਤ ਜਿਨ੍ਹੀ,  
 ਚਾਲਾ ਘਣੋਤ ਚਲਾਧਣ ।  
 ਕਿਥਾਂ ਇੱਹੋ ਗੁਫ਼ਦਥ ਨੇ ਸਾਥੇ,  
 ਰੋਤੁਤ ਹਾਮ ਹਿਰਾਧਣ ॥ ਸਾ, ॥ ੨੨ ॥  
 ਵਿਵੇਕ ਵਿਕਲ ਨੇ ਚਾਂਗ ਪਹਿੰਚਾਵੈ  
 ਲੇਕੇ ਕਰੈ ਆਹਾਰਣ ।  
 ਸਾਮਗਰਿ ਮੇਂ ਜਾਧ ਵਾਂਢਾਵੈ,  
 ਝ੍ਰਿਵ ਝ੍ਰਿਵ ਹੁਵੈ ਘੁਚਾਰਣ ॥ ਸਾ. ॥ ੨੩ ॥  
 ਅਜ਼ੋਗ ਨੇ ਦੀਕ਼ਾ ਦੀਧੀ ਤੇ,  
 ਭਗਵਨਤਨੀ ਆਜ਼ਾ ਬਾਰਣ ।  
 ਨਿਸ਼ੀਥ ਰੋ ਝਾਡ ਮੂਲ ਨ ਮਾਨੈ,  
 ਤੇ ਵਿਟਲ ਹੁਵਾ ਵਿਡਰਾਲਣ ॥ ਸਾ. ॥ ੨੪ ॥  
 ਵਿ਷ੁ ਪਡਵੇਦਾਂ ਪੁਸ਼ਟਕ ਰਾਖੈ,  
 ਤੋ ਜਮੈ ਲੁਵਾਂ ਜਾਂ ਜਲਣ ।  
 ਪੜੈ ਕੁਞਚਨਾ ਉਪਜੈ ਮਾਂਕਡ,  
 ਜਿਥੁ ਬਾਂਧੀ ਲਾਗੀ ਪਾਲਣ ॥ ਸਾ. ॥ ੨੫ ॥  
 ਜੇਵੈ ਵਰਸ ਛ ਮਾਸ ਨਿਕਲਿਧਾਂ,  
 ਤੋ ਪਹਿਕੇ ਵਰਤ ਹੁਵੈ ਅ਷ੁਡਣ ।  
 ਨਿਤ ਪਡਵੇਦਾਂ ਵਿ਷ੁ ਮੇਵੈ ਤਿਣੁ ਨੇ,  
 ਏਕ ਮਾਸ ਰੋ ਝਾਡਣ ॥ ਸਾ. ॥ ੨੬ ॥

ગૃહસ્થ સાથે કહે સંહેશો,  
 તો લેદો હુવૈ સંલોગજી ।  
 તિણુ ને સાધુ કિમ સરધીજૈ.  
 લાગો જેગને રોગજી ॥ સા ॥ ૨૭ ॥  
 સમાચાર વિવરાસુધ કહી કહી,  
 સાની કર ગૃહસ્થ એલાયજી ।  
 કાગદ લિખાવે કરી આમના,  
 પર હુથ દેવૈ ચલાયજી ॥ સા. ॥ ૨૮ ॥  
 આવણુ જાવણુ એસણુ ઉઠખુરી,  
 જાયગા દેવૈ ખતાયજી ।  
 ઈત્યાદિક સાધુક હૈ ગૃહસ્થ ને,  
 તો એહું ખરાખર થાયજી ॥ સા ॥ ૨૯ ॥  
 ગૃહસ્થને દેવ લોટપાતરાં,  
 પૂહાં પરત વિરોષજી ।  
 રજેડુરણુ ને પૂંજ્યી દેવૈ,  
 તે લિષ્ટ હુવા લેઇ લેષજી ॥ સા ॥ ૩૦ ॥  
 પૂછૈ તો કહૈ પરઠ દિયા મેં,  
 ફૂટ કપ્ટ મન માંહિજી ।  
 કામ પડૈ જખ જાય ઉરાડૈ,  
 ન મીઠી અન્તર ચાહિજી ॥ સા ॥ ૩૧ ॥  
 કહૈ પરઠયાં ગૃહસ્થને દેઇ,  
 એલૈ એલ. અન્યાયજી ।  
 કહ્યો આચારાંગ ઉત્તરધ્યયન મેં,  
 સાધુ પરઠૈ એકન્ત જાયજી ॥ સા. ॥ ૩૨ ॥

ਤੇਰੈ ਗੁਹਿਸਥ ਸ੍ਰੂੰ ਸਦਲਾ ਘਵਲੇ।

ਪਿਤ ਨਾਮ ਧਰਾਯਲੁ ।

ਪੂਰੀ ਪਡੀ ਸਗਲਾਂ ਵਰਤਾਂ

ਲੇਖ ਕੇ ਭੂਲਾ ਜਾਯਲੁ ॥ ਸਾ ॥ ੩੩ ॥

ਥਾਡੀ ਉਪਾਧਿ ਗੁਹਿਸਥਨੇ ਫੀਧਾਂ।

ਵਰਤ ਰਹੈ ਨਹੀਂ ਏਕਲੁ ।

ਚੋਮਾਸੀ ਫੁੱਝ ਨਿਸ਼ੀਥ ਮੇਂ ਗੁਥਯੋਾ,

ਤਿਥੁ ਛੇਡੀ ਜੁਨ ਖੰਮੰ ਟੇਕਲੁ ॥ ਸਾ ॥ ੩੪ ॥

ਵਿਨ ਆਂਕੁਸ ਜਿਮ ਹਾਥੀ ਚਾਲੈ,

ਥੋਡੇ ਵਿਗਰ ਲਗਾਮਲੁ ।

ਅਛੁਕੀ ਚਾਲ ਕੁਗੁਰਾਂ ਰੀ ਜਾਣ੍ਹੋ,

ਕਹੁਚਾਨੇ ਸਾਧੁ ਨਾਮਲੁ ॥ ਸਾ ॥ ੩੫ ॥

ਆਣੁਕੁਪਾ ਨਹੀਂ ਛਹੁੰ ਕਿਥਨੀ

ਗੁਣ੍ਣ ਵਿਨ ਕਹੇ ਅਮੇ ਸਾਧਲੁ ।

ਆ ਚਰਚਾ ਆਣੁਧੋਗ ਫੁਵਾਰਮੇਂ,

ਵਿਰਲਾ ਪਰਮਾਰਥ ਲਾਧਲੁ ॥ ਸਾ ॥ ੩੬ ॥

ਕਹ੍ਯੋ ਆਚਾਰਾਂਗ ਉਤਾਰਾਧੇਨ ਮੇਂ,

ਸਾਧੁ ਕਰੇ ਚਾਲਤਾਂ ਵਾਤਲੁ ।

ਭਾਂਚੀ ਤਿਰਥੀ ਫਿਝਿ ਜ਼ੇਵੈ,

ਤੋ ਹੁਕੈ ਛਿਕਾਧ ਰੀ ਘਾਤਲੁ ॥ ਸਾ ॥ ੩੭ ॥

ਚਰਸ ਆਹਾਰ ਕੇ ਵਿਨ ਮਰਧਾਦਾ,

ਤੋ ਵਧੈ ਫੇਹੀਰੀ ਕੋਧਲੁ ।

ਕਾਚ ਮਖ੍ਯ ਪਰਕਾਸ਼ ਕੇ ਜਥੁਂ,  
     ਕੁਝੁੰ ਮਾਧਾ ਥੋਥਾਅ ॥ ਸਾ ॥ ੩੮ ॥  
 ਫਿਲਕ ਫਿਲਕ ਉਤਾਰਲਾ ਚਾਲੈ,  
     ਤਸ ਥਾਵਰ ਮਾਡੀ ਜਾਧਾ ।  
 ਧਰਨਯਾ ਸੁਮਤ ਜੇਥਾਂ ਵਿਨ ਚਾਲੈ,  
     ਤੇ ਕਿਮ ਸਾਂਧੁ ਥਾਧਾ ॥ ਸਾ. ॥ ੩੯ ॥  
 ਕਪਡਾਂ ਮੇਂ ਲੋਧੀ ਮਰਧਾਦਾ,  
     ਲਾਂਘਾ ਪਨਾ ਲਗਾਧਾ ।  
 ਇਖਕਾ ਰਾਖੈ ਹੋਧ ਪੁਰ ਉਡੈ,  
     ਵਕੇ ਐਕੈ ਮੁਖਾਵਾਧਾ ॥ ਸਾ. ॥ ੪੦ ॥  
 ੩੦ਟਪੁਣ੍ਟ ਨਰ ਮਾਂਸ ਵਖਾਰੈ,  
     ਕੈ ਵਿਗੈਰਾ ਪ੍ਰੂਧਾ ।  
 ਮਾਠਾਂ ਚਰਿਖੁਆਮਾਂ ਨਾਰਥਾਂ ਨਿਰਖੈ,  
     ਤੋ ਸਾਂਧੁਪਥਾ ਥੀ ਫੂਰਾ ॥ ਸਾ. ॥ ੪੧ ॥  
 ਓਪਥੱਖੁ ਕੇ ਅਧਿਕਾਂ ਰਾਖੈ,  
     ਤਿਖੁ ਮੋਟੇ ਕਿਚੋ ਅਨਧਾਧਾ ।  
 ਨਿਸ਼ੀਅ ਰੇ ਸੋਲਮੇਂ ਉਫੇਈ,  
     ਚੋਮਾਸੀ ਚਾਰਿਤ ਜਾਧਾ ॥ ਸਾ. ॥ ੪੨ ॥  
 ਮੂਰਖ ਨੇ ਗੁੜ ਏਹਵਾ ਮਿਲਿਧਾ,  
     ਤੇ ਲੇਇ ਕੁਭਸੀ ਲਾਰਾ ।  
 ਸਾਚੋ ਮਾਰਗ ਸਾਂਧੁ ਬਤਾਵੈ,  
     ਤੋ ਲਡਵਾ ਨੇ ਹੁਕੇ ਤਾਰਾ ॥ ਸਾ. ॥ ੪੩ ॥  
 ਅਹਵਾ ਗੁੜ ਸਾਚਾ ਕੰਡੀ ਮਾਨੈ,  
     ਤੇ ਅਨਧ ਅਜਾਨੀ ਬਾਣਾ ।

ઝોડા પડૈ ઉત્કૃષ્ટા તિષ્ણ મેં,  
ઝેવે અનન્તો કાલજી ॥ સા. ॥ ૪૪ ॥

હલુકરમી જીવ સુષુ સુષુ હરવૈ,  
કરે આરી કર્મો દ્વેષજી ।

સુતર રેં ન્યાય નિન્દા કર જાનૈ,  
તો દૂણે વલે વિશેષજી ॥ સા. ॥ ૪૫ ॥

॥ દોઢા ॥

લેખ પહેંચો લગવાન રેં, સાધુ નામ ધરાય ।  
આચાર મેં ઢીકા ધણ્ણા, તે કણો કઠા લગ જાય ॥ ૧ ॥

ત્યાંને વાંદૈ શુરૂ જાણુને, વલે કૂડી કરે પખપાત ।  
ત્યાં જૂઠા ને સાચા કરવા ખપૈ, ત્યારે મોટો શાલમિથયાત ॥

કુશુર તણ્ણા પગ વાંદને, આગૈ ખૂડા જીવ અનન્ત ।  
વલૈ ખૂડૈ ને ખૂડસી ધણ્ણા, ત્યારે કહતાં ન આવે અન્ત ।  
સાધ ભારગ છૈ સાંકડો, તિષ્ણમેં ન ચાલૈ ખોટ ।  
આગાર નહીં ત્યારે પાપરે, ત્યાં વરત કિયા નવકોટા ॥ ૪ ॥

લેખધારી ભાગલ ધણ્ણાં, ત્યાંસ્નુ પલૈ નહીં આચાર ।  
કુશુ કુશુ અકારજ કર રહ્યા, તે સુણુન્યો વિસ્તાર ॥ ૫ ॥

### દાલ ચોથી

( આદર જીવ ભિમ્યાં શુણુ આદર એ દેશી )

કુશુર તણ્ણા અરિત ભાડેર કર સું,  
સુતરની દેષ સાખજી ।

सुभता आਖु सुਣो। ਭਰ ਜਵਾਂ,  
 ਸ਼੍ਰੀਵੀਰ ਗਯਾ ਛੈ ਲਾਖਲੁ ॥  
 ਸਾਧ ਮਤ ਨਾਣੋ। ਇਖੁ ਆਚਾਰੇ ॥ ੧ ॥  
 ਜੇ ਥੇ ਕੁਗੁੜੁ ਸੌਂਠਾ ਕਰ ਆਵਧਾ,  
 ਤੋ ਸੁਣੁ ਸੁਣੁ ਮ ਕਰੋ ਫੇਖਲ ।  
 ਸਾਚ ਭੂਠ ਰੋ ਕਰੋ ਨਿਵੇਰੋ,  
 ਸੂਤਰ ਸਾਮੋ ਫੇਖਲ ॥ ਸਾ. ॥ ੨ ॥

ਅਮਥਾਰ ਮਾਂਡੀ ਸ੍ਰੂੰ ਕੋਇ ਗੁਹਵਥ,  
 ਵਾਵੈ ਧਾਵਖੁ ਪਾਣੀ ਮਾਂਡਲ ।  
 ਪਛੈ ਆਪ ਤਥੁ ਧਰੇ ਆਖੁ ਵਹਿਰਾਵੈ,  
 ਤੇ ਕਰੇ ਲੇਖ ਨੇ ਲਾਂਡਲ ॥ ਸਾ. ॥ ੩ ॥

ਜਾਖੁ ਜਾਖੁਨੇ ਸਾਖੁ ਵਹਿਰੇ,  
 ਤਿਥੁ ਲੋਧੁ ਫਿਧੋ ਆਚਾਰਲ ।  
 ਤੇ ਪ੍ਰਤਖਕ ਸਾਹਮੋ ਆਏਧਾ ਲਵ,  
 ਤਾਂਨੇ ਕਿਮ ਕਿਛਿਜੈ ਅਖੁਆਰਲ ॥ ਸਾ. ॥ ੪ ॥

ਓ ਅਖੁਆਰ ਉਧਾਡਾ ਸੇਵੈ,  
 ਜੇ ਸਾਹਮੋ ਆਏਧੋ ਵੇ ਆਹਾਰਲ ।  
 ਦੁਖਵੈਕਾਲਿਕ ਤੀਜੈ ਅਧਿਧਨੇ,  
 ਕੋਇ ਜੇਵੋ ਆਂਖ ਉਧਾਰਲ ॥ ਸਾ. ॥ ੫ ॥

ਸਾਧ ਸਾਧਵੀ ਫਲੇ ਮਾਨੇ,  
 ਐਕਖੁ ਫਰਵਾਲੇ ਲਾਖਲ ।  
 ਵੀਰ ਵਚਨ ਸ੍ਰੂੰ ਉਤਟਾ ਪਤਿਆ,  
 ਚਰਕੈ ਕੁਰੇ ਅਨਿਆਖਲ ॥ ਸਾ. ॥ ੬ ॥

શાંખ નગર પુર પાટણુ પાડો,

તિષ્ણુરેા હુવૈ એક નિકાલજ ।

તિહાં સાધ સાધવી નહીં રહૈ લેવા,

આ બાંધી ભગવન્ત પાલજ ॥ સા. ॥ ૭ ॥

એકણુ દરવાજે સાધ સાધવી,

જવૈ નગરી આરજ ।

તો અપ્રતીત ઉઠે લોકાં મેં,

કેદ વરત ભાગૈ હુવૈ ખુનારજ ॥ સા. ॥ ૮ ॥

જુહો જુહો નિકાલ છૈ તો પિણુ,

કેદ જવૈ એકણુ દરવાજજ ।

થેઠા હટક ન માનૈ કિષ્ણરી,

વદે ન માનૈ મન મેં લાભજ ॥ સા. ॥ ૯ ॥

એક નિકાલ તિહાં રહિણોધ વરજયો.

તો કિમ જાએ એકણુ હુનારજ ।

એ બૃહત્કદ્વય રૈ પહિલે ઉદ્દેશો,

તે બુધવન્ત કરે વિચારજ ॥ સા. ॥ ૧૦ ॥

ગૃહસ્થને ઘર જાય ગોચરી,

જો જડિયો હૈએ હુનારજ ।

તિહાં સુધ સાધુ તો દિર જાય પાછા,

લાગવ જવૈ ખોલ કિંવારજ ॥ સા. ॥ ૧૧ ॥

કેદ લેખધાર્યાં રૈ એહવી સરધા

જો જડિયો હૈએ હુનારજ ।

તો ધણી તણી આગન્યા લેદ ને

માંહિ જવૈ ખોલ કિંવારજ ॥ સા. ॥ ૧૨ ॥

હાથ સૂં સાધ કિંવાર ઉધાડૈ,

માંહિ જાવ વહિરણુ ને આહારળ ।

કસડી દીકી કરૈ પરપણુા,

તે વિટલ હુવા વિકરાલજ ॥ સા. ॥ ૧૩ ॥

કિંવાર ઉધાડી ને આહાર વહિરણુ રો,

મૂલ ન સરઘૈ પાપજ ।

કદા ન ગયા તો પણ ગયા સરીખા,

આ કર રાખી છૈ થાપજ ॥ સા. ॥ ૧૪ ॥

કિંવાર ઉધાડ ને વહિરણુ ને જાવૈ,

તો હિંસા જુવાં રી થાયજ ।

તે આવસગ સૂતર માંહિ વરજયો,

ચૈયાથા અદ્યયન રે માંયજ ॥ સા. ॥ ૧૫ ॥

ગાંવ નગર ખારૈ ઉતરિયો,

કટક સથવારો તાહિજ ।

બે સાધુ રાત રહે તિણુ ઠામે,

તે નહીં જિણુ આજા થાંહિજ ॥ સા. ॥ ૧૬ ॥

એક રાત રહૈ કટક મેં તિણુ ને

ચ્યાર માસ રો છેદજ ।

એ બૃહત્કલ્પ રે તીજે ઉદેસૈ,

તે સુણુ સુણુ ભ કરો ખેદજ ॥ સા. ॥ ૧૭ ॥

કસડા હોષ જાણી ને સેવૈ,

તિણુ છોડી જુણુ ધર્મ રીતજ ।

એહવા ભિષ્ટ આચારી ભાગત

ત્યાંરી કુણુ કરસી પરતીતજ ॥ સા. ॥ ૧૮ ॥

બિન કારણ આંખ્યાં મેં અંજણુ,  
     ને ધાવૈ આંખ ભારળ ।  
 ત્યાંને સાધવિયાં કેમ સરધીનૈ,  
     ત્યાં છોડ દિયો આચારળ ॥ સા. ॥ ૧૬ ॥  
 બિન કારણ ને અંજણ ધાવે  
     તો શ્રી જિન આજા બારળ ।  
 દશવૈકાલિક તીજૈ અધ્યયન,  
     તે ઉધાડો અનાચારળ ॥ સા. ॥ ૨૦ ॥  
 વાં પાત્ર પોથી પાનાહિક,  
     લય ગૃહસ્થ રે ધરે મેલળ ।  
 પછી વિહાર કર હે ધણી ભલામણુ,  
     તિણુ પ્રવચન દીધા ઠેલળ ॥ સા. ॥ ૨૧ ॥  
 પછે ગૃહસ્થ આંહમા સાંહમા મેલતાં,  
     હિંસ્યાં જીવા રી થાયળ ।  
 તિણુ હિંસા સું ગૃહસ્થ ને સાધુ,  
     દોતું ભારી હુંવૈ તાયળ ॥ સા. ॥ ૨૨ ॥  
 ભાર ઉપરાવે ગૃહસ્થ આગૈ,  
     તે કિમ સાધુ થાયળ ।  
 નશીથ રે ભાર મેં ઉદ્દેશો,  
     ચૌમાસી ચારિત લયળ ॥ સા. ॥ ૨૩ ॥  
 વલે વિષ પડલેહાં રહે સદા નિત,  
     ગૃહસ્થ ર્ય ધર માંયળ ।  
 એ સાખપણો રહસી કિમ ત્યારો,  
     બેવો સૂતર રો ન્યાયળ ॥ સા. ॥ ૨૪ ॥

એ વિષુ પડલેહ્યાં રહે એકષુ હિન,

તિષુને ડંડ કહો માસીકળ ।

નિશીથ રે દ્રજે ઉહેશૈ

તિહાં જેય કરો તહુતીકળ ॥ સા. ॥ ૨૫ ॥

માતપિતાદિક સગા સ્નેહી,

ત્યાંરા ઘર મેં હેણૈ ખાતળ ।

ત્યાંને પરિગરે સાધ દિરાવૈ,

આ ચૌડે કુગુરે રી ચાલળ ॥ સા. ॥ ૨૬ ॥

સાનીકરસાધ દિરાવૈ ઝુપિયા,

વરત પાંચમોં ભાગળ ।

વલે પૂછ્યાં બૂઠ કષ્ટ સૂં ઝાલૈ,

ત્યાં પહિર બિગારો સાંગળ ॥ સા. ॥ ૨૭ ॥

ન્યાતીલાને દામ દિરાવૈ,

તિષુ રે મોહ ન મિટિયો કોયળ ।

વલે સાર સંલાર કરાવૈ ત્યાંરી,

તે નિશ્ચય સાધ ન હેયળ, ॥ સા. ॥ ૨૮ ॥

અનરથ રે મૂલ કહોણ પરિગરે,

ઠાણુંગ તીંબે ઠાણળ ।

તિષુ રી સાધ કરૈ દલાલી,

તે પૂરા મૂઠ અભષુળ ॥ સા. ॥ ૨૯ ॥

અતુ ઉન્હાલે પાણી ઠારે,

ગૃહસ્થ રા ઠામ મજારળ ।

મનમાને જથ પાછા સ્ફૂરૈ,

તે શ્રી જિન આજા ખારળ ॥ સા. ॥ ૩૦ ॥

ગૃહસ્� રા લાજન મેં સાધુ,

જીમે અસલ્યાદિક આહારળુ ।

તિષ્ણ ને બિંટ કહ્યો દશવૈકાલિક મેં,

છઠા અધ્યયન મજારળુ ॥ સા. ॥ ૩૧ ॥

કેઈ સાંગ પહિર સાધવિયાં બાજે,

પિષ્ણ ઘટ માંહિ નહીં વિવેકળુ ।

આહાર કરે જાંડ જડે કિંવાડ,

વદે દિન માહિ વાર અનેકળુ ॥ સા. ॥ ૩૨ ॥  
કરડે માતરે ગોચરી જાવૈ,

જથું આડા જડે કિંવારળુ ।

વદે સાધાં કનૈ આવૈ તોહી જરને,

ત્યારોં બિગર ગયો આચારળુ ॥ સા. ॥ ૩૩ ॥  
સાધવિયાં ને જડણો ચાલ્યો,

તે શીલાદિક રાખણુ કાજળુ ।

ઔર કામ જો જડે સાધવી,

તિષ્ણ છોડી સંજમ લાજળુ ॥ સા. ॥ ૩૪ ॥

આવસગ માંહિ હિંસા કહી જડિયાં,

આદોષણુ ખાંતે તાહિલુ ।

મન કરને જડણો નહિ વંછૈ,

ઉત્તરાધ્યયન પૈંતીસમાં માંહિલુ ॥ સા. ॥ ૩૫ ॥

ઔપધ આદ હે વહિરી આણૈ,

કોઈ વાસી રાખૈ રાતળુ ।

તે ભાય મેલૈ ગૃહસ્થરા ઘર મેં,

પછૈ નિત લાવૈ પરભાતળુ ॥ સા. ॥ ૩૬ ॥

આપ રો થકો ગૃહસ્થ ને સૂંઘે,  
 ઓ મોટો હોખ પિછાણુલ ।  
 વલે બીજો હોખ વાસી રાખ્યાં રો,  
 તીજો અજૈણુા રો જણુલ ॥ સા. ॥ ૩૭ ॥  
 વલે ચૈંદ્રા હોખ પૂછ્યાં ઝૂઠ એલૈ,  
 વાસી રાખ્યો ન કહે મૂશુલ ।  
 કેદ લેખધારી છે એહવા ભાગત,  
 ત્યારે ઝૂઠ કપટ છૈ ગૂઠણ ॥ સા. ॥ ૩૮ ॥  
 ઔષધ આદ હે વાસી રાખ્યાં,  
 વરતાં મેં પડૈ વધારણ ।  
 કંધો દશવૈકલિક તીજૈ અધ્યયને,  
 વાસી રાખૈ તો અણ્ણાચારણ ॥ સા. ॥ ૩૯ ॥  
 કોઈ આધાકરમી પુસ્તક વહિરે,  
 વલે તેહિજ લીધાં મોલણ ।  
 તે પિણુ સાહમાં આએથાં વડિરે,  
 ત્યારે મોટી જણુણ્ણો પોલળ ॥ સા. ॥ ૪૦ ॥  
 કોઈ આપ કને દીક્ષા લે તિણુરે,  
 સાની કર મેલૈ સાજણ ।  
 પુસ્તક પાનાદિક મોલ લિરાવ,  
 વલે કુણુ કુણુ કરે અકાજણ ॥ સા. ॥ ૪૧ ॥  
 ગંધીવાસી પ્રમુખ આજા સૂં,  
 લિખાવૈ સૂતર જણુણ ।  
 અહિતા મોલ કરાય પરત રો,  
 સંચકર હિરાવૈ આણુણ ॥ સા. ॥ ૪૨ ॥

झंपिया भेहलावै और तथे धर,  
 छसडो सैंडो करै आमल ।  
 ते पिष्टु हःथ परत आयां विन,  
 हीक्षा हे मूडे तामल ॥ सा. ॥ ४३ ॥  
 पछै गच्छवासी विकलां सूं डरतां,  
 परत लिखै दिन रातल ।  
 अब अनेक भरै तिष्टु लिखतां,  
 करै त्रस थावर री धातल ॥ सा. ॥ ४४ ॥  
 धष्टु लिध साधु परत लिखावै,  
 तिष्टु संयम हीधो ऐयल ।  
 जे हया रहित छै ओहवा हुण्ठी,  
 ते निश्चय साध न होयल ॥ सा. ॥ ४५ ॥  
 छःकाय हण्णीने परत लिखी ते,  
 आधाकरभी जाष्टुल ।  
 तेहिज परत तो साधु वहिरे,  
 तो भागल रा ओहनाष्टुल ॥ सा. ॥ ४६ ॥  
 वले तेहिज परत टोला भें राखै,  
 आधाकरभी जाष्टुल ।  
 जे सामिल हुवा ते सघला दुआ  
 तिष्टुभे शंका भत आष्टुल ॥ सा. ॥ ४७ ॥  
 आधाकरभी रा वेवाय इलै तो,  
 उल्कुण्ठो काल अनन्तल ।  
 हया रहित क्षेया तिष्टु साधु ने,  
 भगवती भें भगवन्तल ॥ सा. ॥ ४८ ॥

કોઈ શાબક સાધ સમીપે આએ,  
     હરથે વાંદે પગ જાલજ ।  
 જદુ સાધુ હાથ હે તિણુ રે માથૈ,  
     આ ચોડે કુગુર રી ચાલજ ॥ સા. ॥ ૪૬ ॥  
 ગૃહસ્થ રૈ માથૈ હાથ હેવૈ તો,  
     ગૃહસ્થ બરાખર જણજ ।  
 એહવાં વિકલાં ને સાધુ સરધૈ  
     તે પિણુ વિકલ સમાનજ ॥ સા. ॥ ૫૦ ॥  
 ગૃહસ્થ રૈ માથૈ હાથ દિયો તિણુ,  
     ગૃહસ્થ સૂં ઢીધો સંલોગજ ।  
 તિણુને સાધુ કિમ સરધીને,  
     લાગો જેગ ને રોગજ ॥ સા. ॥ ૫૧ ॥  
 દશવૈકાલિક આચારાંગ માંહી,  
     વલે જેવો સૂત્ર નિશીથજ ।  
 ગૃહસ્થ ને માથૈ હાથ હેવૈ  
     આ પ્રત્યક્ષ ઉન્ધી રીતજ ॥ સા. ॥ ૫૨ ॥  
 ચેલા કરે તે ચોર તણી પરૈ,  
     ઠગ પાસીગર જયું તામજ ।  
 ઉજખક જયું તિણુ ને ઉચકાવૈ,  
     લે જય મૂડે ઓર ગામજ ॥ સા. ॥ ૫૩ ॥  
 આછો આહાર દિખાવ તિણુ ને,  
     કુપડાદિક મહી હેખાયજ ।  
 ધત્યાદિક લાલચ લોલ ખતાવૈ,  
     લોલા ને મૂડે ભરમાયજ ॥ સા. ॥ ૫૪ ॥

ਇਥੁ ਵਿਖ ਚੇਲਾ ਕਰ ਮਤ ਆਂਧੀਆ,  
     ਤੇ ਗੁਣੁ ਵਿਨ ਕੋਡੇ ਲੇਖਲ ।  
 ਸਾਧ ਪਥਾਂ ਰੇ ਸਾਂਗ ਪਹਿਰ ਨੇ,  
     ਲਾਰੀ ਹੁਵੈ ਵਿਸ਼ੇ਷ਲ ॥ ਸਾ ॥ ੫੫ ॥  
 ਮੂੰਡ ਸੁੰਡਾਧ ਲੇਲੇ ਈਧੀਆ,  
     ਤਾਂ ਸ੍ਰੂੰ ਪਵੈ ਨਹੀਂ ਆਚਾਰਲ ।  
 ਲੂਅ ਤੁਧਾ ਪਿਥੁ ਕਥਮਣੀ ਨ ਆਵੇ,  
     ਜਫ ਲੇਵੈ, ਅਸੁਧ ਪਿਥੁ ਆਹਾਰਲ ॥ ਸਾ. ॥ ੫੬ ॥  
 ਅਨਲ ਅਜੇਗ ਨੇ ਫੀਕਾ ਫੀਧਾਂ,  
     ਤੋ ਚਾਰਿਤ੍ਰ ਰੇ ਹੁਵੈ ਅਛੁਤਲ  
 ਨਿਸ਼ਾਥ ਰੇ ਉਫੇਰੈ ਇਗਧਾਰ ਮੇਂ,  
     ਚੌਮਾਸੀ ਰੇ ਫਂਡਲ ॥ ਸਾ. ॥ ੫੭ ॥  
 ਵਿਵੇਕ ਵਿਕਲ ਬਾਲਕ ਘੂਢਾ ਨੇ,  
     ਪਹਿਰਾਵੈ ਸਾਂਗ ਸਿਤਾਬਲ ।  
 ਤਾਂਨੇ ਲੁਵਾਇਕ ਪਦਾਰਥ ਨਵ ਰਾ,  
     ਜਾਖਕ ਨ ਅਵੈ ਜਾਖਲ ॥ ਸਾ. ॥ ੫੮ ॥  
 ਸ਼ਿਖ ਕਰਣ੍ਹੇਂ ਤੋ ਨਿਪੁਣੁ ਬੁਧ ਵਾਲੇਾ,  
     ਲੁਵਾਇਕ ਜਾਣੈ ਤਾਹਿਲ ।  
 ਨਹੀਂਤਰ ਏਕਲ ਰਹਣ੍ਹੇਂ ਟੋਲਾ ਮੇਂ,  
     ਉਤਰਾਧਿਧਨ ਬਤੀਸਮਾਂ ਮਾਂਡਿਲ ॥ ਸਾ. ॥ ੫੯ ॥  
 ਕੇਉ ਫੈ ਲੀਪੈ ਛਾਥਾਂ ਸ੍ਰੂੰ ਥਾਨਕ,  
     ਤੇ ਪਿਥੁ ਫਗਲਿਥਾ ਝੂਟਲ ।  
 ਇਕਡੋ ਕਾਮ ਕਰੈ ਤਿਥੁ ਸਾਧੁ,  
     ਪਾਡੀ ਲੇਖ ਮਾਂਡਿ ਝੂਟਲ ॥ ਸਾ. ॥ ੬੦ ॥

जे हड़ै लीपै थानक ने साधु,  
 तिष्णु श्री जिष्णु आज्ञा भांगल ।  
 तीज वरत री तीज भावना,  
 तिहाँ वरजये दशमें अंगल ॥ सा. ॥ ६१ ॥  
 छती साधवियां छै टोला भें,  
 वले कारणु न पडये डैयल ।  
 तो पिष्णु होय साधवियां करे चेमासो,  
 ओ होक्ष उधाडो जेयल ॥ सा. ॥ ६२ ॥  
 होय साधवी करे चेमासै,  
 ते जिन आज्ञा भें नाहिंल ।  
 त्यांने वरजये छै व्यवहार सूतर भें,  
 पांचमा उदेशा मांहल ॥ सा. ॥ ६३ ॥  
 कारणु विना एकली साधवी,  
 असणु दिक्ष वडिशु जायल ।  
 वले ठरडे पणु एकलडी जावै,  
 ते नहिं लुन आज्ञा मांयल ॥ सा. ॥ ६४ ॥  
 वले एकलडी ते रहेंद्रो वरजये,  
 ईत्यादिक घोल अनेकल ।  
 अहतकृप रै पांचमे उदेशो,  
 ते समझो आणु विवेकल ॥ सा. ॥ ६५ ॥  
 कुण्डल एहवा हीणु आचारी,  
 साधां सूं हे लिङ्कायल ।  
 आप तण्णुं किरतभ सूं ठरतां,  
 जिन मारग दिये छिपायल ॥ सा. ॥ ६६ ॥

ખસડા કુંગુરાં ને શુરૂ કર માને,  
 ત્યારે અલિન્તર મેં અન્ધકારળું ॥  
 શુરૂ મેં ઓટ પાય અજાની,  
 તે ચાહ્યા જનમ બિગારળું ॥ સા. ॥ ૬૭ ॥  
 અશુભ કમ્ભ જથારે ઉદ્ય હુવા જથ,  
 ઈસડા શુરૂ મિલિયા આયળુ ।  
 દુધણીજ હોય જાણક ઘૂડા,  
 પછે ચિહુંગત ગોતાં આયળુ ॥ સા. ॥ ૬૮ ॥  
 ઈમ સાલત ઉત્તમ નર નારી,  
 છોડો કુશુરનો સંગળુ ।  
 સતગુરુ સેવો સુધ આચારી,  
 દિન દિન ચઢતૈ રંગળુ ॥ સા. ॥ ૬૯ ॥  
 આ સન્નાય કરી કુશુર ઓલખાષુ,  
 શહુર પીપાડ મઝારળુ ।  
 સંવત અઠારે ને વરસ ચીંતીસ  
 આસો જ સુધી સાતમ બુધવારળુ ॥ સા. ॥ ૭૦ ॥  
 ॥ દોષ ॥

કેદ લેખધારી ભૂતા થડા, કર રહ્યા ઝૂડી તાણુ ।  
 અન્તર બતાવૈ સાધુ રે, તે સુતર અરથ અળણુ ॥ ૧ ॥  
 ત્યાં સાધપણો નહીં ઓલખ્યો, ભૂતા ભ્રમ ગિંવાર ।  
 સર્વસાવધ ત્યાજ્યો સુખસૂં કહ, વલે પાપરો કહે આગાર ॥ ૨ ॥  
 એહવા લેખધારીને અમત ખરી, પણ સાધુને ઈન્તત નકાય ॥ ૩ ॥  
 આહાર પાણી કપડાદિક ઉપરે, ઉવે સદા રહ્યા સુરજાય

ચ્યાર ગુણુડાણુા ઈત્રત કહી, ત્યાં ન દીસે વ્રત લિગાર ॥  
 દેશ વ્રત ગુણુડાણુા પાંચમો, આગે સરવ્રવ્રતી અણુગાર ॥  
 જે સાધાં રૈ ઈત્રત હુંવે, તે સર્વ વ્રતી કુણુ હોય ।  
 ત્યારા ભાવ બેદ પ્રગટ કરેં, તે સાંભળજ્યો સહુ કોય ॥૫॥

॥ દાઢ પાંચવીં ॥

( આ અંતુકમ્યા જિન આજામેં-એ દેશી )

ચ્યાવીસમાં શ્રી વીર જિનેશ્વર,  
 નિરહોષ આહાર આણીને ખાયો ।  
 સુધ પરિણુામ ઉદ્દરમેં ઉતારયો,  
 તિણુમાંહી મુરખ પાપ બતાયો ॥  
 ઈષુ પાખંડ ભત રા નિરણોં કીલે ॥ ૧ ॥  
 અનન્ત ચ્યાવીસી સુગત ગઈ તે  
 આહાર વ્યાયા થા હોષષુ ટાલો ।  
 તિષ્ઠ માંહી પાપ બતાવૈ અજ્ઞાની,  
 ત્યાં સગલાં રૈ શિર દીધો આળો ॥ ૪. ॥ ૨ ॥  
 સરવ સાધ જેગ રા ત્યાગ કરીને,  
 સરવ વ્રતી સુધ સાધ કહાવૈ,  
 તિરષુ તારણુ પુરૂષાં રૈ અજ્ઞાની,  
 ઈત્રત રા આગાર બતાવૈ ॥ ૫. ॥ ૩ ॥  
 ગોતમ આદિ હે સાધ અનન્તા,  
 સાધધિયાં રા છેડ ન પારો ।  
 સગલાં રા આહાર અધમ માંહી ધાદ્યો,  
 તિષ્ઠ આંખ મીચી ને કીધો અંધારો ॥ ૬. ॥ ૪ ॥

साधु रो जनम हुवे। किष्ण दिनथी,  
 कहै ते वस्तु वहिरी ने लावै ।  
 ते किष्ण अरिहन्त नी आज्ञा सूं,  
 तिष्ण मांडी भूरभ पाप बतावै ॥ ८. ॥ ५ ॥  
 वसतर पातरा रजूहरखारिक,  
 साधुरा उपध सूतर मांडे चाल्या ।  
 अरिहन्त री आगन्या सूं राख्या,  
 अधर्म मांडे अज्ञानी धाल्या ॥ ९. ॥ ६ ॥  
 हशवैकालिक ठाण्डा अंग में,  
 ग्रन्थ व्याकरण उवाच माहो ।  
 धरम उपध साधु रा वरत में,  
 तिष्ण मांडि हुणी पाप बतायो ॥ १०. ॥ ७ ॥  
 किष्ण ही गृहस्थ लीलोतरी ने त्यागी,  
 लुव ज्यां लग आखु वैरागो ।  
 साधपणो लेइ धन्त सरधै,  
 तो विवेकविकल खायवा कांઈ लागो ॥ ११. ॥ ८ ॥  
 अधर्म जाणु लीलोतरी आधां,  
 तो पचआखु लागो। किष्ण लेए ।  
 धर में थकां जवज्जुव त्यागी थी,  
 धिणु साहमुं भूरभ क्युं नहीं हेए ॥ १२. ॥ ९ ॥  
 किष्ण ही गृहस्थ जे जे वस्तु त्यागी थी,  
 तो अधर्म रो भूत धन्त जाणो ।  
 साधपणो लेइ सेववा लागो,  
 ते क्युं न पावै लिया पचआणो ॥ १३. ॥ १० ॥

ધીરત સરધૈ ને સુંસ ન પાલૈ,

તિણુ ભાગત રૈ છૈ ભારી કમો

મારગ છોડને ઉજર પરિયા,

સાધ આહાર કિયાં મેં સરધૈ અધમો ॥ ઈ. ॥ ૧૧ ॥

કરૈ વૈયાવચ્ચ ચેલા શુરૂ રી,

કમ્ તણું કોડ તેહ ખપાવ ।

તીથ્યંકર ગોત્ર બંધૈ ઉત્કૃષ્ટો,

પિણુ શુરૂ ને મૂરખ પાપ બતાવૈ ॥ ઈ. ॥ ૧૨ ॥

દશ વીસ ચેલા પડીકમણું કરને

શુરૂ રી વૈયાવચ્ચ કરવા ને આવે ।

તો શુરૂ ને પાપ લગાય અજ્ઞાની,

હુરગત માંય કાંય પહોંચાવૈ ॥ ઈ. ॥ ૧૩ ॥

શુરૂ ને પાપ લાગૈ વૈયાવચ્ચ કરાયાં,

સૂત્રમાંહિ કંઈ હી ન ચાલ્યો ।

મૂર્ખમતી જુવ ભારી કરમા,

ઓ પિણુ ઘોચો અણુહુન્તો ઘાલ્યો ॥ ઈ. ॥ ૧૪ ॥

શુરૂ ને પાપ સું લેલા કિયા મેં

ચેલા રા કર્મ કટૈ કિણુ લેખૈ ।

અલિન્તર કુટી ને અન્ધ થયા તે,

સૂતર સાંહમો મૂર્ખ મૂલ ન હેખૈ ॥ ઈ. ॥ ૧૫ ॥

સાધ માંહામાંહ હેવૈ ન લેવેં,

વસતર પાતર આહાર ને પાણું ।

તે પિણુ લીધા મેં પાપ બતાવૈ,

એહની કુપાતર બોલૈ વાણું ॥ ઈ. ॥ ૧૬ ॥

દાતાર ને ધમં સાધાં ને વહિરાયાં,

પિણુ સાધ વહિરી હુવા પાપ સ્તું ભારી ।

દાતાર તિરિયા સાધ ડોયા,

આ પિણુ સરધા કહૈ લેખધારી ॥ ઈ. ॥ ૧૭ ॥

જે પાપ લાગે સાધુ આહાર કિધામે,

તિણુ રૈ પાપ રો સાજ દિયો દાતારો ।

તિણુ રી આશ રાખૈ કિણુ લેખૈ,

ભૂલા રૈ ભૂલા થે મૂઢ ગિવારો ॥ ઈ. ॥ ૧૮ ॥

સાધાં તો પાપ અડારે હી લાગ્યા,

ચોખી છૈ જ્યાંરી સુમતિ ને શુપતી ।

દાતાર કને સુધ જાંચ લિયા મે,

પાપ કઠૈ સ્તું લાગો રૈ કુમતી ॥ ઈ. ॥ ૧૯ ॥

શુક્ર દીક્ષા હેઠ શિષ્ય કરે તે,

નિજરા રા લેફ માંહે ચાલ્યા ।

મોહ મિથ્યાત સ્તું ભારી કરમા,

એ પિણુ પરિગરામાં ઘાલ્યા ॥ ઈ. ॥ ૨૦ ॥

ઇઠૈ ગુણુઠાણૈ પરમાદ કહીને,

સાધાં રૈ ઈત્રત થાપૈ આવારી ।

પૂછે તો કહૈ રહે સરવ બ્રતી છા,

એ પિણુ ઝૂઠ બોલૈ લેખધારી ॥ ઈ. ॥ ૨૧ ॥

ઇઠૈ ગુણુઠાણૈ પરમાદ કહ્યો તે,

કિણુહિક વેલાં લાગતો જણો ।

વિષે કષાય અશુલ જોગ આયાં,

પિણુ મૂઢમતી કરે જન્મી તાણો ॥ ઈ. ॥ ૨૨ ॥

પ્રમાદ કહે આહાર ઉપધ સું,

કર રહ્યા કુણુદ્ધિ કૂડી વિષવાહો ।

આહાર ઉપધ કેવલી પિણ આણે,

કહે ગયો ત્વારો પરમાહો ॥ ઈ. ॥ ૨૩ ॥

અપ્રમાદી કદ્યા સાતમે ગુણુઠાણે,

પ્રમાદ નહીં તિણુ ગુણુ ઠાણુ આગૈ ।

આહાર ઉપધ વે પિણ લોગવતા,

ત્યાં સાધાં ને પ્રમાદ કયું નહીં લાગૈ ॥ ઈ. ॥ ૨૪ ॥

કેવલી આચરિયો છજ્ઞસ્થ આચરૈ,

કેવલી ત્યાગો તે છજ્ઞસ્થ ત્યાગૈ ।

આહાર ઉપધ કેવલી જયું લોગવિયાં,

તિણુ સાધા ને પ્રમાદ કિણુ વિણુ લાગૈ ॥ ઈ. ॥ ૨૫ ॥

સાધ આહાર કરતાં ચારિત કુશલે,

સુત્ર પરિણામ સું કટૈ આગળા કમો ।

જદ ઊંધમતી કોઈ અવલો એલૈ,

ધણ્ણો આવે તો ધણ્ણો હેવૈ ધમો ॥ ઈ. ॥ ૨૬ ॥

પોહર રાત તાંક સાધ ઊંચે શખ્ફૈ,

ધમો કથા કહૈ મોટે મંડાણું ।

ઉણુ ઊંધમતી રી સરધા રૈ દેખૈ,

આખી રાત મેં કરણ્ણો વખાણ્ણો ॥ ઈ. ॥ ૨૭ ॥

જૈણું સું સાધુ કરૈ પરલેહણું,

કાટવા કમો આતમ ને ઉદ્ધરણી ।

ઉણુ ઊંધમતી રી સરધા રૈ દેખૈ,

આખો હી દિન પરલેહણું કરણી ॥ ઈ. ॥ ૨૮ ॥

ਮरज्जदा सूं आहार साधां ने करण्या,

मरज्जदा सूं करण्या वभाण्या ।

मरज्जदा सूं परलेहषु करनी, ॥ ४. ॥ २६ ॥

समजे रे समजे थे भूँ अयाण्या ॥ ४. ॥ २६ ॥

॥ कारण्या आहार साधां ने करण्या,

धण्या धण्या आसी किषु लेझै ।

छ०वीसमां उत्तराध्ययन में छै,

वले छहो ठाण्या भूँ ठ कर्यु नहीं हेझै ॥ ४. ॥ ३० ॥

कहै धम् छावे साधु आहार किया में,

तो कथांने करै आहार रा पच्यभाण्या ।

पाप जाणी ने त्याग करै छै,

उलट युद्धि बोलै एहवी वाण्या ॥ ४. ॥ ३१ ॥

साधु काउसग में त्यागो हालवो चालवो,

वले भुख सूं न बोलै निरवध वाण्या ।

उषु उलट युद्धि री सरधा रै लेझै,

ऐ पिषु पाप तथा पच्यभाण्या ॥ ४. ॥ ३२ ॥

केठ साध बोलण्या रा त्याग करी भूत साजै

धम् कथा भांडी न करै वभाण्या ।

उषु उलट युद्धि री सरधा रै लेझै,

ऐ पिषु पाप तथा पच्यभाण्या ॥ ४. ॥ ३३ ॥

केठ साध साधां ने आहार हेवण्या रा,

त्याग करै मन उछरंग आण्या ।

उषु उलट युद्धि री सरधा रै लेझै,

ऐ पिषु पाप तथा पच्यभाण्या ॥ ४. ॥ ३४ ॥

કોઈ સાધુ સાધાં રી ન કરે વૈયાવચ્ચ,  
 ત્યાગ કરે મન ઉછરંગ આણો ।  
 ઉષુ ઉલટ જુદ્ધિ રી સરધા રૈ લેણૈ  
 એ પિણુ પાપ તણુા પચખાણો ॥ ક. ॥ ૩૫ ॥  
 સાધાં મૂત્ર શુષુ મેં સરવ સાવજ ત્યાગ્યો,  
 તિણુ સૂં નવાં પાપ ન વાગૈ જણો ।  
 આગલાં કર્મ કાટણુ સાધાં રે,  
 ઉત્તર શુષુ છૈ દશ વિધ પચખાણો ।  
 આ સરધા શ્રી જિનવર લાઘી ॥ આકડી ॥ ૩૬ ॥  
 કોઈ વાસ બેલાદિક કરે સંથારો,  
 કોઈ સાધ કરે નિત રોનિત આહારો ।  
 પાપ રા ત્યાગ હોયાં રે સરિયા,  
 પિણુ તપ તણો છૈ લોહજ ન્યારો ॥ આ. ॥ ૩૭ ॥  
 જૈણુા સૂં ચાલ્યા જૈણુા સૂં શિલા,  
 જૈણુા સૂં બૈઠા જૈણુા સૂં સુવંદા ।  
 જૈણુા સૂં લોજન કિયા જૈણુા સૂં બોલ્યા,  
 તિણુ સાધુને પાપ ન કહ્યો અગવન્તા ॥ અ ॥ ૩૮ ॥  
 દશવિકાલિક ચૈથે અધ્યયને,  
 આઠમી ગાથા અરિહુન્ત ભાણી ।  
 છઃબેલ સાધુ જૈણુા સૂં ડિયા મેં,  
 પાપ કહે ભારીકરમા અન્હાખી ॥ આ. ॥ ૩૯ ॥  
 નિરવદ્ય ગોચરી ઋષેશ્વરાં રી,

મોક્ષરી સાધન લગવંત સાખી ।  
 દર્શાવૈકાલિક પાંચ મેં અદ્યયને,  
 ખાણુંભી ગાથા બોલૈ સાખી ॥ આ. ॥ ૪૦ ॥  
 સુધ આહાર જિયા સાધુ સદગત જાવૈ,  
 નિરહોષ દિયાં જાવે સદગત દાતા  
 દર્શાવૈકાલિક પાંચ મેં અદ્યયને,  
 પહીલા ઉદેશા રી છેહલી ગાથા ॥ આ. ॥ ૪૧ ॥  
 સાત કર્મ સાધુ હીલાં પાડૈ,  
 સૂજતો આહાર કરે તિષ્ણ કાવેા ।  
 કાગવતી સૂતર પહીલૈ શ્રુત ખાંધે,  
 નવમો ઉદેશો જેઠ સંભાડો ॥ આ. ॥ ૪૨ ॥  
 આહાર કરે ગુરુ રી આગન્યા સું,  
 તિષ્ણ સાધુ ને વીર કદ્યો છે મોક્ષો ।  
 અડારમો અદ્યયન જાતા રો જેઠ  
 સાંસો કાડો મેટો મનરો ધોયો ॥ આ. ॥ ૪૩ ॥  
 શણદ રૂપ ગંધ રસ ફરસરી,  
 સાંધા રે ઈત્ત્રત મૂલ ન કાંયો ।  
 સૂયગડાંગ અદ્યયન અડાર મેં  
 એાર ઉવચાઈ સૂત્ર માંયો ॥ આ. ॥ ૪૪ ॥  
 સાધાં રે ઈત્ત્રત કહે પાખણડી,  
 તિષ્ણ કુમતી રી સંગત ફર નિવારો ।  
 કંમ સાંભવ ને ઉત્તમ નરનારી,  
 રસ વ્રતી બુઝ આણ પારો ॥ આ. ॥ ૪૫ ॥

॥ દોડા ॥

સમદ્વિષિત આરે પાંચમે, થોડી બુદ્ધિ અદ્વય માન ।  
 મિથ્યાદિષ્ટ જોડે હુસી, બહુ ઝંદ બહુ સન્માન ॥ ૧ ॥

સમષુ થોડા ને ભૂઠ ધણુા, પાંચ મેં આરે ચૈન ।  
 લેખ લેધ સાધુ તણો, કરસી કુડા ફૈન ॥ ૨ ॥

સાધુ અદ્વય, પૂજા હુસી, ઠાણુા અંગ મૈ સાખ ।  
 અસાધુ મહિમા અતિ ધણી, શ્રીવીર જયા છે કાખ ॥ ૩ ॥

કુદેવ કુશુર કુદ્ધર્મ મેં, ધણુા લોછ રહ્યા બંધ હોય ।  
 ઓદખને નિરણો કરે, તે તો વિરતા ન્યે ॥ ૪ ॥

સાખ મારગ છૈ સાંકડો, લોલા ને અખર ન કાય ।  
 નિમ હીવે પડે પતાંગિયો, તિમ પડૈ પગાં મેં જાય ॥ ૫ ॥

ધણુા ચાધુ ને સાધવી, શ્રાવક શ્રાવિકા લાર ।  
 ઉતટા પડી જિલ્લુ ધર્મ થી, પડસી નરક મજાર ॥ ૬ ॥

મહા નિશીથ મેં મૈ સુણી, શુણુ વિન ધારી લેખ  
 લાખાં કોડાં ગમે સાવટાં, નરક પડંતાં દેખ ॥ ૭ ॥

લીધા પ્રત ન પાલિસી, જોતી હણિ અયાણુ ।  
 તિણુ કહી છૈ નારણી, કોઈ આપ મ લેજયો તાણ ॥ ૮ ॥

આગમથી અવતા વહૈ સાધુ નામ ધરાય ।  
 સુધ કરણી થી વેગતા, તે છદ્દા કઠા લગ્ન જાય ॥ ૯ ॥

## ॥ દાલ છટ્ઠી ॥

(ચન્દ્રગુપ્ત રાજ સુણો એ હેઠી)

સીધા આપે સાધુ ને,

જ્ઞાને ઓર કરાવૈ આગૈ રે ।

અહંકા ઉપસરા લોગવ,

ત્યાંને વજર કિરિયા લાગૈ રે ।

તિષ્ણને સાધુ કિમ જાણ્યે ॥ ૧ ॥

આચારાંગ ફૂજૈ કલ્યો,

મહા કુંટ હોપણુ છૈ તિષ્ણમેં રે ।

બે વીર વચન સવલો કરો,

તો સાધુ પણો નહીં તિષ્ણમેં રે ॥ તિ. ॥ ૨ ॥

સાધુ અરથે કરાવૈ ઉપાસરો,

છાયો લિંગ્યો ગૃહસ્થ બાલ રાખી રે ॥ તિ. ॥ ૩ ॥

તિષ્ણ થાનક મેં રહૈ તેહને,

સાવધ કિરિયા લાગી રે ॥ તિ. ॥ ૪ ॥

તિષ્ણને ભાવે તો ગૃહસ્થ કળ્યો,

દિયો આચારાંગ સાખી રે ।

બેખધારી ધારી કળ્યો સિદ્ધાંત મેં,

તિષ્ણ રી ભગવન્ત કાણુ ન રાખી રે ॥ તિ. ૩૪ ॥

સિજયાતર પિણ્ડ લોગવૈ,

વહે કુણુદ્ધ કેલવે કપટી રે ।

धाणी छोड आग्या ले और री,  
 सरस आहारादिक रा लंपटी रे ॥ ति. ॥ ५॥  
 सबलो होषणु लागै तेहने,  
 निशीथ में डंड भारी रे ।  
 अणुयारी कह्यो दशवैकात्मिके,  
 लगवन्त री सीध न धारी रे ॥ ति. ॥ ६ ॥  
 अखुकंपा आणु श्रावक तणी,  
 द्रव द्विवष्टु लागै रे ।  
 झज्ज करणु घंड हुवो व्रत पांचमो,  
 तीनै करणु पांचुं ही लोगै रे ॥ ति. ॥ ७॥  
 गृहस्थ जिमावणु री करै आमना,  
 वक्ते करै साधु छलाली रे ।  
 चैमासी दंड कह्या निशीथ में,  
 वरत भांग हुवो खाकी रे ॥ ति. ॥ ८ ॥  
 करै वांसादिक नो भांधवो.  
 वक्ते किया जीत ना चेज रे ।  
 छायें लीध्यो तेहने कहीने,  
 सारी कर्म सेज रे ॥ ति. ॥ ९ ॥  
 ओहवी वसती लोगव,  
 ते साधु नहीं लवकेशो रे ।  
 भासिक दंड कह्यो तेहने,  
 निशीथ रे खांच में उहेयो रे ॥ ति. ॥ १० ॥  
 खांधै पद्मा परेच कनात ने,  
 वक्ते चन्द्रवासिरक्षी ने ताठा रे ।

સાધુ અરથે કરાવૈ તે લોગવૈ,

જ્યાંરા જ્ઞાનદિક શુણુ નહાડો રે ॥ તિ. ॥ ૧૧ ॥  
થાપીતો થાનક લોગવૈ,

ત્યાં દ્વિયા મહાત્મન લાંગો રે ।

લાવૈ સાધું થી વેગલા,

ત્યાં ને શુણુ વિત જણૈ સાંગો રે ॥ તિ. ॥ ૧૨ ॥  
કાચ ચસમો વરજયો તે રાખયો.

વિન જણૈ છૈ હોષણ થોરા રે ।

પાંચમોં પ્રત પૂરો પડયો,

વધે જિલ્લુ આગન્યા ના ચોરા રે ॥ તિ. ॥ ૧૩ ॥  
ગૃહસ્થ આયો હેઠી મોટકા,

હાવ લાવ સું હરખિત હુવા રે ।

બિધાવણું ની કરૈ આમના,

તે સાધપણું થી જુવા રે ॥ તિ. ॥ ૧૪ ॥  
ગૃહસ્થ આયો સાધુ તેડવા,

કપડો વર્હિરાવણું લધ જવૈ રે ॥

ઇણવિધ વહિરૈ તેહ મેં,

ચારિત કિણુ વિધ પાવૈ રે ॥ તિ. ॥ ૧૫ ॥  
સાહમો આણ્યો લે જવૈ તેડિયા

એ હોષણુ હેતું ભારી રે ।

યાંને ટાકૈ કેડાયત વીરના.

સેણ્યાં નહીં સાધ આચારી રે ॥ તિ. ॥ ૧૬ ॥  
ધોવણુદિક મેં લીલોવરી,

જીવાં સહિત કણ બિના રે ।

એહવા વહિરે શાંકે નહીં,

તે પરબ્રહ્મ સું નહીં બિહુના રે ॥ તિ. ॥૧૭॥  
એહવો અન્ન પાણી લોગવ,

ત્યાંને સાધુ કિમ થાપીજૈ રે ।

એ સુતર ને જાચો કરે.

ત્યાંને ચોરા રી પાંત મેં આપીજે રે ॥ તિ. ॥૧૮॥  
ગૃહસ્થ ના સનાય ખોલ ચોકડા,

સાધુ લિખૈ તો હોષણુ લાગે રે ॥ તિ. ॥૧૯॥  
વિખાયને અણુમોહિયાં,

હોય કરણુ ઉપરતા બાગૈ રે ॥ તિ. ॥૧૯॥  
પહિલે કરણુ લિખ્યા મેં પાપ છૈ,

નો લિખ્યા હોષણુ ઉધારો રે ।  
પાંચ મહાવત મૂલગા,

ત્યાં સંબ્રદ્ધાં મેં પસ્યા બધારો રે ॥ તિ. ॥૨૦॥  
ઉપધ લોતાવે ગૃહસ્થને,

ઓ નહીં સાધુ આચારો રે ।

પ્રવચન ન્યાય ન માનિયે,

લિયો મુગત સું મારગ ન્યારો રે ॥ તિ. ॥૨૧॥

ગૃહસ્થ ઉપધરા કરે જાણતા,

કિયા વરત અકસુરો રે ।

સેવગ હુવા સંસારિના,

સાધુપણું થી હુરો રે ॥ તિ. ॥૨૨॥

સાતા પૂછૈ પૂછાવ ગૃહસ્થ રી,

ઇત્ત્રત સેવણ લાગા રે ।

અષ્ટુચારી કલ્યો દશવૈકાલિકે,

વહે પાંચુણી મહાપ્રત ભાગા રે ॥ તિ. ॥ ૧૨૩॥  
શ્રાવક ને વહે શ્રાવિકા,  
કરે માંડોમાંછી કારજ રે ।

સાતા પૂછૈ વિનેા વૈયાવચ કરે,

તિણુ મેં ધર્મ પુરૂપૈ અનારજ રે ॥ તિ. ॥ ૧૨૪॥  
અષ્ટુચાર પૂરા નહીં ઓલખ્યા,

નવ ભાંગા કિણુ કિધ ટાલે રે ।

ગૃહસ્થ ને સિખાવે સેવના.

લીધા પ્રત નહીં સંભાવે રે ॥ તિ. ॥ ૨૫॥

કારણુ પહિયાં દેણો કહે સાધને,

કરે અસુધ વહિરણુ થી થાપો રે ।

દાતાર ને કહૈ નિજં રા ધણી,

વહી થોડો બતાવે પાપો રે ॥ તિ. ॥ ૨૬॥

એહવી ઉંઘી કરે પરપણાં,

ધણુ જીવ ને ઉલટા નાખે રે ।

અષ્ટુ વિચારી ભાષા ઓલતાં,

ભારી કર્મ જીવ ન શાંકે રે ॥ તિ. ॥ ૨૭॥

બિંઠ આચાર રી કરે થાપના,

કહે હુખમ કાલો રે ।

હિવડાં આચાર છૈ એહવો,

ધણુ દોષણ રો ન હુવૈ ટાલો રે ॥ તિ. ॥ ૨૮॥

એક પોતો તો પાલે નહીં,

વહે પાલે તિણુ સું દ્રેષો રે ।

દોય સુરખ કહ્યા તેહને,  
 પહુંલો આચારાંગ હેણો રે ॥ તિ. ॥ ૨૬ ॥  
 પાટ બાનેટ આણૈ અહૃસ્થ રા,  
 પાછા દેવણ રી નહોં નીતો રે ।  
 મરજદા લોપને લોગવૈ,  
 તિણુ છોડી જિણુધર્મ રી રીતો રે ॥ તિ. ॥ ૩૦ ॥  
 તિણુને દંડ કહ્યો એક માસનો,  
 નિરીથ રે ઉહેશૌ ભીજૈ રે ।  
 ન્યાય મારગ પડ્યપતાં,  
 ભારી કરમા સુષુ સુષુ ભીજૈ રે ॥ તિ. ॥ ૩૧ ॥  
 ॥ ઈતિ સાધુના આચાર સમ્પૂર્ણ ॥

નવકડાની શ્રી સડાનથીથ, સુત્ર ની ૬:૩  
 દોહરો

ફક્ષમ આરે પાંચમે, ધર્મી ગથડબથડ જાન  
 તેમાં લેષ ધારી થશે ધણા, કુડકપટની ખાન ॥૧॥  
 તે કુણુદ્ધિ ધર્મી ચલાવશે, આ સાધુના વેષમાય  
 વળી હિસા ધર્મ પડ્યપશે, પડશે નરકમાં જાય ॥૨॥  
 તેના લોગા શાબક શાવીકા, તેઓ કરે એ ટી પક્ષપાત  
 તેને કુણુદ્ધિ કદાગરો શાખવી, તેને પણ લઈ  
 જશે આય ॥૩॥

તેને અંધ કુવામાં નાંખશો, તેને દિવસ તેવીજ રાત  
ધુવડ જેવા થઈ રહ્યા, હીન હીન વીરોષ મીથયાત ॥૪॥  
તે નવ આંકના નવકડા, જશો નરક મજાર  
શ્રી મહાન શીથમાં સુષ્યા, તે સાંલળો વિસ્તાર ॥૫॥

ઢાંડ

આચારજ ને સાધુ સાધવી, વહી શ્રાવક શ્રાવીકા,  
જાણો રે  
ગુણુ વગર નામ ધરાવીને, નરક જશો તેનો  
પરમાણો રે ॥૬૦૭ વીધ ઓદાઓ નવકડા ॥૬॥  
પંચાવન કરોડ લાખ પંચાવન, વળી પંચાવન  
હારો રે  
પાંચસો પંચાવન ઉપરે, આચારજ જશો નરક  
મજારો રે ॥૬૦૮ ॥૧૧॥

છાસેંડ કરોડ લાખ છાસેંડ, વળી છાસેંડ હારો રે  
છસો છાસેંડ ઉપરે, સાધુ જશો નરક મજારો રે  
॥૬૦૯ ॥૧૨॥

સી-તો-તેર કરોડ લાખ સી-તો-તેર, વળી સી-તોતેર  
હારો રે  
સાતસે સી-તોતેર ઉપરે, સાધવી જશો નરક  
મજારો રે ॥૬૧૦ ॥૧૩॥

અઠયાસી કરોડ લાખ અઠયાસી, વળી અઠયાસી  
હારો રે  
આઠસો અઠયાસી ઉપરે, શ્રાવક જશો નરક  
મજારો રે ॥૬૧૧ ॥૧૪॥

નવાણું કરોડ લાખ નવાણું, વળી નવાણુ હુઅરો રે  
નવસો નવાણુ ઉપરે, શ્રાવીકા જશો નરક મજારો રે

॥ એ૦ ॥૬॥

આચારજ સાધુ સાધવા, પદ્ધતીધર કહેવાય મહોટા રે  
તે નરકે જશો આ વૈષમાં, તેના લક્ષણુ ધણુા  
છે ખોટા રે ॥ ॥ એ૦ ॥૭॥

તે ભ્રષ્ટ થયાં આચારથી, વળી શ્રદ્ધામાં સુળ  
મીથ્યાત્વીરે  
ઘેરે વેશ સાધુતણો, પણ છે ચણુાના છેતરાના  
સાથી રે ॥ ॥ એ૦ ॥૮॥

ખાઈ પી દીવસે સુખે સુધ રહે, વળી શરીરમાં  
અન્યા છે આડા રે  
ગોચરી વિહાર કરે ત્યારે, જણે રાજ્યના કુંદતા।  
ઘોડા હોડયા રે ॥ ॥ એ૦ ॥૯॥

તે તો ફરતા વચન ઓલે ધણુા, વળી કુદકપટમાં  
રાચે રે  
ચર્ચા કરે તે અવસરે, જણે નાગાઓધાડા નાચે રે  
॥ ॥ એ૦ ॥૧૦॥

ન્યાય નિષ્ઠુર્ય કર્યાવિના, કરી રહતા ફેલ દીતુરા રે  
બેને સુત્રની ચર્ચા કરે તો, હગલે હગલે પડભય  
કુરારે ॥ ॥ એ૦ ॥૧૧॥

કુદકપટ કરે મત રાખવા, તે તો પેટ ભરાઈ કાજે રે  
આચારમાં દીકા ધણુા, તો પણ નિર્બજ સુળન  
લાજે રે ॥ ॥ એ૦ ॥ ૧૨॥

તે સાધુનામ ધરાવીને, ઠામ ઠામ અપસરા  
 થાનક કરાવે રે  
 તે ઉપદેશ ઈ ઈપ લારાંધીને, છકાય જીવ  
 મરાવે રે ॥ એ૦ ॥૧૩॥  
 સાધુ માટે કરાવેલા લોગવે, વળી વેષ સાધુનો  
 ધરીયો રે  
 છ કાયાના જીવો મરાવતા, પીયર નામ પુરે  
 પરીયો રે ॥ એ૦ ॥૧૪॥  
 પડહા પરૈચ બંધાવતા, ચંદ્રવા પુઠીયા ને ટાટારે  
 વળી છાપરા લીપણુ કરાવતા, તેના જ્ઞાનાદીક  
 ગુણ નાથારે ॥ એ૦ ॥૧૫॥  
 એમ અપાથરાથાનક કારણે, જીવ મરાવે વારંવારારે  
 એવા અપશરા થાનક સાધુ લોગવે, તે બય  
 જન્મ ધીગારારે ॥ એ૦ ॥૧૬॥  
 સાધુ થઈ ઉદ્દેશીક લોગવે, વળી વેચાતો લેનરાવે  
 આહારારે  
 નીત્ય પીડ વહેારે એક ઘેરથી, તે જશે નરક  
 મજારારે ॥ એ૦ ॥૧૭॥  
 શ્રી ઉત્તરાધ્યેયન વીશમે, વીરના વચન સંભાવોરે  
 જે ઉદ્દેસીકાદીક લોગવે, તે નિશ્ચય જશે નરક  
 મજારારે ॥ એ૦ ॥૧૮॥  
 ધી, ખાંડ, લાડુ, શાકર વેચાતા લે, ભરી મુકે ચાડારે  
 તે વહેરાવે સાધુને, તે ગર્ભમાં આવશે આડારે  
 ॥ એ૦ ॥ ૧૯॥

ધી, ખાંડ, લાણુ, ચાકર વેચાતા લીધેવા જણ્ણોરે  
જણી સાધુ કહેવાય આ બોડેમાં, તે તો પુરા  
મુઢ અંજળ્ણોરે ॥ એ૦॥ ૨૦॥

એ ચેડો થતો હોય આપણો, તે તેને રાકડ  
ઝીપીયા અપાવે  
પાંચમો મહાત્રત લાંગીને, સાધુનો નામ ધરાવે  
॥ એ૦॥ ૨૧॥

લુલાદીક જણ્ણે નહી, તેને પાંચ મહાત્રત ઉચરાવેરે  
સાધુનો વેષ પહેરાવીને, લોળા બોડેને પગે  
લગાવેરે ॥ એ૦॥ ૨૨॥

ખાળક ખુઢો જુદે નહી, કે આવે તેને મુડેરે  
નામદારી કરવા કારણે તે તો માન મોદાઈમાં  
યુડેરે ॥ એ૦॥ ૨૩॥

જણી ચેડો કરવા કારણે, માંહેમાંહે લડાઈ માંડેરે,  
કૃડા તોડા કરતા લાગે નહી, આ સાધુના  
વેષને લાંડેરે ॥ એ૦॥ ૨૪॥

જામ નગર સામાચાર મોકલવા, ઈશારા કરે  
અહુસ્થને ઓદાવેરે  
કાગળ લખાવે તેની કને, વીગત પોતે બતાવેરે ॥ એ૦॥ ૨૫॥  
અહુસ્થને પાશે વયાવચ્ચ કરાવીઆ, સાધુને કદ્યો  
અલ્યુચારોરે  
શ્રીદશનૈકાલીક નોળ અધ્યયન, કોઈ ભુધ્યીવાન  
કરનો વીચારોરે ॥ એ૦॥ ૨૬॥

બાળવ તુટલ તેમાં ધણ્ણા, તેનો કોણુ કાઢે નીક. લોરે  
 એ થોડા તેને છેડીયા, હેવે અણુહુતા આગોરે ॥ એ૦ ॥૨૭॥  
 ચોતા જેવા કરવા માટે, ઉલયા હે ખોટા આગોરે  
 તેને પરલબની શ્રીકર નહીં, તેને જુઠનો નહીં  
 દાગોરે ॥ એ૦ ॥૨૮॥  
 સુદ્ધ સાધુને માથે આળદે, તેના ટોળામાં  
 કહેવાય સપુતોરે  
 તે જુઠનો નિરણ્ણા કરે નહીં, તે નરક જવાના  
 સુતોરે ॥ એ૦ ॥૨૯॥  
 જુઠા આળદે તેહને, પાયશ્રિત ન હે તે લગારોરે  
 તેની સાથે આહાર પાણી લેગા કરે, તે દુણી  
 ગયા કાલી ધારોરે ॥ એ૦ ॥૩૦॥  
 રેણુદેવાની કુગુરને ઓપમાં, તે સાંલલજ્યો  
 ચીત લાયોરે  
 કુડ કપટ કરી પાપીયા, સુદ્ધ સાધુથી ભડ  
 કાયોરે ॥ એ૦ ॥૩૧॥  
 રેણુદેવી દક્ષિણા બાગમાં, અણુહુતો સરપ  
 બતાંયો રે  
 તેમ પોતાના કૃતન્ય ઢાંકવા, તે ઓલે છે  
 મુસાવાયો રે ॥ એ૦ ॥૩૨॥  
 તેણે જુનરીખ ને જુનપાવ ને, ધાલી શાંકા  
 મોટી રે  
 રેણુ ખુદ્ધીવંત જઈને જોઈયો. ત્યાં જાણી  
 રેણુદેવીને ઓટી રે ॥ એ૦ ॥૩૩॥

તેમ કુશુર રેણુાહેવી સરખા, શંકા સાધુની ખાલેરે  
 તે પોતાનાં કૃતય હાંકવા, શુદ્ધ સાધુ પાશે  
 જતાં વારે રે ॥ એ૦ ॥૩૪॥  
 પણ ખુદ્ધીવંતે પુષ્ટી નષ્ટુંય કર્યો, ત્યારે જાણી  
 લીધા તેને ખોટા રે  
 જાન કીયામાં ખોટ ઘણી, જાણે પાણી  
 તણું પરપોટારે ॥ એ૦ ॥૩૫॥  
 તે રેણુાહેવી સામુ જ્વેઠને, અનરીખ થયો ખુવારારે  
 તેમ કુશુરની પ્રતીતથી, હુર્ગતી જશો મનુષ્ય  
 ભજ હારો રે ॥ એ૦ ॥૩૬॥  
 રેણુાહેવીના કૃપટથી ઘણો, કુશુરનો કૃપટ છે  
 જારી રે  
 ચોતે દુષે બીજને દુખાવે, કોઈ થઈ જય  
 અનંત સંસારી રે ॥ એ૦ ॥૩૭॥  
 ચેખ પહેરી સાધુ તણો, ખાંધા લોકોના માલો રે  
 જ્ય ત્ય ઢીરીયા વગરના સાધુ, જની રહ્યા  
 કુદા લાલો રે ॥ એ૦ ॥૩૮॥  
 એમ ચાંખલ નર નારીઓ, છોડી હો કુશુર  
 સત્તાખોરે  
 સુધ સાધુની સેવા કરો, જો રાખવા ચાહો  
 હજજતને આયોરે ॥ એ૦ ॥૩૯॥  
 ચંચત અઠારસે ને ત્રેતીય, જોઠ સુદ પુનમ  
 શુકુર વારો રે  
 કણી છે કુશુરાની નવકરી, સીજા જામ મગારો રે  
 ॥ એ૦ ॥૪૦॥

જુના, વીર શાશન તા. ૧૮૮ ડીસેમ્બર ૧૯૭૬  
પાનુ-૧૪૩ લખનાર શ્રી પદ્મવિજયજી મહારાજ  
કૃમાવે છે કે

ખાવત પીવત મોશ ને માને  
તે સરદાર સહુ જટમાં

અર્થાત=ખાવા પીવામાં જે મોશ માને તે મુખ્યાઓમાં  
સરદાર છે.

વધુ માટે જીવો જૈન સાધુ ચોપડી.

### નવકરી

હુઃખમ આરે પાંચમે, શ્રાવક શ્રાવીકા નામ બરાય  
ગુણુ વગર ખાલી ઠીકરા. પડશે નરકમાં જય ॥૧॥  
તો પણ અખુચારી કુગુરુ તણી, સેવા કરે હીનરાત  
તે જીવા ને સાચા કરવા લણી, ઓટી કરેપક્ષપાત ॥૨॥  
તે જન્માંધળાં ને સુલ સુઝે નહી, નગમે ન્યાય  
મારગની વાત  
પાખંડ મતમાં રામી રહ્યા, ઘર માંડે ઘોર  
મીધ્યાત ॥૩॥

નોયા ને અણનોયા કહે, શુદ્ધ ઐલતા ન આણે શાંક  
આળ દેવામાં આળશ નહી, તેની ઐલીમા છે વંક ॥૪॥  
એહવા શ્રાવક જશે નરકમાં, તેના લક્ષણુ  
આરિન્દ અનેક  
તે થોડા એક પ્રગટ કરુ, તે સાંસળો રાખી વીવેક ॥૫॥

દાદ ( રે જીવ મોહ અનુકંપા ન આણ્ણીએ )

નવ નવ આંકના કુગુર નવકરા, તે તો જથે  
નરક મજારો રે  
તેના શ્રાવક શાવીકા તણોા, સાંલલન્યો વીસ્તારો રે ॥૧૧॥

ઓહવા શ્રાવક જણોા નવકડા

પહેલા તો મારગ બુદ્ધા મોક્ષનો, ગુર માટે  
હણો છે જીવ રે  
વળી ધૂમે જણો હુંસા કીધા, તેને દીધી નરકની  
નીર રે ॥ એ૦ ॥૧૨॥

પડતો જણો થાનક અપાશરા શુર તણોા, તેની  
જઈ કરે સંભાલ રે  
લીલોતરી ઉખેડ ઉપર નાંખે માંટીને, કરે અનંત  
જીવનો અંગાવરે ॥ એ૦ ॥૧૩॥

પીલો પાણી તણું જીવ મારીને, દડે લીધે થાનક  
અપાશરા જાયરે  
તે પણુ કુગુર માટે નીશંકથી, એ તો માર  
રહ્યા જીવ છકાયરે ॥ એ૦ ॥૧૪॥

કોઈ કરાવે થાનક અપાશરા મુળથી, પાયાથી  
નવી જગ્યા ચણુાયરે  
વળી જીવ વીજુાશે નિધનીધે, તે કણોા કયાં  
લગ જાયરે ॥ એ૦ ॥૧૫॥

આમ ગામંથી પૃથ્વી મંગાવતા, કુવે કુવેથી  
પાણી મંગાયરે

કરે ધમશાણુ કુટો છકાયનો, મનગમતા થાનક  
 અપાશરા કરાયરે ॥ એ૦ ॥૬૬॥  
 કોઈ કરે મળુરી હાથથી, ઉંડી ઉંડી ઐદાવે નીવરે  
 ધરનો પૈસો ખર્ચી પાપીથા, છકાયના મરાવે  
 . લુધરે ॥ એ૦ ॥૭૭॥  
 છકાય હણ્ણીને થાનક અપાશરા કરે, તેમાં ધર્મ  
 જણે નીશાંકરે  
 તેથી ઠામ ઠામ જગ્યા ખાંધે, એહવા લાઘ્યા  
 કુગુરના ઠંકરે ॥ એ૦ ॥૮૮॥  
 તેને પુછ્યા કોઈ આલે પાધરા, કોઈ ઝુંઝુ આલે  
 તતકાલ રે.  
 શ્રાવક માટે થાનક કરાયો કહે, અનાખી થકા  
 લાખે અલાલ રે ॥ એ૦ ॥૯૬॥  
 પુન કરાયો શુરૂ કારણે, લાજે મરતાં ખાંચે આપરે  
 ધર્મને ઠેકાણે ઝુંઝુ આલીને, લારી હુવે ચીકણું  
 ખાંધે પાપરે ॥ એ૦ ॥૧૦૦॥  
 ધર્મ ઠેકાણે ઝુંઝુ આલીચા, ખાંધે મહામોહની કર્મરે  
 ચીતોર ડોડા ડોડી સાગર લગી, નહી પામે લુન  
 વર ધર્મ રે ॥ એ૦ ॥૧૧॥  
 જેમ કોઈની મા બહેન ડાકણુ હુવે, તેની વાત  
 સાંલજ્યા પામે ખીજરે  
 તેને સાચી કરવા કોશીશ કરે ધણ્ણી, ઝુડા થકા  
 પણ થપે ધીજરે ॥ એ૦ ॥૧૨॥

વળી અનેક ઉપાય કરે ધણ્ણા, ધર જણો! પણ  
 કરે કણુલરે  
 પણ મોઢેથી ડાકણુ કહેવી હોહુલી, ધણ્ણા હુંઘ  
 થાય ભુડા કસુત ॥ એ૦ ॥૧૩॥  
 તેમ લારી ડર્મા કેઠ જીવડા, ઓલે કુગુર  
 માટે જુઠરે  
 અને સાચા કરવા કેશીશ કરે ધણ્ણી, ઓટા ગુણ  
 કરે પરપુઠરે ॥ એ૦ ॥૧૪॥  
 અનંત સંસારથી હરે નહીં, નરકે જવાનુ પણ  
 કરે કણુલરે  
 પણ મોઢેથી ઓટા કહેવા હોહીલા, રહ્યા યાંખંડ  
 મતમાં જુદરે ॥ એ૦ ॥૧૫॥  
 ડાકણુને બદલે ધીજ કરતા થકા, કહાચ રાજા  
 હોખ્યા ધર જાયરે  
 તેમ કુગુર માટે જુઠ ઓલીયા, પડે નરક  
 નીગોદમાં જાયરે ॥ એ૦ ॥૧૬॥  
 ચોતે આદરિયાં વેણુ કુગુર તણ્ણા, હેવે હોખણુ  
 સધલા ટાંકરે  
 શુદ્ધ સાધુને આળ હેતા થકા, પાપી સુલ ન  
 લાવે શાંકરે ॥ એ૦ ॥૧૭॥  
 શુદ્ધ સાધુની નીંદા કરીને, વળી નજરે જ્વેયા  
 જગે દ્રેષ્પરે  
 તેથી વરતે વેરીને શોઠ જેમ, જુવે વળી છીર  
 વીશોષરે ॥ એ૦ ॥૧૮॥

ચેતે કંગુરને પાકા ખારીયા, તેમાં દોષનો છેહ  
 ન પાર રે  
 તેથી સાધુના દોષ જોવતાં, અપકર રહ્યા મુશ  
 ગમાર રે ॥૩૬૦ ॥૧૯૬॥  
 પણ સાધુના દોષ જુવે નહીં, ત્યારે ઓટા હેવે  
 આળ રે  
 અછી ઝુદુ એલી બકતા કરે, તેનો કોણુ કાઢે  
 નીકાલ રે ॥૩૭૦ ॥૨૦૧॥  
 કડવો તુખડો વહેરાર્યો સાધુસે, નાગશ્રી આલાણી  
 એકવાર રે  
 તેથી રખડી જંસારમાં ઘણી, સાતે નરકમાં ખાધી  
 માર રે ॥૩૮૦ ॥૨૧૧॥  
 તેને નાંખવાના આળશથી, તુખડો વહેરાર્યો  
 સાધુને દેખ રે  
 તેના ઝળ મજ્યા કડવા, પામી હુઃખમાં હુઃખ  
 વીશેષ રે ॥૩૯૦ ॥૨૨૧॥  
 તો સાધુની કોઈ નીંદા કરે, વળી રાખે અલ્યાંતર  
 દેખ રે  
 અછતા આળ હે નિશાંકથી, તે તો કુણે વળી  
 વીશેષ રે ॥૪૦૦ ॥૨૩૧॥  
 કોઈ કરડુ એલે એટી રીતથી, કોઈ વંછે  
 સાધુની ઘાત રે  
 કોઈ પરિસાહ હેવે વચ્ચના, કોઈ તપતા રહે  
 દીન રાત રે ॥૪૧૦ ॥૨૪૧॥

સર્વ પાખંડી મળી ગયા, વળી લોકોને હેવે  
 લગાય રે  
 તેને મનગમતા એલે ધણા, સાધુના વેરી કરવા  
 તાથ રે ॥૩૦ ॥૨૫॥  
 એવી નાગશ્રી થઈ ધણી જુરી, તેનો કહેતા ન  
 આવે અંત રે  
 તે તો નરકમાભી છે નવકડા, તેને ઓલખન્દે  
 બુદ્ધિવંત રે ॥૩૦ ॥૨૬॥  
 નાગશ્રી પ્રાણણી દુઃખ લોગવી, મહામુર્ખકેલીએ  
 પાભી અંતરે  
 સાધાવેરીની માર્ક વરતે સાધુથી, તેનો શું થશે  
 વીરતંત રે ॥૩૦ ॥૨૭॥  
 હેવે કહી કહીને કેટલો કહું, કોઈ બુદ્ધિવંત  
 કરન્દે વિચાર રે  
 જો જો સાધુને માથે અણ હે, તે તો દુષ્યા  
 કાળી ધાર રે ॥૩૦ ॥૨૮॥  
 જો સાચાને સાચું કહે, તે તો નિંદા ન જણો  
 કાય રે  
 સાચીને સાચી કહેની નીશંકથી, તે પણ અવશર  
 જેય રે ॥૩૦ ॥૨૯॥  
 એ તો જીવ અજીવ જણો નહી, આશ્રવ સંવરની  
 અભર ન કાય રે  
 આશ્રવ સેવે સંવર ધર્મ જણીને, એ તો ખુલ્લવા  
 જુદ્યા જાય રે ॥૩૦ ॥૩૦॥

રૂપલોગ પરીલોગ શ્રાવક તણુા, તે તેઠા અવત  
 આશ્રમ માંહી રે  
 સેવાસેવરાયા બદ્લો બાળીયા, તેમાં ધર્મં  
 જણે છે તાંહી રે ॥૩૧॥  
 હેવ, ગુરુ, ઓદાખયા વીના, રદ્ધા ખાડી વાદલ  
 જેમ ગાજ રે  
 વળી ધેરી થઈ એઠા ધર્મના, પણુ પૂરા મુઢ  
 અખુંજ રે ॥૩૨॥  
 વળી ચરચામાં અટકે ધણુા, પણુ સીધા ન  
 ઓદે મૂઢ રે  
 અણુ વીચાર્યો ઉધા ઓદે ધણુા, પણુ છોડે નહીં  
 ઓઠી ઝન રે ॥૩૩॥  
 વળી કુશુરનો આચાર જણે નહીં, સરધાની  
 પણુ અખર ન કાય રે  
 સેષધારી ભાગલ તુટલ જણી, ત્રીજુતો કરી વાંદે  
 પાય રે ॥૩૪॥  
 ધી, ખાંડ, ગોળ, શાકર, આદી હે, મોલ લેવરાવે  
 જણુ રે  
 વળી નીપજ્યો જણે વત ખારમે, એવા મુઢ  
 અયાણુ રે ॥૩૫॥  
 ખારમે વત ભાગે આપરો, સાધુને વહેરાવે લૈ  
 મોલ રે  
 તેની પણુ સમજ પડે નહીં, તેના વતમાં છે  
 ચોઠી પેંબ રે ॥૩૬॥

થાનક અપાશરા વેચાતા લે શુરૂ કારણે, વળી  
 ભાડે લે શુરૂ કાજરે  
 આરમુ પ્રત ભાંગી લાગલ થયા, નરકમાં જશે  
 શ્રાવક વાજ રે ॥૩૬૦ ॥૩૭૧॥  
 કષ્પડા ભાંગે સાખુ સાધવી, ત્યારે હાજર ન હોય  
 ધરમાંય રે  
 વેચાતું લૈ વહેરાવે સાધુને, ગામ પરગામથી  
 મંગાય રે ॥૩૬૦ ॥૩૮૧॥  
 વેચાતું લાવી કષ્પડું વહેરાવીને, વળી ધર્મ જણે  
 મનમાંય રે  
 ઓહવી અદ્ધાના શ્રાવક શ્રાવીકા ફુગંતી પડશે તે  
 તો જાય રે ॥૩૬૦ ॥૩૯૧॥  
 જમણુવાર આરા તણે ધરે, માંડ ધોાવણુ ઉનો  
 પાણી જણ્ણ રે  
 તે સાધુને વહેરાવવા કારણે, પોતાને ઘેર રાખે  
 આણુ રે ॥૩૬૦ ॥૪૦૧॥  
 પછી તેડી વહેરાવે સાધુને, વળી જણે  
 થયો મને ધર્મ રે  
 ઓહવા કુશુરના ભરમાવીયા, ભુલા છે અજાની  
 ભર્મ રે ॥૩૬૦ ॥૪૧૧॥  
 કોઈ ધોાવણુ જાણી વધારે કરે, સાધુને વહેરાવવા  
 કામ રે  
 ઉનો પાણી ઠારે વાસણુ ભરભર, તે પણ લૈ  
 કુશુરનો નામ રે ॥૩૬૦ ॥૪૨૧॥

ઘણુા સાધું સાધવી જાણીને, વધારે નીપજાવે  
 આહાર રે  
 પછી ભર ભર વહેરાવે પાતરાં, તે તો ભવ ભવમાં  
 થશે ખુવાર રે ॥૪૦ ॥૪૩॥

અશુદ્ધ આહાર પાણી વહેરાવીઆ, વધે પાપ  
 કર્મના ખુર રે  
 સાધુ પણ જાણી વહેરાવે અસુઅતો, તે તો  
 સાધપણુથી હુર રે ॥૪૦ ॥૪૪॥

કોઈ આહાર વહેરાવે અસુઅતો, કોઈ કપડુ  
 વહેરાવે અશુદ્ધ રે  
 હેવે થાનક અપાશરેા અસુઅતો, ભ્રષ્ટ થયી બધાની  
 ખુદ્ધ રે ॥૪૦ ॥૪૫॥

સામાયક સંવર પોષા મજે, કરે સાવદ્ધનેગના ત્યાગરે  
 તેમાં પણ ભાંગલને વંડણુા કરે, સામાયક પોષા  
 પણ ગયા ભાંગ રે ॥૪૦ ॥૪૬॥

એક સામાયક ભાંગે તેહને, દંડ હેવે થામાયક  
 અગ્યાર રે  
 તો નીત્ય સામાયક ભાંગે, તે તો ગયા જન્મારેા  
 હાર રે ॥૪૦ ॥૪૭॥

શુચ ન લે તેને પાપી કદ્યો, લૈને ભાંગે તે  
 મહા પાપી હોય રે  
 વળી જાણું હું શ્રાવક મોટો, તેને નરક તણી  
 ગતી જોય રે ॥૪૦ ॥૪૮॥

માને ભાગલ તુટલ એકલ ભણી, વીનતી કરી  
 રાખે ચોમાસ રે  
 તે પણ સાધુથી દ્રેષ ના ઘાલીયા, વખાણુ સાંભળે  
 તેની પાશ રે ॥૪૬॥  
 જે તે સાધુના અવગુણુ બોલે ઘણુા, તેને હરખથી  
 દેવે દાન રે  
 વળી પ્રશંસા કરે તેહની, ઘણુા આપે આદર  
 સન્માન રે ॥૪૭॥  
 તેને મનમાં તો સાધુ જણું નહીં, તો પણ વધારે  
 તેનો આખ રે  
 તે પણ વાત ચલાવવા, તેનો નિશ્ચય જણો  
 અભાગ રે ॥૪૮॥  
 ચોતે આદર્યો કુશુર તેહના, શુણુ બોલાવવા કામરે  
 તે પણ લોભના ભારીયા, જુડી જુઢી કરે શુણુ  
 આમ રે ॥૪૯॥  
 એવા ચાળા ચારીત્ર કરે તેહને, જે પાપ ઉદે  
 થાય આ લવ આણુ રે  
 દુઃખ અશાતા અપજરા થાય ઘણી, પરલસવમાં  
 તો શંકા નહીં જણુ રે ॥૫૦॥  
 ભાગલના વખાણુવાણી સુણ્ણા, કોઈ પણ વજે  
 વેગો મીથ્યાત રે  
 વળી તહુત વચન કરે તેહનો, તેના હુકારે મોતી  
 વાત રે ॥૫૧॥

જેને કુગુરુથી રાગ અતી ધણો, વળી શુદ્ધ સાધુથી  
અત્યંત દ્વેષ રે  
બાંને બાળુ હેવાણુ લેહને, તે તે હુણ્યા છે  
વીશેષ રે ॥૪૦ ॥૫૫॥

કરડો દંક લાગે કુગુર તણો, તેથી કરે જેની  
પ્રક્ષ પાત રે  
તેની લીધી ટેક છોડ નહી, તેના ઘરમાં મેઠો  
મીથ્યાત રે ॥૪૦ ॥૫૬॥

સંવત અઠારને તેત્રીશીમાં, અષાઢ વદ નવમી  
રવીવાર રે  
આવક નરક ગામી છે નવકડા, જેડી રીયા  
ગામ મજાર રે ॥૪૦ ॥૫૭॥

### કુપાત્ર તથા અપાત્રનો પરિહાર

વર્ષ ૧૧ અંક ૨૨-૨૩ શા. ૧૯૬૬ ફાગુણ સુદ  
૧૨ શુક્રવાર તા. ૨૧=૩-૧૯૪૦ પ્રવચનકાર શ્રીમદ  
વિજય રામચંદ્રસુરીશ્વરજી મહારાજ.

મોક્ષ ઈકડ દાન માટે કુપાત્ર તથા અપાત્રનો  
પરિહાર કરવાનો છે.



# જૈન ધર્માં આગ્યાભાળુ

હેશ માળવા ગામ બરનગરમા અનાવનાર શ્રી ૧૦૮ શ્રી તુલશીરામજી સ્વામી હાત શ્રી ૧૦૦૮ શ્રી તુલશીશુરીજી મહારાજ જન્મ ૧૯૭૧ દીક્ષા ૧૯૮૨ સુરી પદ શાં ૧૯૯૩ આશરે મુનીરાજ, ૧૫૮ મહાસનીજી ઉંડુ કુલથાળુ પદપ ને “પંચેન્ની સમવરણું તહુનવવીય બંદ્વચર્યુ” ગુત્તીધરો, ચહવીહ કસાય મુકો એ અઠારસસ્ય શુણેહી સંજુ-તો, પંચ મહાવય જુતો, પંચવીહાયાર પાલષુ ખંમતો, પંચસમીઓતીકુ-તો એ છત્રીશ શુણે શુરૂમન્ન” મુજબ પોતે આચાર પાર્ગી બધાને પળાવે છે. ને આશરે થાણું પઠપ અખંડ આણું પાલતા વીચરે છે. તે દર્શાન કરવાથી અથવા દર્શાન કર્યા હોય તેને પૂછી આત્મી કરવી.

દોડ બહેડાન હેત, વાત યુ બનાય કહે  
તેરાપંથી દાન દ્વાયા, મુળશે ઉખાડ દી  
ગોવન કો ચાડો તામે, આગ કો લગાઈ નીચ  
તાકો કેચી ખોળો, તામે મનાઈ પોઢાર દી  
શુખે આરૂ ર્થાસે હીન, હોઢગુ હેવે દાન

તાડો ભત દેવો, એસી અંતરાય ડાર હી  
 તુલશી ભણુંત તાડો, તેરા પંથ ભતહુકીં  
 વાકથી ન પુરી ચુહી, કુડી ગપ માર હી ॥ ૧ ॥  
 એસી એસી વ્યથેં વાત, તાણુમત પક્ષપાત  
 કરતે હુંમેશ જાડી, બુઢી જો ધીગડ્ગૈ  
 તાડી સુણુવાત નહી, સાચ જુઠ જયકરે  
 લોકનમાં એક, લેહુતાણ પડ્ગૈ  
 એક લેદ ખોલે લ્યાં, હુળુપણ ખોલે લ્યાં  
 ગ્રીલ ઓાર ચોથી, સખ લાજ લાજ લડ્ગૈ  
 તુલશી ભણુંત સમજાવે, અખ કાંકો કાંકો  
 ચારેહી જહાન આતો, કુવે લાંગ પડ્ગૈ ॥ ૨ ॥

લીક્ષા લેન હેત, જો બૃહસ્થ ધરનત લીક્ષુ  
 આગે કોઈ રંક, લીક્ષા માંગત હીખાત હે  
 તાહી ઊલંઘ નહી, ધરમે પ્રવેશ કરે  
 મધ્ય જત તઃકો ચીત, અંતર હુઃખાત હે  
 એતી અંતરાય ભી, ન કરે સુનીરાજ તાપે  
 તો મના કરના તો, એક મોટીશી વાત હે  
 તુલશી ભણુંત અંત, તંતકો વીચારે એસે  
 જોઈ છલ્લુકાળ પ્રલુ, તેરાપંથ પાત હે ॥ ૩ ॥

વાડો કોજી ખોલે તાડો, કરત મનાઈ કોઈ  
 વો સાધુના કસાઈ, સેલી નીચ કહુલાતહે  
 સ્વેચ્છા નીજ ગેહુહી, લુટાવે સખ લોકનકુ  
 તેરાપંથી કોજી તહાં, આડો નહી આતહે

યત્ત વે કુપાત્ર એક, માત્રનો ન કરે  
તામે એત્ત અર્જુભર, સેઃ અંતર બતાતહે  
તુલશી લખુંત અંત, તંત કે વીચારે એસે  
સોહી ધિલુકાગ પ્રભુ, તેરાપથ્ય પાનહે ॥૪॥

### શ્રોકનું આશરે બનાવેલું ગુજરાતી

લોકને બહેકાવવા માટે, વાત કહે બનાવી એમ  
તેરાપથ્યી દાન હ્યા, સુણથી ઉખાડે એમ  
આયોનો વાડો જે હોય, તેમાં આગ લગાવે કોઈ  
નેને જધ જોવે કોઈ, તેમાં મનાધ પોકાર દીધ  
ભુખાં તરસ્યા હુઃખી દીન, તેને દાન આપે જે કોઈ  
તો તેને નહિ આપો કોઈ, એવી અંતરાય નાંખ દીધ  
તુલશી લખુંત તેરાપથની, તેને પુરી સમજ નહીં  
જોથી આવે જોટી, લોકોમાં ગપ માર દીધ ૧

આવી જોટી વાતો સુણી, પક્ષપાત મત આણો કોઈ  
કરે છે આવી જોટી વાતો, જેની યુદ્ધી બગડ ગઈ  
આવી જોટી વાતો સંભળી, ડાહ્યા વિચારી જુઓ  
સાચ જુઠનો નીખુર્ય કરો, જોટી જેંચા તાણુનાં નહિ પડો  
લોકોમાં કહેવત છે એમ, ગાડર એક જોકે લેં જેમ  
બડકી ખીજા કરે એમ, સમજુઓ નહીં કરે તેમ  
તુલશી કહે છે એમ, સમજાવે હુવે કોને કોને  
આતો આખા દોડમાં, કુવે ભાંગ પડી ગઈ ૨

શીક્ષા લેવા ગૃહસ્થ ધરે, જાતે સાધુ ભય છે

જે લીખારી કોઈ ત્યાં, માંગતો હેખાય છે  
 તેને થાથ અંતરાય તેથી, ને ધરમાં પ્રવેશો નાહીં  
 જે સાધુભાય તે ધરમાંહી, હીલ લીખારીનું હુઃખાયે તાંહીં  
 આવી અંતરાય જે થાય, તે સમજુ મુળીને કલ્પે નાંહીં  
 તો આપવામાં કરે કેમ મનાઈ, સમજુઓ વિચારો તાંહીં  
 તુલશી કહુત આ, તત્ત્વને વિચારે જે  
 હે પ્રભુ આ કાળમાં, તેરાપંથી થાય છે તે ૩  
 વાડો જ્યદી એલે કોઈ, તેને સાધુ જે કરે મનાઈ  
 તે સાધુ સાધુ નહિ, પણ કસાધથી નીચ કહેવાય સહી  
 સ્વેચ્છાથી પોતાનું ધર, જગત માંહી લુટાવે કોઈ  
 તો તેરાપંથી તેમાં, આડો નહિ આવે કોઈ  
 પાત્ર કુપાત્ર એઉ, એક સરીખા ગણે નહિ  
 ઇકત શૈત્ર અશૈત્રનો, અંતર બતાવે શહી  
 તુળશી ભણુંત એમ, આ તત્ત્વને વિચારે તે  
 હે પ્રભુ આ કાળમાં, તેરાપંથ (તમારાપંથ) પામે છે ૪

## સમાપ્ત

---

‘શામીજુની ભાષા મારવાઈ છે તે  
સમજવા માત્રા જોડણી વ્યાકરણના  
અનણે ગુજરાતી ઉમંગથી છયું છે  
ભૂત હોય તે સુધારી વાંચવું. પ્રેસને  
લખવું. ફરી સુધારી છપાશો.’

---



